



રશિયાનો યુક્રેનના ચર્નિહિવ શહેર પર હુમલો, 22ના મોત

PAGE NO. 18

# સ્વાદેશ

પરદેશમાં દેશની મહેક એટલે

કેનેડાથી પ્રસિદ્ધ થતું સર્વોત્તમ ગુજરાતી સાપ્તાહિક SWADESH

**FOR BUYING, SELLING & LEASING**  
Investment In Real Estate Can Make Your Future Better...

**FOR SELLERS**  
Free Home Staging Consultation  
Professional Photography & Virtual Tour  
Attractive Advertisements  
Social Media Marketing  
Customized Feature Sheet  
Monthly Open House  
Assist in Mortgage & Legal Services

**FOR BUYERS**  
Years of Buying Mortgage Brokers  
Team of Lawyers  
Professional Home Inspectors  
Step by Step Guidance Through-out Buying Process

**AMIT SHAH**  
Sales Representative  
Tel: 416-996-0640  
amitshah@swadesh.com

**KOMAL SHAH**  
Sales Representative  
Tel: 416-424-8640  
komalshah@swadesh.com

HomeLink 2000@gmail.com  
Web: www.comishah.com

FRIDAY, 04 MARCH, 2022 Vol. 19, No. 09 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

## મંત્રણા માટે તૈયાર રશિયાએ યુક્રેન પર હુમલા ચાલુ રાખવા મક્કમતા દાખવી યુદ્ધ વિરામ સાથે લોકોને સુરક્ષિત કરવા યુક્રેનની માંગ

મોસ્કો

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે આઠમો દિવસ રહ્યો હતો. બીજા તબક્કાની મંત્રણા વચ્ચે રશિયા વધુને વધુ આક્રમક બની યુક્રેન પર અનેક તોપમારો કરી રહ્યું છે. રશિયન સેના દ્વારા યુક્રેનમાં ઓઈલ ડેપો, ત્રણ સ્કૂલો, રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જેમાં માસુમ બાળકો સહિત નિર્દોષ નાગરિકોના મોત નિપજ્યા છે. તો બીજી તરફ બેલારુસિયન ક્ષેત્રમાં રશિયન અને યુક્રેનિયન પ્રતિનિધિઓ વચ્ચે બીજા તબક્કાની સીદીધી વાતચીત ચાલી રહીય છે. ગુરુવારે રશિયન અધિકારીઓ સાથે વાટાઘાટોમાં યુક્રેનિયન વાટાઘાટકારો ઘેરાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે યુદ્ધ વિરામ અને માનવતાવાદી કોરિડોરની માંગ કરી હતી. કારણ કે મોસ્કોના આક્રમણ દળોએ યુક્રેનિયન શહેરોને ઘેરી લીધા હતા અને બોમ્બમારો કર્યો હતો.

બીજી તરફ રશિયાએ દરિયાઈ માર્ગે યુક્રેનને ઘેરવાની તૈયારી શરૂ કરી છે. બ્લેક સીમાં રશિયન નેવીની મોટી હિલચાલ જોવા મળી હતી. આવી સ્થિતિમાં યુક્રેનના રાષ્ટ્રપતિ લેન્સકીએ રશિયન સૈનિકોને જલદી યુક્રેન છોડવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે હું મારી જમીન તમારા મૃતદેહોથી ભરવા માંગતો નથી. દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું હતું કે મોસ્કો યુક્રેનમાં લડાઈ સમાપ્ત કરવા વાતચીત માટે તૈયાર છે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે યુક્રેનની સૈન્ય શક્તિને ખતમ કરવા માટે રશિયા પોતાનું અભિયાન ચાલુ રાખશે. રશિયન પ્રતિનિધિમંડળે આ સમાહની શરૂઆતમાં યુક્રેનિયન પક્ષ સમક્ષ તેની માંગો રજૂ કરી હતી. પશ્ચિમી દેશોએ યુક્રેનને સતત સશસ્ત્ર મોકલ્યા છે. અને તેના સૈનિકોને તાલીમ આપી રહ્યા છે. પશ્ચિમી દેશો યુક્રેનનો રશિયા સામે ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

## રશિયા કોઈપણ સંજોગોમાં યુક્રેનમાં લક્ષ્યોને પ્રાપ્ત કરશે : પુતિન



મોસ્કો : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે ફરી વાતચીત કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે તેમના કેન્દ્ર સમક્ષ ઈમેન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે યુક્રેનમાં રશિયાના સૈન્ય ઓપરેશનનો ઉદ્દેશ યુક્રેનના બિનલશ્કરીકરણ અને તેની તટસ્થ સ્થિતિ જાળવી રાખવાનો છે. રોઈટર્સના અહેવાલો અનુસાર

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચે લગભગ 90 મિનિટની વાતચીત થઈ હતી. આ દરમિયાન મેક્રોન સાથેની વાતચીતમાં પુતિને જણાવ્યું હતું કે, યુક્રેનમાં શું હાંસલ કરવા માંગે છે. પુતિને કહ્યું હતું કે, યુક્રેનમાં રશિયાના અભિયાનના લક્ષ્યો યુક્રેનનું ડિમિલિટરાઈઝેશન અને તટસ્થ સ્થિતિ છે. અમે આને કોઈપણ સ્થિતિમાં હાંસલ કરીશું. જો યુક્રેન કોઈપણ પ્રકારની મંત્રણામાં વિલંબ કરવાનો પ્રયાસ કરશે તો રશિયા તેની માંગણીઓ વધારશે.

નોંધનીય છે કે આ પહેલીવાર નથી. જ્યારે બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હોય. અગાઉ મેક્રોન અને પુતિન વચ્ચે 28 ફેબ્રુઆરીએ વાતચીત થઈ હતી. મેક્રોને પુતિનને યુક્રેનમાં નાગરિકો પરના તમામ હુમલાઓ રોકવા, નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી કરવા અને મુખ્ય રસ્તાઓ સુધી સુરક્ષિત પ્રવેશ આપવા વિનંતી કરી હતી. તે સમયે રાષ્ટ્રપતિ પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિને કહ્યું હતું કે રશિયન પક્ષ યુક્રેનના પ્રતિનિધિઓ સાથે વાતચીત માટે તૈયાર છે અને મોસ્કોને યોગ્ય પરિણામોની અપેક્ષા છે.

## ભારત પર પ્રતિબંધ લાદવા USના સાંસદોની માંગ

વોશિંગ્ટન

યુક્રેન અને રશિયા વચ્ચેના જંગમાં ભારતે અત્યાર સુધી કોઈનો પક્ષ લીધો નથી. જોકે અમેરિકાને ભારતનું વલણ ગમ્યું નથી અને હવે અમેરિકામાં મનોમંથન શરૂ થયું છે કે, ભારત સાથેના સંબંધોને કઈ દિશામાં લઈ જવા જોઈએ. રશિયા સામે યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં જે પણ પ્રસ્તાવો મુકાયા હતા તેમાં ભારતે મતદાન કર્યું નહતું. જેની સામે

અમેરિકાના સત્તાધારી અને વિપક્ષી સાંસદોએ નારાજગી વ્યક્ત કરી છે. સાંસદોની ચર્ચામાં સાંસદોએ ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સહયોગનો પણ વારંવાર ઉલ્લેખ કર્યો હતો અને પૂછ્યું હતું કે, આક્રમણખોર રશિયા પર ભારતનું વલણ જાણ્યા બાદ પણ ભારત પર અમેરિકાની સરકાર પ્રતિબંધો લાગુ કરશે કે નહીં. અમેરિકાના ડિપ્લોમેટ્સનું કહેવું છે કે, બાઈડન પ્રશાસન પર ભારત પર પ્રતિબંધનું

દબાણ વધી રહ્યું છે. જોકે સરકારે હજી કોઈ નિર્ણય લીધો નથી. અમેરિકા માટે ચીન સાથે બેલેન્સ રાખવા માટે ભારતથી સારો કોઈ બીજો વિકલ્પ નથી. અમેરિકાન ડિપ્લોમેટ લુએ કહ્યું છે કે, જો ભારત પર પ્રતિબંધ લગાવાશે તો ભારત અને તેનું જોઈને બીજા દેશો રશિયા પાસેથી હથિયારો ખરીદવા માટે પ્રેરાશે. જોકે મોસ્કો પાસેથી આગામી વર્ષોમાં હથિયારો ખરીદવું મુશ્કેલ બનશે.

**ABOWATH REAL ESTATE GROUP**  
VALUING BUY AND SELLING OVER TRANSACTING EVERY SINGLE TIME!

**MAAZ ABOWATH**  
BROKER  
416 893 4585

More info on PAGE 2 વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

**SUPER VISA INSURANCE**  
Get Full REFUND if visa is declined  
Get partial refund if parents leave early\*  
\*conditions apply.... Ask NOW for a free quote...

**Sanjiv Puri**  
Insurance Broker  
Ph.: 416-890-3232  
Email: sanjivpuri@rogers.com

**StarLife**  
Insurance & Investments Inc.  
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE  
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

IN GUJARATI  
ONLINE 7-DAY RAJA YOGA MEDITATION COURSE

**Finding Inner Peace**  
with Jayshri Patel

Thursdays (7 sessions)  
6:00-7:15pm (EDT)  
March 10, 17, 24, 31  
April 7, 14, 21

To Register: 514-271-7717 or visit our website

L'EMERGENCE  
CENTRE BRAHMA KUMARIS  
514-771-7717 monalbrahmapuric.ca

Need mortgage financing?  
Look no further. Let me make it happen.

**RBC Royal Bank**

**BHAVIN PATEL**  
Mobile Mortgage Specialist  
Royal Bank of Canada

bhavin.patel@rbc.com  
mortgage.rbc.com/bhavin.patel Cell: 647-502-8069  
Serving Greater Toronto Region Fax: 416-253-9461

છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપનો અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ યશે.

**Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬**

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

**www.ashoktravel.com**  
Ashok Travels Serving your travel needs in Canada since 1973  
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

✓ Residential  
✓ New Condos  
✓ Investments  
✓ Commercial

દુઆમાં રાદે રાખશે  
**Zakir Patel**  
Broker

Cell: 416-561-7973  
Office : 416-287-2222

**RE/MAX COMMUNITY**  
Realty Inc., Brokerage

Independently Owned and Operated  
1265, Morningside Ave. #203  
Toronto, ON M1B 3V9  
Email : patelzakir82@gmail.com

**SS & LAWYERS LLP**

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

**Avni Shah**  
B.A., JD  
Barrister & Solicitor

ashah@sslawyers.ca  
Tel : 416-818-4000  
Fax : 416-740-4002

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1



રશિયન તેલની આયાત  
પર કેનેડા પ્રતિબંધ મુકશે

## યુકેન માટે કેનેડા લશ્કરી સાધનો મોકલાશે

નાટોના નિર્ણયના સમર્થનમાં કેનેડા દ્વારા યુકેનને તમામ મદદ કરવાની ટૂંકોની ખાતરી

**ઓન્ટેરિયો**  
સોમવારે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો જણાવ્યું હતું કે, કેનેડા રશિયામાંથી કરવામાં આવતી કાચા તેલની આયાત પર પ્રતિબંધ મુકશે અને યુકેનને લશ્કરી સાધનોની ત્રીજી ખેપ મોકલશે કે જેથી યુકેનની સેના રશિયાનો મુકાબલો કરી શકે. ટૂંકોએ એમ પણ જણાવ્યું હતું કે, ગઈકાલે જાહેરાત કર્યા મુજબ અમે મિલિટરી સાધનોની એક નવી ખેપ

યુકેન મોકલી રહ્યા છીએ. જેમાં બોડી આર્મોર, હેલ્મેટ્સ, ગેસમાસ્ક અને નાઈટવિઝન ગોગલ્સનો સમાવેશ થાય છે. જે અમે ફરીથી જાહેરાત કરીએ છે કે, અમે યુકેનને એન્ટી ટેન્ક શસ્ત્રપ્રણાલી અને વધુ આધુનિક દારુગોળો મોકલવાનો પણ બંદોબસ્ત કરી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેનેડાની સેના હવાઈ માર્ગે આ પુરવઠો પૂરો પાડશે અને નાટો દ્વારા યુકેનને જે



ટેકો અપાઈ રહ્યો છે, તેમાં સત્તાધીશોએ ઈચ્છુનું સભ્યપદ પણ મદદ કરશે. યુકેનનાં મેળવવામાં મદદ કરવા માટે

કેનેડાને વિનંતી કરી હતી. સંરક્ષણ પ્રધાન અનિતા આનંદે જણાવ્યું હતું કે, કેનેડા 100 કાર્લ-ગુસ્ટાફ ટેન્ક વિરોધી શસ્ત્રપ્રણાલી, 2000 રોકેટ અને સૈનિકો ખભા પર રાખીને ઉપયોગ કરી શકે એવા શસ્ત્રો કેનેડાની સેના પાસેનાં જથ્થામાંથી યુકેનને મોકલવામાં આવશે.

પ્રાકૃતિક સંપદા ખાતાનાં પ્રધાન જહોન વિલકિન્સને ડાઉસ ઓફ કોમનમાં

દરમિયાન જવાબ આપતાં કહ્યું હતું કે, કેનેડાને રશિયા તરફથી 2019થી કાચું તેલ મોકલવામાં આવ્યું નથી. આજે અમે અમારો એવો ઈરાદો જાહેર કરે છીએ કે, રશિયાની કુલ આવકમાં તેલઉદ્યોગની આવક 2/3 ગણી છે, જે પુટીનને વધુ મજબૂત બનાવે છે અને તેથી અમે રશિયાના તેલઉદ્યોગ ઉપર પ્રતિબંધ મુકવાનાં પગલાં લેવા માંગીએ છીએ.

શિયાળામાં ઓન્ટેરિયો ખાતે અત્યંત નીચું  
તાપમાન સાથે બરફ પડવાની સંભાવના

હવામાન ખાતા દ્વારા નવી આગાહી જાહેર કરાઈ, નાગરિકોને સુચનો કરાયા

**ઓન્ટેરિયો**  
ઓન્ટેરિયોમાં શિયાળો વહેલો શરૂ થઈ રહ્યો છે, તેને કારણે અગવડતાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આગાહી મુજબ અત્યંત નીચું તાપમાન તથા ભારે બરફ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા તરફથી શિયાળુ હવામાન બાબતે મંગળવારે કરવામાં આવેલી આગાહી મુજબ હવે પછી ઓન્ટેરિયોના રહેવાસીઓએ બહુ ધીરજ અને

સહનશક્તિ રાખવી પડશે. કારણ કે, સંકેતો એવા છે કે આવી રહેલો શિયાળો વધુ ભીષણ અને જોખમી રહેશે. હવામાનશાસ્ત્રી ટેલર હેમિલ્ટને ટોરોન્ટોના મીડિયાને સોમવારે જણાવ્યું હતું કે, દક્ષિણ ઓન્ટેરિયો અને ખાસ કરીને સમગ્ર દક્ષિણ પૂર્વ ઓન્ટેરિયોમાં પરિસ્થિતિ વધુ વિષમ રહેશે. દક્ષિણ પૂર્વ ટોરોન્ટોનાં લોકોને એવો અનુભવ થશે કે, આ સમયમાં તેઓ સાચા અર્થમાં શિયાળાની સિઝનનો સામનો કરી રહ્યા

છે. ટેલર હેમિલ્ટને કહ્યું હતું કે, ટોરોન્ટો અને ઓન્ટેરિયોના દક્ષિણ વિસ્તારમાં વધુ બરફ પડવાની શક્યતા છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં જે બરફ પડે છે તેનાં કરતાં વધુ બરફ પડવાની શક્યતા છે. ટોરોન્ટોમાં માર્ચ મહિનામાં સામાન્ય રીતે 16 સેમી બરફ પડે છે. પરંતુ આ વર્ષે એવું નહીં બને. અહીં રહેનારાંઓએ કેટલાક દિવસ આમતેમ રહીને વિતાવવા પડશે. જ્યાં તાપમાનનો પારો વધશે ત્યાં ટૂંકા સમયમાં ફરીથી બરફવર્ષા થશે.

ટોરોન્ટોમાં જાતીય સતામણીનાં 100  
કેસમાં મહિલા તથા પુરુષ સામે તપાસ**ઓન્ટેરિયો**

ટોરોન્ટો પોલીસે જણાવ્યું હતું કે, છેલ્લા 17 વર્ષથી ડઝનબંધ મહિલાઓ, બાળકો અને પુરુષોનું શારીરિક શોષણ કરવાનાં 100થી વધુ ગુના બદલ એક મહિલા અને એક પુરુષ સામે તપાસ ચાલી રહી છે. 37 વર્ષની માર્ટિન વેટલોફર અને 42 વર્ષીય કેથરિન વોર્ડલો બંને સામે ટોરોન્ટોમાં 41 વ્યક્તિઓની જાતીય સતામણી કરવા બદલ પોલીસ તપાસ ચાલી રહી છે. એમ માનવામાં આવે છે કે આ જોડી આવા 100થી વધુ ગુનાઓમાં સંડોવાયેલી છે. સોમવારે એક પત્રકાર યાટીમાં પોલીસે જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2020થી આ જોડી સામે

તપાસ ચાલી રહી છે. છેલ્લા 17 વર્ષથી આ યુગલ વિવિધ પ્રકારનાં જાતીય શોષણ અને લોકોને માર મારવાનાં ગુનાઓમાં સંડોવાયેલું છે. ડેનફોર્થ એવન્યુ અને ડાઉસ રોડ વિસ્તાર તેમજ એગલિન્ટન એવન્યુ પૂર્વના વિસ્તારોમાં મહિલાઓ, પુરુષો અને બાળકોને આ જોડીએ શિકાર બનાવ્યા હોવાનું તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું. વધુ માહિતી આપવાનું એમને માટે યોગ્ય નથી. ટોરોન્ટો પોલીસનાં પ્રવક્તા મેઘન ગ્રેએ જણાવ્યું હતું કે, વધુ માહિતી આપવાથી પીડિતોને નુકસાન થવાની શક્યતા છે. વળી, કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી પણ વધુ માહિતી આપી શકાય એમ નથી.

બ્રામ્પ્ટનમાં ગોળીબાર થતાં યુવકનું મોત  
આરોપીને શોધવા પોલીસની દોડધામ**બ્રામ્પ્ટન**

મંગળવારે બ્રામ્પ્ટન ખાતે 20 વર્ષનાં એક યુવકનું ગોળીબારમાં મોત નીપજ્યું હતું. પ્રાથમિક તબક્કે ટોરાડા કોર્ટ જે વેનલેસ ડ્રાઈવ અને હ્યુરોન્ટોરિયો સ્ટ્રીટ ખાતે બનેલી ઘટના અંગે બપોરે 2.40 કલાકે પોલીસને 911 નંબર પર જાણકારી મળી હતી. જેમાં ગોળીબારની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ તાત્કાલિક બનાવનાં સ્થળે ધસી ગઈ હતી, જ્યાં પીડિત બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. આથી પોલીસ દ્વારા તાત્કાલિક તેને સારવાર કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો અને શરૂઆતમાં જીવનરક્ષક સારવાર આપવામાં આવી હતી. પરંતુ

તેને બચાવી શકાયો નહોતો. પીડિતની ઓળખ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કોન્સ્ટેબલ ડોના મોરિસે મંગળવારના રોજ ઘટનાસ્થળ પરથી પત્રકારોને જણાવ્યું હતું કે, હાલનાં તબક્કે આ બનાવ વિશે કંઈપણ કહેવું વધુ વહેલું ગણાશે. પોલીસે સંભવિત ગુનેગાર વિશે કોઈ માહિતી આપી નહોતી. મોરિસને જ્યારે પૂછવામાં આવ્યું કે, ગોળીબાર કરનારે ચોક્કસ નિશાન સાધીને ગોળીબાર કર્યો હતો કે કેમ, ત્યારે તેના જવાબમાં તેણે પત્રકારોને કહ્યું હતું કે, પોલીસ પાસે કેટલીક મહત્વની માહિતી છે. પરંતુ તપાસને અસર ન પહોંચે તે માટે અમે હાલમાં આનાથી વધુ માહિતી પત્રકારોને આપી શકીએ તેમ નથી.

**LIFE INSURANCE**  
MORTGAGE/LINE OF CREDIT INSURANCE

Q : DO YOU HAVE MORTGAGE / LINE OF CREDIT INSURANCE WITH BANK ?  
A : COMPARE & SAVE UP TO 50% LOWEST RATES GUARANTEED

AGE	\$ 250,000		\$500,000		\$1000,000	
	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female
30 Yrs	\$ 12.00	\$ 07.00	\$ 18.00	\$ 10.00	\$ 32.00	\$ 19.00
40 Yrs	\$ 13.00	\$ 08.00	\$ 22.00	\$ 14.00	\$ 36.00	\$ 26.00
50 Yrs	\$ 30.00	\$ 18.00	\$ 50.00	\$ 31.00	\$ 95.00	\$ 60.00
60 Yrs	\$ 85.00	\$ 56.00	\$ 146.00	\$ 103.00	\$ 271.00	\$ 190.00

ALSO AVAILABLE

- ★ NO MEDICAL TEST LIFE INSURANCE (up to age 85)  
(Even if you have DIABETES, BLOOD PRESSURE, HEART ATTACK, STROKE)  
CANCER OR INSURANCE declined by other companies
- ★ CORPORATION OWNED LIEF / CRITICAL ILLNESS INSURANCE  
(Key Person INSURANCE, BUY SELL AGREEMENT, GROUP BENEFITS)
- ★ MONEY BACK LIFE / CRITICAL ILLNESS INSURANCE, RRRSP, RESP, TFSA

Visitor To CANADA INS, TRAVEL INS, Lite ins For Refugees & Work Permits  
Email : - Davindersinghthi@gmail.com  
www.financialhutltd.com.

**416.320.4614** Toll : 1866.623.0865 Call For HONEST ADVICE

**SUPER VISA INSURANCE**  
HARD TO BEAT OUR PREMIUMS

**THINKING OF  
BUYING, SELLING OR INVESTING?**

**આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર**

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટ ની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.  
મોર્ટગેજ જોઈએ છે? અમે મદદ કરી શકીએ છીએ!

**CALL 416 893 4585 TODAY!!!**

**SUBHRO CHAKRABORTY**  
SALES REPRESENTATIVE

**SUDHIR PARMAR**  
SALES REPRESENTATIVE

Call us **TODAY** for all of your Real Estate needs and get honest, reliable and professional Service you can count on.

**MOHAMMAD ABOWATH**  
SALES REPRESENTATIVE

**MAAZ ABOWATH**  
BROKER - TEAM LEADER

**IBRAHIM ABOWATH**  
SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH

REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

#1 RE/MAX

ABOWATH.COM

RE/MAX CROSSROADS REALTY INC. #SellwithABOWATH your Local REALTOR



# ઓન્ટેરિયોમાં ડિજિટલ પ્લેટફોર્મનાં કામદારોને લઘુત્તમ વેતન

કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા કામદારોને ભેદભાવ વગર આગળ લાવવા પ્રિમીયર ડોગ ફર્ડનું વચન

**ટોરોન્ટો**

ઓન્ટેરિયોની સરકારે કામ કરતાં કામદારો માટેનો એક્ટ 2022 સંસદમાં રજૂ કર્યો હતો. જો આ ખરડો પસાર થઈ જશે તો દેશનાં અર્થતંત્રને વધુ મજબૂત બનાવવામાં આ કાયદો અગ્રગણ્ય ભાગ ભજવશે. આ ખરડામાં કેટલાંક નવાં સૂચનો ઉમેરવામાં આવ્યાં છે અને કેનેડામાં આવો કાયદો ઘડનાર ઓન્ટેરિયો સૌથી પહેલું રાજ્ય હશે. તેમાં કરવામાં આવેલા સુધારા મુજબ ડિજિટલ પ્લેટફોર્મનાં કામદારો કે જેઓ રાઈડ્સ, ખાનપાનની વસ્તુઓ પહોંચાડવી અથવા ઉબેર, ડોર ડેશ અને ઈન્સ્ટાકાર્ટમાં સેવા આપે છે, એવા લોકોને પણ અધિકારો આપવામાં આવશે અને તેમને માટે લઘુત્તમ વેતનના દર પણ નક્કી કરવામાં આવશે. પ્રિમીયર ડોગ ફર્ડે જણાવ્યું હતું કે, તમે મોટી કંપનીમાં કામ કરતાં હો કે કોઈ નાની કંપનીમાં કે પછી તમે



કોઈ ઘરમાં નોકરી કરતાં હોવ, પણ અમારી સરકાર કોઈપણ ભેદભાવ વગર કામદારોને આગળ લાવવા ઈચ્છે છે. આંકડા દર્શાવે છે કે, કેનેડિયનો વિચિત્ર પ્રકારનાં અર્થતંત્રમાં કામ

કરી રહ્યા છે અને આવા કામદારોની સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા છે અને આવા કામદારોએ સતત અચોક્કસતાનો સામનો કરવો પડે છે. તેમની જરૂરિયાતો પૂરી થતી

નથી. તેથી જ સરકારે નીચે દર્શાવેલા અધિકારો આપતો એક કાયદો ડિજિટલ પ્લેટફોર્મનાં કામદારો માટે પસાર કરવામાં આવ્યો છે. કોઈપણ ઉદ્યોગ કે સાહસ ઓન્ટેરિયોમાં કામ કરતા

કામદારોને લઘુત્તમ વેતનધારા અંતર્ગત નક્કી કરવામાં આવેલા પગારથી ઓછો પગાર આપી શકશે નહીં, એમ મજૂરોના તાલીમ વિભાગનાં પ્રમુખ મોન્ટે મેકનોઈને જણાવ્યું હતું.

- » કામદારે જેટલો સમય કામ કર્યું હોય તેટલો સમય સામાન્ય લઘુત્તમ ધારા મુજબ એને વેતન મળવું જોઈએ.
- » તેઓને આપવામાં આવતી ટીપ વધારાની આવક તરીકે તેઓ પોતાની પાસે રાખી શકશે. આ આવક પગારવધારામાં સામેલ નહીં હોય. પગારની ગણતરી કરી રીતે કરવામાં આવી છે તથા ક્યારે, શા માટે અને કઈ રીતે તેને સજા કરવામાં આવી છે, તે જાણવાનો આવા કામદારોને અધિકાર છે.
- » જો તેમને તેનાં કામ પરથી દુર કરવામાં આવે તો લેખિત કારણ દર્શાવવું પડશે.
- » ઓન્ટેરિયોમાં તેમનાં કામ સંબંધી સમસ્યાનો ઉકેલ લાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
- » તેમને સામાજિક ભેદભાવ અને ટીકા સામે રક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવે છે.

## ઓટાવાના મિલકતદારો ધ્યાન ન આપે તો વધારાના 250 ડોલર ચૂકવવા પડશે

શહેર વિકાસ સમિતિ દ્વારા ખાલી મકાન પર વેરો લાદતો કાયદો પસાર કરાયો

**ટોરોન્ટો**

ઓટાવામાં રહેતા અને મિલકતો ધરાવતા કેટલાક લોકોએ દર વર્ષે ઓટાવા શહેરના સત્તાવાળાઓને તેમનાં મકાન ખાલી નથી, એવી જાણ કરવી પડશે અને જો તેમ કરવામાં તેઓ ભૂલચૂક કરશે તો તેમણે 250 ડોલરની લેટ ફી અથવા 1000 ડોલરનો કર ચૂકવવો પડશે. શહેરની વિકાસ સમિતિએ એક નવો ખાલી મકાન પર વેરો લાદતો કાયદો મંગળવારના રોજ પસાર કર્યો છે અને રહેવાલાયક મકાનો ખાલી ન રહે તેની ચોકસાઈ રાખી છે. શહેરનાં નાણાં વિભાગે ખાલી પડેલી મિલકતો પર કેટલો કર લેવો તેની સમીક્ષા કરી છે અને મિલકતનાં મૂલ્યાંકન પછી આ વેરો લગભગ 1653 ડોલર લેવામાં આવશે. ઓન્ટેરિયોમાં મે 2023માં જે વેરા બીલ આપવામાં આવશે તેમાં આ કરવેરાનો સમાવેશ કરી લેવામાં



આવશે. ખાલી પડેલા મકાન માટે એવું માની લેવામાં આવશે કે, આ મકાનમાં કોઈ મૂળ માલિક રહેતો નથી અને 184 દિવસથી વધુ સમય મકાન ખાલી પડ્યું હશે તો તેને આ કાયદો લાગુ પાડવામાં આવશે. આ કર 6 યુનિટ ધરાવતા મકાનને લાગુ પડશે. મકાન ખાલી પડ્યા છે, તેની માહિતી મેળવવા માટે સિટી ઓફ ઓટાવા 330,000 મિલકતધારકોને દર વર્ષે એક જાહેરનામુ

રજુ કરવાની ફરજ પાડશે. દરેક વર્ષે દરેક મિલકતમાલિકે જાન્યુઆરીથી શરૂ થતાં વર્ષ દરમિયાન માર્ચ મહિનાના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આવું ડેકલેરેશન આપવાનું રહેશે અને આવા ડેકલેરેશનને આધારે આંકડા તૈયાર કરીને વેબસાઈટ પર મૂકવામાં આવશે. જો માલિક આ સમય દરમિયાન ડેકલેરેશન ભરવામાં નિષ્ફળ જશે તો તેને 250 ડોલર લેટ ફી તરીકે ચૂકવવાના રહેશે.

## સ્વસ્તિક પર પ્રતિબંધ મુદ્દે કેનેડા મુક્ત્યું : બિલમાં હવે ફેરફાર કરાશે

**ઓટ્ટાવા**

કેનેડામાં સ્વસ્તિક પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતા બિલ અંગે ભારતીયોનો વિરોધ સફળ થયો છે. અંતે કેનેડાના સાંસદ ઝૂક્યા છે અને સ્વસ્તિકને નાજી પ્રતિક ગણાવી પ્રતિબંધ મૂકવાની માગણી કરતા સૂચિત બિલની ભાષામાં ફેરફાર કરવા સંમત થયા છે. આ બિલમાં નાજી પ્રતિકને સ્વસ્તિકના બદલે હૂકડ કોસ કહેવાશે. સ્વસ્તિક હિન્દુ ધર્મનું પવિત્ર પ્રતિક છે. એવામાં કેનેડામાં એક બિલમાં આખા દેશમાં સ્વસ્તિક પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી હતી. આ બિલમાં જર્મન નાજીઓના પ્રતિક હૂકડ કોસના બદલે સ્વસ્તિક શબ્દનો ઉપયોગ કરતા ભારતીય સમાજના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ બિલ સામે હિન્દુ ફેરફાર સંગઠને દેખાવો કર્યા હતા. સ્વસ્તિક મુદ્દે આખા કેનેડામાં ભારતીયોના ભારે વિરોધ પછી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ પીટર જુલિયને કહ્યું, હું સૂચિત બિલ સી-૨૨૮ની

ભાષામાં ફેરફાર કરવા તૈયાર છું. બિલમાં સ્વસ્તિકની જગ્યાએ હવે હું હૂકડ કોસ શબ્દનો ઉપયોગ કરીશ. નાજીઓ પણ તેને હૂકડ કોસ જ ગણાવતા હતા. આ પ્રાઈવેટ મેમ્બર બિલને એનડીપીના નેતા જગમીત સિંહનું પણ સમર્થન મળ્યું છે. આ બિલમાં દરખાસ્ત કરાઈ હતી કે કેનેડામાં નાજી પ્રતિક સ્વસ્તિક ચિહ્નના વેચાણ અને તેના દેખાવો પર પ્રતિબંધ મૂકાશે. તાજેતરમાં કેનેડાની રાજધાની ઓટાવામાં થયેલા ટ્રક આંદોલનમાં નાજીઓના પ્રતિકનો ઉપયોગ કરાયો હતો. ત્યાર પછી આ બિલ તૈયાર થયું હતું. આ બિલના સમર્થનમાં જગમીત સિંહે ટૂવીટ કરી હતી કે, સ્વસ્તિક અથવા કનફેડરેટના ઝંડાનું કેનેડામાં કોઈ સ્થાન નથી. આપણા ઉપર એ જવાબદારી છે કે આપણે બધાને સલામતીનો અનુભવ કરાવીએ. આ સમય છે કેનેડામાં હેટ સિમ્બોલ્સ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ. તેમણે હિન્દુ ધર્મના પ્રતિક સ્વસ્તિકને નાજી પ્રતિક સાથે સરખાવતા ભારતીયોમાં ભારે રોષ ફેલાવ્યો હતો.

## કન્ઝર્વેટીવ પાર્ટીના નવા નેતાની 10મી સપ્ટેમ્બરે થશે જાહેરાત, અનેક દાવેદારો

**ઓન્ટેરિયો**

કેનેડાની કન્ઝર્વેટીવ પાર્ટી તેના નવા નેતાની 10મી સપ્ટેમ્બરનાં રોજ જાહેરાત કરશે અને વધુમાં વધુ કાર્યકરો આ પદની રેસમાં ભાગ લઈ શકે તે માટે સમય લંબાવવામાં આવ્યો છે. પક્ષનું નેતૃત્વ સંભાળવાની દોડમાં પીઅરે પોલિવરે પણ જોડાયા છે. ક્યુબેકનાં ભૂતપૂર્વ પ્રિમિયર જીન કાસ્ટે પ્રોગ્રેસિવ કન્ઝર્વેટીવના નેતા રહી ચૂક્યા છે. તેઓ પણ લિડરશીપની આ સ્પર્ધામાં એક મહત્વના ઉમેદવાર છે. કાસ્ટે બુધવારે રાત્રે ઓટાવો ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, કાયદા મુજબ અમે અમારો પ્રચાર કરવા માટે યોગ્ય છીએ કે કેમ તેની હવે પછી અમને જાણ કરવામાં આવશે. તેઓ કન્ઝર્વેટીવ કુકુઝનાં સભ્યને સતત મળી રહ્યા છે અને

અત્યાર સુધીમાં 40 સભ્યોની મુલાકાત લઈ ચૂક્યા છે. પોતાની ઉમેદવારી વિશે તેમણે ચર્ચા કરી હતી. એક અન્ય ઉમેદવાર કેન્ડીસ બર્ગન ઘણાં લાંબા સમય સુધી પક્ષનાં વચગાળાનાં નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, તેમને બહુમતિના અભાવમાં નેતૃત્વ પરથી પડતા મૂકવામાં આવ્યા હતા. તેઓ પણ પક્ષનાં નેતાની સ્પર્ધામાં છે. અત્યાર સુધીમાં પક્ષનાં નેતા તરીકેની સ્પર્ધામાં ફક્ત ચેરેસ્ટનું નામ જ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ કન્ઝર્વેટીવ પક્ષનાં કેબિનેટ પ્રધાન પીટર મેકે પણ આ દોડમાં સામેલ છે. સૂત્રોએ રેડિયો કેનેડાને જણાવ્યું હતું કે, નેશનલ પોસ્ટ કોલમિસ્ટ અને રાજકીય સલાહકાર તાસા ખેરડીને પણ નેતૃત્વની સ્પર્ધામાં ઝંપલાવ્યું છે.

## યુકેનમાં રશિયાની ઘુસણખોરી બાદ BCમાં પૂર્વ યુરોપના ઉદ્યોગપતિઓને મળતી ધમકી

બેકરી સંચાલકને ધંધો બંધ કરી દેવા દબાણ : યુકેનના સમર્થનમાં આગળ આવવા અપીલ

**ટોરોન્ટો**

બ્રિટીશ કોલંબિયામાં ઉદ્યોગધંધા કરી રહેલાં પૂર્વ યુરોપનાં ઉદ્યોગપતિઓને યુકેનમાં રશિયાની ઘુસણખોરીને ટેકો આપી રહેલા ગ્રાહકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. યુકેનમાં ચાલી રહેલાં ઘર્ષણને એક સમાહ થઈ ચુક્યું છે. અને આ ઘર્ષણની અસર હવે આ વિસ્તારનાં ધંધાઉદ્યોગો અને કેટલાંક કરારો પર પણ થવા લાગી છે. રશિયાને સમર્થન આપી રહેલાં આવાં કેટલાંક ક્ષેત્રોમાં રશિયન સ્પૂન કે જે વેનકુવર, હાબર સેન્ટરમાં બેકરી ચલાવી રહ્યાં છે, તેનું સંચાલન નાતાલિયા મિત્રોફેનોવા કરી રહ્યાં છે.

તેઓ મૂળ રશિયાનાં છે અને કેનેડામાં વસે છે. નાતાલિયાની બેકરીમાં પૂર્વ યુરોપિયન ખાનપાનનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેની આ બેકરીમાં યુકેન, મોર્ડોવા, કઝાખસ્તાન અને રશિયાના કારીગરો કામ કરે છે. હાલ યુકેન પર રશિયાએ હુમલો કરી દીધો છે. જેને કારણે આ બેકરીના માલિકને સ્થાનિક લોકો તરફથી સતત ધમકી મળતી રહે છે. નાતાલિયા કહે છે કે, અમે અત્યારે ભારે માનસિક ત્રાસમાંથી પસાર થઈ રહ્યા છીએ. લોકો અમને અમારો ધંધો બંધ કરી દેવાનો આગ્રહ કરી રહ્યા છે. જો કે, જેઓ વફાદાર ગ્રાહકો છે, તેઓ નાતાલિયાની બેકરીને રક્ષણ પૂરું પાડી

રહ્યા છે. નાતાલિયા કહે છે કે, હજુ પણ સંઘર્ષમાં વધારો થવાની શક્યતા છે અને દરરોજ અમારે અમારા ગ્રાહકોને સમજાવવા પડે છે અને કેટલાક ગ્રાહકો તરફથી અમને ધમકી પણ મળતી રહે છે. વાનકુવરમાં કામ કરી રહેલાં એક અન્ય ઉદ્યોગપતિ રશિયન વર્લ્ડનાં માલિકે મીડિયાને ઈન્ટર્વ્યૂ આપવાનો ઈનકાર કર્યો છે. પરંતુ જ્યારથી રશિયાએ યુકેનમાં ઘુસણખોરી કરી છે, ત્યારથી તેમની મુસીબત વધી ગઈ છે. કેટલાક લોકો યુકેનને ટેકો આપતાં જોવા મળે છે. વિક્ટોરિયા ખાતે એક મહત્વનો ઉદ્યોગ ચલાવતા પોલ સર્વો કહે છે કે, હવે અહીં કામ કરવું મુશ્કેલ બનતું જાય છે.





તંત્રી સ્થાનેથી

# રશિયા-યુકેન યુદ્ધ, તબાહીનું તાંડવ, દુનિયાભરમાં અજંપાં

સતત નવ દિવસથી રશિયા અને યુકેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી સમગ્ર દુનિયામાં અજંપાં ફેલાયો છે. બુધવારે યુકેનના બીજા નંબરના સૌથી મોટા શહેર ખારકીવ પર કબજો કરવા માટે રશિયાએ જબરદસ્ત આક્રમણ કર્યું, જેને કારણે અસંખ્ય લોકોના મોત થયા. એ જ રીતે ગુરુવારે યુકેનના ચર્નિહિવ શહેર પર થયેલા હુમલામાં 22 લોકોએ જીવ ગુમાવ્યા. રશિયા અને યુકેનનું યુદ્ધ ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. દુનિયાના અનેક દેશોની શાંતિની અપીલ છતાં રશિયા અને યુકેન બંને જીદ પર ચડી જતા કોઈ યુદ્ધને રોકવા તૈયાર નથી. રશિયાએ યુકેનમાં સંખ્યાબંધ મોરચા કોલ દીધા છે. ખેરસોન શહેર પર રશિયાનો કબજો કર્યા બાદ યુકેનના બીજા નંબરના સૌથી મોટા શહેર ખારકીવ પર કબજો કરવા રશિયાએ આક્રમકતા દાખવતા ઠેર ઠેર તબાહી સર્જાઈ છે.



તંત્રી - પ્રકાશક  
સ્વદેશ

ખારકીવમાં ધીરે ધીરે યુકેનના સૈનિકો ઘટી રહ્યા છે, રશિયાના સૈનિકો હવાઈ માર્ગે ઉતરી રહ્યા છે. ખારકીવ રશિયાની સરહદની નજીક આવેલું શહેર છે. લગભગ ૧૪ લાખની વસતી ધરાવતું આ શહેર રશિયાના કબજામાં જાય તો રશિયા માટે મોટી જીત ગણાય. અહીં રશિયા સરળતાથી પોતાના સૈનિકો અને શસ્ત્ર સરંજામનો ખડકલો મોકલી શકે તો યુકેનને જલદી પરાસ્ત કરી શકે. રશિયાએ યુકેનની રાજધાની કીવ પર કબજો કરવા મોરચો ખોલી દીધો છે. રશિયા ગમે તે ભોગે કીવ પર કબજો કરવા માગે છે. રાજધાની કબજે થાય એટલે યુકેનની હાર નક્કી થઈ જાય. સામે યુકેન કીવને બચાવવા મક્કમ છે. રશિયા અને યુકેનનાં લશ્કરો વચ્ચે કીવને બચાવવા ખરાખરીનો જંગ ખેલાઈ રહ્યો છે. કીવમાં નાગરિકો પણ હથિયાર લઈને ઉતરી પડ્યાં છે તેથી રશિયાના લશ્કર માટે કીવ કબજે કરવું મુશ્કેલ થઈ ગયું છે.

બીજી તરફ અમેરિકા સહિતના દેશો પણ ધીરે ધીરે આક્રમકતા વધારી રહ્યા છે. અમેરિકા સહિતના દેશોએ યુકેનને થોડા થોડા પ્રમાણમાં લશ્કરી સહાય વધારવા માંડી છે. બીજી તરફ રશિયાને ભીંસમાં મૂકવા માટે યુનાઈટેડ નેશન્સ સહિતની વૈશ્વિક સંસ્થાઓના માધ્યમથી પ્રતિબંધો પણ વધારવા માંડ્યા છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડને યુકેનના પ્રતિકારની પ્રસંશા કરીને રશિયાને ખુલ્લી ધમકી આપી છે કે, પુતિનને યુકેન પર આક્રમણની આકરી કિંમત ચૂકવવી પડશે જ. બાઈડને એવું પણ કહ્યું છે કે, પુતિનને ખબર જ નથી કે હવે શું શું બનવાનું છે. બાઈડને આ વાત રશિયા પરના આર્થિક તથા અન્ય પ્રતિબંધોના સંદર્ભમાં કહી છે કે પછી અમેરિકા યુદ્ધમાં સામેલ થશે એવો સંકેત આપવા કરી છે એ સ્પષ્ટ નથી, પણ બાઈડન આક્રમક બની રહ્યા છે તેનો સંકેત તેમના નિવેદનમાંથી મળી રહ્યો છે.

રશિયા પણ આક્રમક મૂડમાં છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે રશિયા અને યુકેનના યુદ્ધમાં અમેરિકા કૂદશે તો પરમાણુ યુદ્ધ થશે એવી ખુલ્લી ધમકી આપી દીધી છે. લાવરોવનું કહેવું છે કે, ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો તેમાં પરમાણુ શસ્ત્રો વપરાશે જ અને આ યુદ્ધ અત્યંત વિનાશકારી હશે. અમેરિકા યુકેનને બચાવવા ઝેલેન્સ્કીને પરમાણુ બોમ્બ આપશે એવી અટકળો ચાલી રહી છે. તેથી લાવરોવે આડકતરી રીતે અમેરિકા સહિતના દેશોને યુદ્ધથી દૂર રહેવા ચેતવણી સ્વરૂપે આ પ્રકારનું નિવેદન કર્યું છે. અલબત્ત અમેરિકા અત્યાર સુધી જે રીતે યુદ્ધથી દૂર રહ્યું છે. યુએસનું

આ વલણ દુનિયામાં આશ્ચર્ય સર્જનારું રહ્યું છે. અમેરિકા જો આ યુદ્ધમાં ઝંપલાવે તો આખી દુનિયામાં ભીષણ યુદ્ધ શરુ થાય તેમાં શંકા નથી. રશિયા પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવા થનગની રહ્યું છે.

એટલે અમેરિકાએ હજી વેઈટ એન્ડ વોયની સ્થિતિ રાખી છે. વાસ્તવમાં અમેરિકા અને રશિયા સામસામે ભિડાઈ જાય તો અમેરિકાને વધારે નુકસાન થાય. રશિયા એક જ દેશ છે જ્યારે અમેરિકાની સાથે યુરોપીયન યુનિયનના ૩૦ દેશો છે. રશિયા આ તમામ દેશોમાં ભારે તબાહી વેરી શકવા સક્ષમ છે. રશિયાએ યુકેનને કરવું હતું એટલું નુકસાન કરી લીધું છે. અત્યારે જે સ્થિતિ છે એ જોતાં રશિયા ત્રણ-ચાર દિવસમાં યુકેનના પ્રતિકારને ખતમ કરીને યુદ્ધ ખતમ કરી નાંખશે. રશિયાએ યુકેનનાં ત્રણેય મોટાં શહેરોને લગભગ તબાહ કરી નાંખ્યાં છે. ચેરનોબિલ જેવો મહત્વનો પરમાણુ પ્લાન્ટ કબજે કરી લીધો છે. રશિયાને યુકેનના નેચરલ ગેસના ભંડારમાં રસ છે. આ ભંડાર જ્યાં આવેલા છે એ પ્રદેશો લુહાન્સ્ક અને દોનેત્સ્કને રશિયાએ સ્વતંત્ર જાહેર કરાવીને ભવિષ્યમાં બંને પ્રદેશોને રશિયામાં ભેળવી દેવાનો તખ્તો તૈયારી કરી દીધો છે.

આ બધું કરવા માટે રશિયાએ પણ ભારે ખુવારી વેઠી છે. યુકેનના દાવો છે કે, સાત દિવસમાં રશિયાના છ હજાર સૈનિકો મરાયા છે. આ દાવામાં કેટલું સત્ય છે એ તો આવનાર સમય જ કહશે. કેમ કે, રશિયા પોતે સત્તાવાર રીતે ખુવારીના આંકડા આપતું નથી. જો કે તેણે ખુવારી વેઠી જ હોય તેમા પણ શંકા નથી. હવે ખુવારી વેઠ્યા પછી રશિયા યુકેનના પ્રમુખ ઝેલેન્સ્કીને નુકસાન કર્યા વગર જવા દે તેમ નથી. રશિયાએ પહેલા પણ કહ્યું જ છે કે, આ યુદ્ધનો લોજિકલ એન્ડ નહીં આવે ત્યાં સુધી યુદ્ધ સમાપ્ત નહીં થાય. યુકેનમાંથી ઝેલેન્સ્કીને પદભ્રષ્ટ કરીને રશિયા પોતાની કઠપૂતળી સરકાર મૂકીને આગળ વધવા માંગે છે. રશિયા ઝેલેન્સ્કીને તગેડીને કોને યુકેનની કમાન સોંપશે એ પણ નક્કી છે. યુકેનના ભૂતપૂર્વ પ્રમુખ વિક્ટર ફેડોરોવિચ યાનુકોવિચનો યુકેનના નવા પ્રમુખ તરીકે રાજ્યાભિષેક કરાવવાની રશિયાની ઈચ્છા છે. વિક્ટર યાનુકોવિચ અત્યારે રશિયાના સાથી બેલારૂલના મિન્સ્ક શહેરમાં છે. વિક્ટર યાનુકોવિચ એક સમયે યુકેનમાં બહુ લોકપ્રિય હતા. યુકેનના દોનેસ્ક પ્રાંતમાં રશિયા સમર્થિત અલગતાવાદીઓનું વર્ચસ્વ છે. યુકોનોવિચ દોનેસ્કના છે. યુકોનોવિચ યુકેનના પ્રમુખ હતા ત્યારે રશિયાના ઈશારે યુકેનનું શાસન ચાલતું હતું. અમેરિકા સહિતના દેશોએ ઝેલેન્સ્કીને જીતાડીને ગાદી પર બેસાડ્યા એટલે યુકોનોવિચે યુકેન છોડીને ભાગવું પડ્યું હતું. પુતિન યુકોનોવિચને પાછા યુકેન લાવીને ફરી સત્તા સોંપીને યુકેનમાં પોતાનું આધિપત્ય જમાવવા માંગે છે. રશિયાનું લશ્કર યુકેનમાં રહે અને યુકોનોવિચ લશ્કરી છત્રછાયામાં રહે તો રશિયાનાં હિતો સાચવાય તેમ છે. પુતિનનો આ જ ગેમ પ્લાન છે. પુતિને પોતાનો આ પ્લાન સફળ કરવા જ યુદ્ધનો માર્ગ અપનાવ્યો છે. જો કે, તેની મોટી કિંમત યુકેનનાં લોકો અને યુકેનમા રહેતાં બહારના લોકોએ પણ ચૂકવી છે. એકદમ શાંત દેશ મનાતું યુકેન અરાજકતા અને અશાંતિની આગમાં હોમાઈ ગયું છે. લોકો સામાન્ય જીંદગી નથી જીવી શકતા. લોકોએ બંકરોમાં રહેવું પડે એવા દિવસો આવી ગયા છે. લોકો પાસે ખાવા-પીવા કંઈ નથી, કોઈ તેમની સંભાળ લેનારું નથી. સામાન્ય લોકો સાવ નોંધારાં થઈ ગયાં છે. અનુસંધાન પેજ નં. 19

Manoj Gandhi

manoj1968@yahoo.ca

# RE/MAX

## REALTY SERVICES

INC., BROKERAGE

INDEPENDENTLY OWNED AND OPERATED



### JAY PATEL

BROKER

647.241.3818  
jaypatel1323@gmail.com



## "Let Me Make Your Dream Home Into A Reality"

### Residential, Commercial & Investment in Real Estate

Off : 905.456.1000 | Fax : 905.456.1924

295 Queen Street East, Brampton, On., L6W 3R1



## ARISTO PEST CONTROL

Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com



✓ Mice

✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL



✓ Cockroach

✓ Bedbug

✓ Animal Control

✓ Bird Control

✓ WASPS and

✓ Hive Removal

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI



## 24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And Discounted Rates



CALL SANKET TRIVEDI - 647.339.3926  
Government Licensed Structural Exterminator



# ગોથાણ-હજીરાની રેલવે માટે 14 ગામોના ખેડૂતો એક તસું જમીન પણ આપશે નહીં

મહારેલી માટે કોઈ પરમીશન લેવાશે નહીં, ધરપકડ કરાશે તો જેલભરો આંદોલન

સુરત

ગોથાણ-હજીરા નવી બ્રોડગેજ રેલવે લાઈનના વિરોધમાં બુધવારે સુરત ખાતે યોજાયેલી ખેડૂત સમાજની બેઠકમાં 11 માર્ચે મહારેલીની જાહેરાત કરી એક પણ ઈંચ જમીન આપવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો.

ગોથાણથી હજીરા વચ્ચે ન્યુ બ્રોડગેજ રેલવે લાઈન માટે 14 ગામોની 85 હેક્ટર થી વધુ જમીન સંપાદન કરવાની શરૂ થયેલી કાર્યવાહીને લઈને ખેડૂતોમાં ભારે વિરોધ છે. આગામી શનિવારથી



14 ગામોમાં તબક્કાવાર જઈને ઓટલા બેઠક કરવાનું નક્કી કરાયું હતું. આગામી 11 મી માર્ચે અલગ અલગ બે જગ્યા વરીયાવથી ભેંસાણ અને જુનાગામથી ઈચ્છાપોર રેલી કાઢીને તમામ જિલ્લા

કલેક્ટર કચેરી જઈ વાધાઓ રજૂ કરાશે અને જમીન નહીં આપવાના નિર્ણયની જાણ કરાશે. હાલમાં કૃભકો કંપનીની રેલવે લાઈન છે, તે રેલવે લાઈનના પાટા પર જ અદાણી, એએમએનએસ કે પછી અન્ય કંપનીઓ માટે ગુડ્સ ટ્રેન દોડાવો. બેઠકમાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની મહામુલી જમીન અપાશે નહીં. હજીરાના મહાકાય ઉદ્યોગોને રેલવે આપવા માટે જમીન કોડીના ભાવે લઈ લેવા માંગે છે.

# ખુડા ડીપી માટે 700 એકર જમીન સંપાદન સામે વિરોધ

10 ગણો ભાવ મળે તો પણ ખેડૂતો બીજી જમીન ખરીદી શકે તેમ નથી

સુરત

ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (ખુડા) દ્વારા 2039 ડેવલપમેન્ટ પ્લાન રજૂ થયો છે. 700 એકર જમીનના સંપાદનને લીધે અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થયો હોવાથી ખેડૂતોએ લડતનું એલાન કર્યું છે.

ખેડૂતોએ આજે કલેક્ટર કચેરીમાં મોરચો માંડીને આવેદનપત્ર આપ્યું હતું. તેમાં જણાવ્યા મુજબ, 1989 થી આજદિન સુધીના 32 વર્ષમાં વિકાસના નામે આભવા ગામની 500 એકર જમીન સંપાદીત કરી દેવાઈ છે. હવે આ નવા પ્લાન હેઠળ બીજી 700

એકર જમીન સંપાદન કરાશે. ગામના ખેડૂત કાંતિભાઈ પટેલે આકોશ સાથે જણાવ્યું હતું કે, ખેડૂતો પાસે જમીનના મોટા ટુકડાને બદલે હવે નાના-નાના ગુંઠા જ બચ્યા છે.

ખુડા હવે વધુ જમીન સંપાદન કરશે તો ગામના 300 ખેડૂતોની જમીન જશે અને તેમાં 80 ટકા ખેડૂતો બિનખેડૂત બની જશે. સરકાર 10 ગણી જંતરી ચૂકવે તો પણ તે રકમમાંથી ખેડૂતો નજીકમાં બીજી જમીન ખરીદી શકે તેમ નથી. ખેડૂતો ખેડૂત મટી જાય તેવી સ્થિતિ હોવાથી ખેડૂતોએ લડતનું એલાન કર્યું છે.

# વિરોધને પગલે પાર-તાપી રિવર લિંક યોજના રદ થવાના ઝંઘાણ

ગાંધીનગર

પાર-તાપી રિવર લિંક યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાર-તાપી રિવર લિંક યોજના હવે રાજ્ય સરકાર રદ કરશે. દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના લોકોએ આ વિશે રજૂઆત કરી હતી. સ્થાનિકોએ સી.આર.પાટીલ, CMને રજૂઆત કરી હતી.

રિવરલિંક યોજના શક્ય ન હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકારે બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી. આદિવાસી સમાજના હિતમાં રાજ્ય સરકાર આ યોજનાને રદ કરશે.

માહિતી પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાર-તાપી યોજના અંગે આદિજાતિ બાંધવોના

પ્રશ્નો અને રજૂઆતોનું નિવારણ લાવવા માટે એક હિતકારી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સુચિત પાર-તાપી યોજના અંગે આ દિજાતિ બાંધવોના પ્રશ્નો-રજૂઆતોનું નિવારણ લાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, પાર-તાપી યોજના અંગેની આદિજાતિ બાંધવોની રજૂઆતો અને સમસ્યાઓને સંપૂર્ણપણે સમજીને તેમના હિતમાં હોય તેવું નિરાકરણ લાવીશું.

મુખ્યમંત્રીએ આ સંદર્ભે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારમાં રજૂઆત કરશે, તેવી આદિજાતિ સમાજને ખાતરી આપી અને જણાવ્યું કે, રાજ્ય સરકાર આદિજાતિઓના હિતોની રક્ષા માટે સદૈવ કટિબદ્ધ છે.

## OFFICE SPACE FOR RENT

Ideal For : Tuition Class,  
Real Estate Broker,  
Tailoring Business Etc. Etc.

Total Area 300 Sq Ft Including Storage Space  
Rent \$600/ Month Including Utilities Fix  
Not Negotiable

Lease Term : Flexible & Negotiable

Contact : Prakash Sapra

416-820-9117

# ગોવર્ધાનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

### Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી,  
છોલેપુરી, કટલેસ,  
ખાસ્તા કચોરી,  
સેવ ઉસળ, સમોસા ચાટ

### Takeout & Catering

Limited થાળી  
(with sweet & Farsan)  
\$9.00 +Tax

Limited થાળી  
(without sweet & Farsan)  
\$7.50 +Tax



### CATERING SPECIAL

\$ 14.99 10 items  
+Tax  
Sweet, Farsan, Subji,  
Kathor, Puri, Dal, Rice  
Papad, Pickle, Kachumber

Franchise  
Opportunity  
in GTA

Call us for details

રસોઈકામ  
કરી શકે તેવા  
બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

**રાજકોટમાં  
જમીન  
કૌભાંડ**

# પૂર્વ CM રૂપાણી-ભાજપ નેતા સામે આક્ષેપનો મુદ્દો કોર્ટમાં, કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ માનહાનિનો દાવો

નીતિન ભારદ્વાજે કોર્ટના દ્વાર ખટખટાવ્યા : ઝોન ફેરના નામે 500 કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનો આક્ષેપ

**રાજકોટ**

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટથી ભાજપના નેતા નીતિન ભારદ્વાજ પર 500 કરોડ રૂપિયાના કથિત કૌભાંડનો મામલો આખરે કોર્ટમાં પહોંચ્યો છે. રાજકોટ ભાજપના નેતા નીતિન ભારદ્વાજ દ્વારા કોર્ટમાં ડેફરમેશનની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વિધાનસભામાં વિપક્ષ નેતા સુખરામ રાઠવા તેમજ કોંગ્રેસના

ધારાસભ્યો સીજે ચાવડા અને શૈલેષ પરમાર દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા નીતિન ભારદ્વાજ પર 500 કરોડ રૂપિયાની જમીનમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

જો કે વિજય રૂપાણીએ પલટવાર કરતાં કહ્યું કે, તેમણે મુખ્યમંત્રી રહેવા દરમિયાન અબજો રૂપિયાના કામ કર્યા છે અને તેમાં કોઈ આરોપ નથી લાગ્યો. કોંગ્રેસ જે કૌભાંડની વાત કરી

રહી છે, તે જમીનની કિંમત માત્ર 75 કરોડ રૂપિયા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ આરોપ છે કે, રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં નવાગામ, આનંદપુર, મલિયાસણ વગેરે ગામની 111 એકર જમીનનો સમાવેશ કરવામાં રૂપાણીએ 500 કરોડ રૂપિયાની ગેરરીતિ આચરી છે.

વિધાનસભામાં નેતા વિપક્ષ સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર, દંડક સીજે ચાવડા સહિતના નેતાઓએ

આરોપ લગાવ્યા છે કે, રાજકોટમાં ઝોન પરિવર્તનના નામે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના વિશ્વાસુ નીતિન ભારદ્વાજ સહિતના નેતાઓએ 500 કરોડ રૂપિયાની જમીનનું કૌભાંડ આચર્યું છે. જો કે હવે નીતિન ભારદ્વાજે પણ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. તેમણે સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને દંડક સીજે ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓ પર માનહાનિનો દાવો માંડ્યો છે. તેમના વકીલનું કહેવું છે કે, કોંગ્રેસ

નેતાઓ દ્વારા માફી નહી માંગવામાં આવતા તેમના વિરુદ્ધ દાવો કરવામાં આવ્યો છે. હકીકતમાં તેમણે કરેલા આક્ષેપ અનુસાર તે જમીનની કિંમત 500 કરોડ રૂપિયા નથી.

અગાઉ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, રૂપાણી-ભારદ્વાજની માફી માંગવાનો સવાલ જ નથી થતો. અમે જે કોઈ આક્ષેપ કર્યા છે, તે રેકોર્ડ અને પુરાવાના આધારે જ કર્યા છે.

## રાજકોટના પાટીદાર આગેવાન, ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરતાં ખળભળાટ

**રાજકોટ**

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નામના ધરાવતા કડવા પાટીદાર આગેવાન અને સૌરાષ્ટ્રની જાણીતી યુ.વી. કલબ સંસ્થાના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. એડવોકેટ અને પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ અંતિમ ચિટ્ટીમાં ખૂબ જ ગંભીર આક્ષેપો કરીને આત્મહત્યા કરી લીધી છે.

આત્મહત્યા પહેલા તેમણે એક પ્રેસનોટ લખી હતી જેમાં આત્મહત્યા



પાછળ જવાબદાર તરીકે રાજકોટ શહેરના બિલ્ડર એમ એમ પટેલ, અમિતભાઈ ચૌહાણ,

અતુલભાઈ મહેતા તેમજ અમદાવાદના ઓઝોન ગ્રુપના જયેશ કુમાર કાંતિલાલ પટેલ, દિપક મણિલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રાણય કુમાર કાંતિલાલ પટેલ નામના વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે.

ચિટ્ટીમાં તેમણે જમીનમાં પૈસા

અટવાયા હોવાનો ઉલ્લેખ કર્યો છે અને તેમની આત્મહત્યાના સમાચારને લઈ સૌરાષ્ટ્રમાં હાહાકાર વ્યાપ્યો છે. તેમના આપઘાતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા.

આજે સવારે 10:00 વાગ્યાની આસપાસ તેઓ સવારે ઘરેથી નીકળ્યા અને ઓફિસ પહોંચ્યા હતા. જોકે ઓફિસમાં કોઈ સ્ટાફ આવે તે પહેલા જ તેમણે મોતને વ્હાલુ કર્યું હતું. તેમણે પહેલા ઝેરી દવા ગટગટાવી હતી અને ત્યાર બાદ ગળે ફાંસો લગાવ્યો હતો.

## ભાવનગરની ડિસ્ટ્રીક્ટ બેંકની ચૂંટણીમાં પણ કોંગ્રેસને પછડાટ

**ભાવનગર**

ભાવનગરમાં 13 વર્ષ બાદ યોજાયેલી ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ચૂંટણીમાં આજે ભાજપે કુલ 16 બેઠકો પૈકી 13 બેઠકો પર જીત મેળવી ભગવો લહેરાવ્યો હતો. લાંબા સમયથી કોંગ્રેસની પેનેલનું આ બેંક પર આધિપત્ય હતું, જેમાં આખરે કોંગ્રેસને પોતાની સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. સાવરકુંડલા અને જેસર બેઠકના ભાજપના ઉમેદવારો તેમજ ખ વિભાગના કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા બનતા 13 બેઠકો માટેની ચૂંટણીના પરિણામો જાહેર

થયા હતા. ઘોઘા અને ભાવનગરની ઘ વિભાગની બેઠકને બાદ કરતા બાકીની તમામ 12 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. એટલે કે કુલ 16 બેઠક પૈકી 13 ભાજપ અને 3 કોંગ્રેસને ફાળે ગઈ હતી. વર્તમાન ચેરમેન નાનુભાઈ વાઘાણી અને તેના પુત્રને પણ હારનો સામનો કરવો પડ્યો હતો, જેમના નેજા હેઠળ આ ચૂંટણી ભાજપે લડી હતી તે ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી હવે ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકના નવા ચેરમેન બનશે. જયારે હારની સાથે જ કોંગ્રેસે હારનું ઠીકરું અધિકારીઓ પર ફોડ્યું હતું.

# THANK YOU FRONTLINE WORKERS



**MORTGAGE DILIGENT**  
A STEP AHEAD

FSRA # 10252

⇒ Purchase ⇒ Refinance ⇒ Renewal/Switch

**5 Yrs Fixed @ 1.84%\* High Ratio Only**  
**5 Yrs Variable @ 1.15%\* High Ratio Only**  
**3 Yrs Variable @ 0.99%\* (Special Promotion)**



**Rakesh Patel\*\***  
Vice President- Commercial.



**Pranay Jani \***



**Nilesh Tailor \***



**Bala Shah\***



**Vijay Rana\***



**Rajesh Khurana, MBA**  
Principal Broker

**Cell : 416-616-1300**

Tel.: 289 521 6900

1305 Matheson Blvd E, Mississauga ON L4W 1R1

• info@mortgagediligent.com • www.mortgagediligent.com

Rates are subject to change without notice.\* FSCO#10252,OAC,E&O.E \* - Mortgage Agent, \*\* - Vice President

\* Some conditions apply

## શીલીમાં અથડામણ, પથ્થરમારો વાહનોમાં તોડફોડ, 2 ઈજાગ્રસ્ત

બેકાબૂ ટોળાએ બે પોલીસ જવાનને ઘેરીને માર માર્યો, સ્થિતિ વણસતા SOG સહિતની પોલીસ કાફલો ખસકાયો

આણંદ

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી ગામે સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી ડી.જે.ના તાલે ભગવાન શિવજીની શોભાયાત્રા નીકળી હતી. ત્યારે શોભાયાત્રા આશાપુરા માતાજીના મંદિર નજીક પહોંચતા ડી.જે.ના સંચાલક બહાદુરસિંહે સંવેદનશીલ ગીત વગાડતા ચૌહાણ જ્ઞાતિના લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને મામલો ગરમાયો હતો. ઘડીભરમાં ચૌહાણ તથા પરમાર જ્ઞાતિના બે જૂથ સામસામે આવી ગયા હતા અને લાકડીઓ તથા ડંડા વડે સામસામે મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. ધીમે ધીમે ટોળુ બેકાબુ બનતા ખંભોળજ પોલીસના પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે મામલો વધુ ગરમાતા બંને જૂથોએ એકબીજા ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેને લઈ ભોરે નાસભાગ મચી ગઈ હતી. દરમ્યાન પાંચ જેટલા શખ્ષોએ સ્થળ ઉપર હાજર ખંભોળજના



પોલીસ કર્મી સલીમ જાવેદને ઘેરી લીધા હતા અને લાકડીઓ સાથે તુટી પડી માર મારતા માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ટીયરગેસનો ઉપયોગ કરી પાંચ સેલ છોડતા નાસભાગ મચી હતી અને પોલીસે કેટલેક અંશે કાબુ મેળવ્યો હતો. બીજી તરફ પોલીસે ઘટના સ્થળેથી પોલીસકર્મી ઉપર જીવલેણ હુમલો કરનારા સહિત ૩૫ શખ્ષોની અટકાયત કરી હતી. સમગ્ર શીલી ગામમાં યુસ્ત બંદોબસ્ત તેનાત કરી બંને જૂથના મળી કુલ ૫૨ શખ્ષો વિરૂધ્ધ રાયોટીંગનો ગુનો નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો હતો.

## વડોદરામાં ગુમ કોંગ્રેસી નેતાના પુત્રની લાશ મળી

વડોદરા: સાવલી તાલુકામાં કોંગ્રેસી નેતાનો પુત્ર રહસ્યમય રીતે ગુમ થયો હતો, જેની નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. સાવલી તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને ક્ષત્રિય સમાજના અગ્રણી વિજયસિંહ વાઘેલાનો ૨૨ વર્ષીય પુત્ર બે દિવસથી લાપતા ચર્ચાનો વિષય બન્યો છે. બે દિવસ પહેલા મંજુસર જીઆઈડીસીમાં જેસીબી લઈને પોતાની સાઈટ પર માટી કામ કરાવવા ગયા બાદ વિજયસિંહ વાઘેલાનો પુત્ર કુલદીપસિંહ વાઘેલા અચાનક ગુમો થયો હતો.

આ ઘટનામાં ભાદરવા પોલીસે પ્રેમપ્રકરણ, અપહરણ અને અંગત અદાવત કે ધંધાકીય હરિફાઈ સહિત તમામ ચિયરીને ધ્યાનમાં યુવકની શોધખોળ શરૂ કરી હતી. સાવલીના મંજુસર ગામેથી કોંગ્રેસ નેતાનો ૨૨ વર્ષીય પુત્ર કુલદીપસિંહ વાઘેલા ગુમ થયાના મામલે તેની લાશ તળાવમાંથી મળી આવી છે. અલીન્દ્રા ઝુમકાલ ગામની સીમમાં આવેલ તળાવમાંથી કુલદીપસિંહ વાઘેલાની લાશ મળી આવી હતી.

## રાધનપુર પાલિકાના પ્રમુખને દૂર કરવા કોંગ્રેસી સદસ્યોની માંગણી

રાધનપુર નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારને લઈને વિવાદોમાં ઘેરાયેલી છે. પાલિકામાં શાસક પક્ષના સદસ્યોનો વિરોધ વધતા રજા ઉપર ગયેલા પાલિકા પ્રમુખ ધારાસભ્યની સૂચનાની અવગણના કરી હાજર થઈ કોન્ટ્રાક્ટરને ઘન કચરાનું બિલ ચૂકવી દેતા પ્રમુખ સામે સત્તાધારી સદસ્યોમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે.

રાધનપુર નગરપાલિકાના પ્રમુખ મહેશ અદા દ્વારા સાથી સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવતા હોવાની સાથે સદસ્યોની ભુમરાડો વચ્ચે ધારાસભ્ય રઘુભાઈની સૂચનાથી નગરપાલિકાના પ્રમુખને એક માસ માટે રજા ઉપર ઉતારવામાં આવ્યા હતા. જ્યારે એક માસ બાદ ધારાસભ્ય કે સાથી સદસ્યોને જાણ કર્યા વગર પ્રમુખ પાલિકામાં હાજર થયા હતા. અને પાલિકામાં

પ્રમુખ હાજર થયા બાદ ખૂબ જ વિવાદિત ઘન કચરાના કોન્ટ્રાક્ટરને બિલ ચુકવવામાં આવ્યું હતું. પાલિકાના પ્રમુખે કોન્ટ્રાક્ટરને ઘન કચરાની કામગીરીમાં ૧૦ ઘણી કિંમતનું ટેન્ડર બહાર પાડી ૯૮ લાખનું બિલ ચુકવણું કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સત્તાધારી પક્ષના સદસ્ય દ્વારા થયા હતા.

સામાન્ય સભામાં પણ ભાજપ અને કોંગ્રેસના સદસ્યોએ ઘનકચરાના બિલ બાબતે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારથી પાલિકામાં સત્તાધારી સદસ્યો દ્વારા પ્રમુખ હટાવો ગુંબેશ શરૂ કરવામાં આવી છે. પાલિકાના કોંગ્રેસ સદસ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રમુખ દ્વારા કોઈ પણ સદસ્યને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. જેને લઈને પ્રમુખ સામે તમામ સભ્યો વિરોધમાં છે અને જો પાલિકા પ્રમુખને હટાવવામાં નહીં આવે તો પાલિકામાં નવાજૂની થશે તેવું પણ સભ્યોએ જણાવ્યું હતું.

## બનાસકાંઠામાં જળ સંકટથી ખેડૂત ત્રસ્ત, વિધાનસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી

7 માર્ચે 5 હજાર ખેડૂતો 100 ટ્રેક્ટર સાથે પાલનપુરમાં રેલી યોજી દેખાવો કરશે

પાલનપુર

બનાસકાંઠા જિલ્લામાં ઘેરા બની રહેલા જળસંકટને નિવારવા જન આંદોલનના મંડાણ થયા છે. જેમાં પાલનપુર તાલુકાના કોટડા ગામે પચાસ ગામના ખેડૂતોની બેઠક મળી હતી. જેમાં જળ સંકટ મામેલ આગામી સમયમા ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી.

પાલનપુર તાલુકાના મલાણા ગામ સહિત આજુબાજુ પચાસ જેટલા ગામમો ભૂગર્ભ જળ સ્તર ઉડા જઈ રહ્યા હોય સિંચાઈ અને પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. આ પંથકમાં જળ સંકટ ઘેરું બનું રહ્યું હોય જળ સંકટની સમસ્યાના કાયમી નિરાકરણ માટે રવિવારે ૫૦ ગામના આગેવાનોએ બેઠક યોજી હતી. જેમાં આગામી તા.૭ માર્ચે ના

રોજ એક સો ટ્રેક્ટરોમાં પાંચ હજાર લોકો જોડાઈ પાલનપુર શહેરમાં રેલી યોજી સરકારને જગાડવાનો પ્રયાસ કરશે અને જો સરકાર ખેડૂતોના પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહીં સાંભળે તો મલાણા પંથકના પચાસ ગામના ખેડૂતો આગામી સમયમાં યોજનાર વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘના પ્રમુખ માવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, મલાણા વિસ્તારના જળ સંકટના કાયમી ઉકેલ માટે આગામી તા.૭ માર્ચે પાંચ હજાર ખેડૂતો સો ટ્રેક્ટર સાથે પાલનપુરમાં રેલી યોજશે. તેમ છતાં તેમની માંગણી નહિ સંતોષાય તો આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો ચીમકી ઉચ્ચારમાં આવી હતી.

## મેઘરજમાં ડિટોનેટર બાંધી પત્નીને ભેટી પતિનો આત્મઘાતી વિસ્ફોટ, બંનેના મોત

પુત્ર ઘરની બહાર હોવાથી બચ્યો, એસપી સહિતનો કાફલો દોડી આવ્યો

મોડાસા

મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામે પીયરમાં રહેતી પત્નીને ડિટોનેટર વીંટાળી વિસ્ફોટ કરી મોતને ઘાટ ઉતારતા ચક્રચાર મચી ગઈ હતી. વેદડીંગના વ્યવસાય સાથે સંકળાયેલા આ શખ્સ પત્ની શારદાબેનને અવાર નવાર મારઝૂડ કરી માનસિક ત્રાસ આપતાં પત્ની સહિત પુત્ર અને સૌ ત્રસ્ત બન્યા હતા. છેલ્લા ૧૦ વર્ષથી અપાતા આ શારિરીક અને માનસિક ત્રાસથી કંટાળી પોતાના ૧૭ વર્ષના પુત્રને લઈ પીયર ચાલ્યા જતાં સમાજના અગ્રણીઓને વચ્ચે રાખી સમાધાન થયું હતું. શારદાબેન વર્ષ ૨૦૧૮માં સાસરી મુલોજ

ગામે પરત આવ્યા હતા. પરંતુ દોઢ માસ અગાઉ દારૂડીયા પતિએ કુહાડી લઈ પોતાના પુત્ર ઉપર હુમલો કરતાં પત્ની શારદાબેન અને કોલેજમાં અભ્યાસ કરતાં ૨૧ વર્ષીય પુત્ર અનીલ સાથે આ પરણિતા પીયર બીટી છાપરા ગામે આવી ભાઈઓ જોડે શાંતીથી રહેતા હતા.

પત્નીના ચારીત્ર ઉપર પહેલીથી વહેમાતા અને દારૂની લતે ચડેલા આ વેલર એવા પતિએ ક્યાંકથી ડિટોનેટર મેળવ્યો હતો. જે બાદ શરીરે ડિટોનેટર વાયર સાથે વીંટાળી પોતાની પત્ની શારદાબેનને બાથે પડી વિસ્ફોટ કરતાં ધડાકો થતાં પતિ અને પત્નીના કૂચ્યે કૂચ્યા ઉડયા હતા.

# Imperial

## PEST CONTROL

Residential • Commercial • Industrial

**24 Hour Service • 7 Days a Week**

Preventing the Spread of COVID-19 :  
Our disinfectant services that we offer are:

**1 Spray Services**

**2 Fogging Services**

**3 Sanitation Services**

**All Pest Control:**

Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants.  
Total Interior & Exterior Pest Control

**Removal:**

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornests, Yellow Jackets

First Time Customer gets

### 10% Off

on your first home service

\*Mention this offer while booking

Free Estimates & Written Guarantee

Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca  
info@imperialpestcontrol.ca  
(We speak English, हिन्दी, ગુજરાતી)

## Call: Ramesh Kanani 416-837-1820

## સ્વદેશ CANADA

Registration # 869127209  
Publication Mail Agreement /  
Email : info@swadesh.news

**WWW.SWADESH.NEWS**

Return Undeliverable Canadian Address To :

**Shree Balaji Inc.**  
**MAILING ADDRESS**  
23 Lyric Road,  
Brampton ON L6S 0B4.  
416-996-7755

**Registered Address**  
713, Markham Road, Scarborough M1H 2A8.

Editor & Publisher : Manoj Gandhi  
Director : Nilesh Tailor  
Sub Editor : Chhaya Gandhi  
Montreal Bureau : Vijay Patel (514-826-7442)

**GUJARAT OFFICE MAC AGENCIES :** F-9, Jolly Square, Ram Chowk, Ghod-Dod Road, Surat – 395 001. GUJARAT ( INDIA)

Designed By  
Sabir Daroga  
Mevada Piyush  
Firoz Shaikh

Disclaimer : Swadesh is a weekly newspaper published by Shree Balaji Inc. in Gujarati Language. The opinions expressed in Swadesh may not be those of the publisher. Contents of this publication are covered by copyright and offenders will be prosecuted under the law.





# મહાશિવરાત્રિએ ભવનાથમાં 7 લાખ ભાવિકો ઊમટ્યાં

મેળાનું ધર્મોલ્લાસ સાથે સમાપન, સાધુઓની ભવ્ય રવેડી, મૃગીકુંડમાં દિવ્ય સ્નાન

## જૂનાગઢ

જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં યોજાયેલ પાંચ દિવસીય મહાશિવરાત્રિ મેળાનું મંગળવારે રાતે નાગા સાધુઓની રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ ધર્મોલ્લાસ માહોલમાં સમાપન થયું હતું. જેમને દુનિયાદારીનો કોઈ ભય નથી અને સમાજને આધ્યાત્મિકતાના માર્ગે ચલાવવો છે, તે દિગંબર સાધુનો અવતરણ સનાતન હિન્દુ ધર્મની રક્ષા માટે થયેલ છે. ભવનાથનો શિવરાત્રિનો મેળો જેમાં નાગા સાધુઓની દિવ્ય અને ભવ્ય રવેડીએ માત્ર સાધુઓના દર્શન પૂરતો સીમિત નથી. પરંતુ સનાતન

હિન્દુ ધર્મની રક્ષા કાજે એક શક્તિ સ્ત્રોત છે. આ રવેડીના દર્શનથી ભાવિક સાધુઓ સંસ્કૃતિના રક્ષણ જનતા માટે એક સર્મિપત એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો ખડેપગે હોવાની સમર્થતાનો અહેસાસ કરે છે. રવેડીના દર્શન માટે આવેલા લાખો શ્રદ્ધાળુઓ બપોરથી રૂટ ઉપર બેસી ગયા હતા. પોલીસે રવેડી રૂટ પર બંદોબસ્ત ગોઠવી દીધો હતો. રાતે નિયત સમયે ભવનાથ તીર્થક્ષેત્રમાં આવેલા મુખ્ય ત્રણ અખાડાના સાધુ સંતોએ પૂજન અર્ચન કરી પોતાના અખાડાની ધર્મ ધ્વજા સાથે રવેડી રૂટ ઉપર નીકળ્યા હતા. ત્રણેય

મુખ્ય અખાડાના ઈસ્ટેવનીપાલખીયાત્રા નીકળી હતી, રવેડી જુના અખાડા ખાતેથી શરુ થઈ મંગલનાથ આશ્રમ, દત ચોક, પ્રવાસન ગેઈટ, આપાગીગાનો ઉતારો, ભારતીઆશ્રમ થઈને ભવનાથ મંદિરે પહોચી હતી. 5 દિવસના મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે 7 લાખ કરતા વધુ ભાવિકો ઊમટી પડ્યા હતા. લાખો ભાવિકોએ શિવરાત્રિ નિમિત્તે ભવનાથ મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભરડાવાવથી જ ઈમરજન્સી સેવા સિવાયના તમામ પ્રકારના વાહનોને સવારના 10 વાગ્યાથી નો એન્ટ્રી કરી દીધી હતી.



## ભાવનગરમાં જેલમાં હત્યા કેસના 4 કેદીનો જેલર-સુબેદાર પર હુમલો

ભાવનગર

ભાવનગર જેલના ઈન્ચાર્જ જેલર બાબુભાઈ સી. સોલંકીએ નિલમબાગ મથકમાં કાચા કામના કેદી તરીકે રહેલ નિહાલ ગુલામઅબ્બાસ ભુરાણી, નિશાંત નિહાલભાઈ ભુરાણી, જહીરઅબ્બાસ વઝીરભાઈ ભુરાણી, નૌશાદ ગુલામઅબ્બાસ ભુરાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, કેદીઓને શિસ્તબદ્ધ બેસવા માટે જિલ્લા જેલના જનરલ સુબેદાર જયદેવસિંહ ગોહિલે કહ્યું હતું કે, આ સમયે કેદીઓએ અમે રાજકીય વગ ધરાવીએ છીએ અને પૈસાવાળા છીએ, અમારૂં કોઈ પણ કાંઈ બગાડી શકે તેમ નથી તેમ કહી તેની તેમજ જનરલ સુબેદાર જયદેવસિંહ ઉપર ઘાતક હુમલો કરી ફરજ પરના જેલના સ્ટાફ સાથે ઝપાઝપી કરી હુમલો કર્યો હતો.

## ચોટીલાના ઝીંઝુડા ગામે બનેલા હત્યા કેસમાં આર્મીમેન સહિત 5 સામે ગુનો

8 માસ પૂર્વે થયેલા હત્યાના ઝીંઝુડાના આરોપીનું ઢીમ ઢાળી દીધું હતું

ચોટીલા

ચોટીલાના ઝીંઝુડા ગામે રહેતા શખ્સની સોમવારે ચોટીલા-થાન રોડ પર આવેલ ભરચક બજારમાં છરીના ઘા ઝીંકી અને 2 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરી દેવાઈ હતી. 8 માસ અગાઉ થયેલ હત્યા કેસમાં વેરનો બદલો વેરથી વાળવા માટે હત્યા કરાઈ હતી. ઝીંઝુડાના 45 વર્ષીય ખેડૂત ધર્મેન્દ્રભાઈ શાંતુભાઈ ખાચરને 8 માસ પહેલા ગામના જ માવજીભાઈ વીરજીભાઈ ગાંગડીયા સાથે બોલાચાલી થતા ધર્મેન્દ્રભાઈએ પાઈપથી માર સારવાર

બાદ મોત થયું હતું. ઝીંઝુડામાં માથાકુટ થવાની શક્યતાને લીધે ધર્મેન્દ્રભાઈ છેલ્લા ત્રણ માસથી ચોટીલા તેમના સગા કાળુભાઈ રામભાઈ ધાધલના ઘરે રહેતા હતા. ધર્મેન્દ્રભાઈ અને કાળુભાઈ પરત આવતા હતા. જેમાં બાઈક ધર્મેન્દ્રભાઈ ચલાવતા હતા. ત્યારે અચાનક બે બાઈકમાં આવેલા ચાર શખ્સોએ છરીના 10 ઘા ઝીંક્યા હતા. આરોપીઓમાં લખમણ ગાંગડીયા, રાયધન ઉફે ભાદા ગાંગડીયા, ભુપત ગાંગડીયા, અનક ગાંગડીયા, વીનુ ગાંગડીયાનો સમાવેશ થાય છે.

## નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા આમ આદમી પાર્ટીના ભારે પ્રયાસો

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છની 58 પૈકી આશરે 20 બેઠક પર પાર્ટીદાર મતો નિર્ણાયક છે ત્યારે ખોડલધામના પ્રમુખ અને પાર્ટીદાર મતો પર પ્રભુત્વ ધરાવતા હોવાનું મનાય છે તેવા નરેશ પટેલને આમ આદમી પાર્ટીમાં લેવા ભરપૂર પ્રયાસો હાથ ધરાયા છે. આપના અગ્રણી અજીત લોખિલ અને પ્રદેશ પ્રભારી તથા દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ તાજેતરમાં આ મુદ્દે નરેશ પટેલને મળી ગયાનું જાણવા મળ્યું છે તો આજે આપના પ્રવિણ રામ અને નિખીલ સવાણીએ પણ તેમની મુલાકાત કરી હતી. આ પહેલા કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ ખોડલધામ પ્રમુખ સાથે બંધબારણે બેઠક ચોક્કસ યૂક્યા છે હાલ આપના નેતાઓએ બેઠકને ઔપચારિક ગણાવી છે.

## ધોરાજીમાં ટોળાએ સરાજહેર પોલીસ ટીમ પર હુમલો કર્યો, ત્રણ ઈજાગ્રસ્ત

ધોરાજી

ધોરાજી રેલવે સ્ટેશન નજીક આનંદનગર વિસ્તારના યશ અને એરીક એપાર્ટમેન્ટના લોકો સાથે ૭થી ૮ આવવા તત્વો મારામારી કરતા હતા ત્યારે તેમને છોડાવવા માટે ગયેલી પોલીસપાર્ટી પર હુમલો કરી ઘાયલ કરી નાખતા પોલીસ બેડામાં સનસનાટી મચી ગઈ હતી. આ ઘટનામાં 3 પોલીસમેનને ઈજા થઈ છે. જેમાં એકને કાન પાસે ટાંકા લેવા પડ્યા છે.

આ બનાવની જાણવા મળતી વિગતો એવી છે કે અહીંના રેલવે સ્ટેશન પાસે ખુલ્લામાં રહેતા અને ભીક્ષાવૃત્તિ કરતા લોકોનું ટોળું એપાર્ટમેન્ટના લોકો સાથે ઝઘડો કરી મારામારી કરતું હતું. એ વખતે પોલીસને કોલ આવતા ડી-સ્ટાફના

એ.એસ.આઈ. રમેશભાઈ કાળાભાઈ બોદર પોલીસપાર્ટી સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ આવતાંની સાથે જ ટોળું વિખેરાઈ જવાને બદલે ટોળાએ ગેરવર્તન ચાલુ કરી દીધું હતું અને એ.એસ.આઈ.એ સંયમ રાખી સમજાવવાની કોશિષ કરી હતી. પરંતુ કુંડલીવાળી લાકડીધારી ટોળાએ પોલીસપાર્ટી સ્ટાફના પરબત પંપાણીયાને લાકડીઓ ફટકારી દીધી હતી. તેને વધુ માર ન પડે એ માટે બચાવવા એ.એસ.આઈ. રમેશભાઈ બોદર ઉપર પણ લાકડીથી હુમલો કર્યો હતો. તેમજ કોન્સ્ટેબલ બાપાલાલ ચુડાસમાને ધક્કે ચડાવી તેને પછાડી દઈ આ ભીક્ષુકો તેના ઉપર બેસી ગયા હતા. તેમજ જોરથી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.

## ભાજપે નાના વેપારોને ભાંગી નાંખીને ગુજરાતની તાકાત તોડી : રાહુલ ગાંધી

દ્વારકામાં યોજાયેલી કોંગ્રેસની શિબિરમાં રાહુલના ભાજપ પર પ્રહારો

રાજકોટ

ગુજરાત ધારાસભા-૨૦૨૨ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે દ્વારકામાં યોજાયેલી કોંગ્રેસની ત્રિદિવસીય શિબિરમાં આવ્યા હતા અને કોંગ્રેસ ક્યા માર્ગે આગળ વધવ માંગે છે તે સ્પષ્ટ કરીને લાગલગાટ મળતી હારથી નિરાશ નહીં થવા કોંગ્રેસના પ્રદેશ નેતાઓને હાકલ કરી હતી. જીએસટી, નોટબંધી, કોરોનામાં બેદરકારીથી ભાજપે ગુજરાતની કરોડરજીત તોડી નાંખી છે, વિશ્વભરમાં ગુજરાતીઓ ફેલાયેલા છે, તેમની તાકાત નાના-મધ્યમ વેપાર ધંધા, ઈનોવેશનને

ભાંગી નાંખી ભાજપે ગુજરાતીઓની તાકાતને તોડી નાંખી છે. ગુજરાતમાં ઓકસીજન અને સારવારના અભાવે ૩ લાખ લોકો કોરોનામાં મોતને ભેટ્યા.

તેમણે કહ્યું કોંગ્રેસમાં નહેરુ, સરદાર, બોઝ ઘણા છે પણ વ્યુહાત્મક દિશાસૂચન આપનાર એક ગુજરાતી, મહાત્મા ગાંધીજી છે. આજે પણ તેઓ કોંગ્રેસના રાજનીતિક ગુરુ છે. આપણે ગાંધીના માર્ગે જ ચાલવાનું છે. પચીસ વર્ષ સુધી ભાજપ સામે હું અહીં ગુજરાતમાં હોઉં તો મારા આત્મવિશ્વાસને પણ થોડો ધક્કો પહોંચે પણ આ ચૂંટણી તમે જીતેલા જ છો, બસ આ વાતને સ્વીકારવાની જરૂર છે.



**First Flight**  
FFCL Couriers Inc.

દુનિયાના કોઈપણ દેશમાં ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ મોકલવા માટે પણ સેવા ઉપલબ્ધ

તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ

<p>1 LB \$20 વધુ દર LB ના \$6 11 LB \$55 વધુ દર LB ના \$6 23 KG \$185, વધુ દર KG ના \$10 30 KG \$230, વધુ દર KG ના \$10</p>	<p>ખાવા-પીવાની વસ્તુ USA મોકલવા માટે FDA ની એપ્રુવલ અમે કરી આપીશું (Extra Charge)</p>
---	---

જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની હવે તમારી સેવા માટે ત્રણ શાખાઓ

<p><b>Brampton (West)</b> 519, Ray lawson boulevard, Unit-3, Brampton ON L6Y 0N2 Chandni Chowk Plaza, ATN Wireless Board Door Open Last Unit Ours Phone 647-761-1317, 647-657-9631 -----: MON-FRI : ----- 11.00 AM to 7.00 PM : SAT-SUN : 1.00 PM to 6.00 PM</p>	<p><b>Scarborough</b> WE ARE RE-OPENING 880 Markham Road, Unit-8 Main Intersection Markham Road &amp; Painted Post, Near Saileela Khaman-Dhokla House Complex, Phone 647-761-1317 647-657-9631 905-673-9631 -----: MON-THU : ----- 2.00 PM to 7.00 PM FRIDAY WEEKLY OFF : SAT-SUN : 11.00 AM to 6.00 PM</p>	<p><b>Mississauga</b> WE MOVED TO 6800 REXWOOD ROAD, UNIT - D : Phone : 905-673-9631 647-761-1317 647-657-9631 -----: MON-FRI : ----- 9.30 AM to 5.00 PM</p>
--	---	--

૬૪૭-૭૬૧-૧૩૧૭ [www.firstflightcanada.com](http://www.firstflightcanada.com)





## લેડી ગાગાએ યૂકેનને કર્યો સપોર્ટ

મુંબઈ : હાલ રશિયા અને યુકેન વચ્ચે લડાઈ ચાલી રહી છે. તેવામાં અમેરિકન સિંગર અને અભિનેત્રી લેડી ગાગાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની આલોચના કરી છે. લેડી ગાગાએ સેગ એવોર્ડ્સ ૨૦૨૨ માટે ટેડ કારપેટ પર યૂકેનના યુદ્ધ પીડિત નાગરિકોનો સપોર્ટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, દુનિયામાં ઘણું બધું થઈ રહ્યું છે અને હું યૂકેન માટે દુખી છું. મને લાગે છે કે આજે રાતે આપણે યૂકેનનું સમ્માન કરવું જોઈએ. આ સાથે જ લેડી ગાગાએ સોશયલ મીડિયા પર પોતાના એવોર્ડ ફંક્શનની તસવીર શેર કરી હતી.



## એ પળોને મન ભરીને માણી લઉં છું: યામી

યામી ગૌતમ લગ્ન પછી નવી ફિલ્મો-સિરીઝના પ્રોજેક્ટમાં સતત વ્યસ્ત છે. હાલમાં જ તેની ફિલ્મ એ થર્સડે આવી હતી. જેમાં તેની ભુમિકાના સૌએ વખાણ કર્યા છે. યામી કહે છે હું હું હું ઝડપથી લોકોના હાવભાવ પકડી શકું છું. થોડો સમય કોઈની સાથે સમય વિતાવું તો તેની કોપી સરળતાથી કરી લઉં છું. મને પહાડો સાથે વાતો કરવી ગમે છે. એવા લોકેશનના પળોને મન ભરીને માણી છું. મને ફિટનેસ સંબંધી કંઈ ને કંઈ કરવું ગમે છે. આ માટે હું અગાઉ પોલો ડાન્સ પણ શીખી હતી. લોકડાઉનમાં મેં યોગ પણ ખુબ કર્યા છે. ખુબ પાણી પીવાથી અને ખુશ રહેવાથી સુંદરતા પણ નીખરતી હોય છે. યામી કહે છે આમ તો મારી કારકિર્દીમાં મેં ભજવેલા તમામ પાત્રો મને પસંદ છે. પણ થર્સડે ફિલ્મમાં મેં ભજવેલી નૈનાની ભુમિકાથી અલગ જ અનુભવ થયો હતો. જે પ્રકારની લાગણી હતી એ મારે અકબંધ રાખવાની હતી. એ ભુમિકામાંથી બહાર આવતાં મને ખુબ સમય લાગ્યો હતો.



## સામંથાએ ડિવોર્સ બાદ 'સૌથી ભયાનક સ્થિતિઓમાંથી પસાર થવા' અંગે પોસ્ટ કરી

મુંબઈ: ગયા વર્ષે ચાહકોને સામંથા રુથ પ્રભુ અને નાગા ચૈતન્યના છુટાછેડાના સૌથી ખરાબ સમાચારનો સામનો કરવો પડ્યો. તેમની ચોથી લગ્નની વર્ષગાંઠ પહેલાં પૂર્વ દંપતીએ સંયુક્ત જાહેર નિવેદન બહાર પાડીને વધતી જતી અફવાઓને સત્તાવાર બનાવી દીધી હતી.

ચૈતન્યથી અલગ થયા બાદ સામંથા તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર સંદેશાઓ પોસ્ટ કરી રહી છે. મંગળવારે અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર સદગુરુનો એક વિડિયો શેર કર્યો, જેમાં તે કહે છે જો તમે ખૂબ જ ભયાનક પરિસ્થિતિઓમાંથી પસાર થાઓ છો, તો કાં તો તમે તે અનુભવનો ઉપયોગ કરીને વધુ સારા માનવ તરીકે બહાર આવી શકો છો અથવા એક ભયાનક ગડબડ બનવા માટે તમે અનુભવનો ઉપયોગ કરી શકો છો. ગયા મહિને સામંથાએ કહ્યું હતું કે તેને 2022 પાસેથી કોઈ અપેક્ષાઓ નથી કારણ કે તેની કાળજીપૂર્વક ગોઠવેલી યોજનાઓ 2021માં ભૂંટી ગઈ હતી.

તેણે તેના છુટાછેડાના પગલે અનુભવેલી ભાવનાત્મક વિનાશ વિશે પણ વાત કરી. સામંથા અને ચૈતન્યએ ઓક્ટોબર 2021 માં તેમના છુટાછેડાની જાહેરાત કરી અઠવાડિયાથી ફેલાયેલી અફવાઓનો અંત લાવ્યો. સામંથાએ કહ્યું 2021માં મારા અંગત જીવનમાં જે કંઈ બન્યું છે તેની સાથે મને ખરેખર કોઈ અપેક્ષા નથી. મારી બધી કાળજીપૂર્વક ગોઠવેલી યોજનાઓ ક્ષીણ થઈ ગઈ છે, તેથી ભવિષ્યમાં મારા માટે જે કંઈ પણ છે તેના માટે હું તૈયાર છું, હું તેને મારું સર્વશ્રેષ્ઠ આપીશ.

## ઋતિક-દીપિકા હોલીવૂડના સ્ટેટમેન્ટ પાસેથી તાલીમ લેશે

મુંબઈ : ઋતિક રોશન અને દીપિકા પદુકોણ આગામી ફિલ્મમાં સાથે જોવા મળવાના છે, જે એકશન દ્રશ્યોથી ભરપુર છે. આ ફિલ્મમાં ઓક્ટેન એકશન સીન્સ માટે હોલીવૂડના સ્ટેટમેન્ટથી તાલીમ લેવાના છે. એક રિપોર્ટના અનુસાર, ઋતિક રોશન અને દીપિકા પદુકોણ ફિલ્મ ફાઇટર માટે આંતરરાષ્ટ્રીય સ્ટેટમેન્ટ દ્વારા ટ્રેનિંગ લેવાના છે. ફિલ્મમાં એકશન સીન્સને હોલીવૂડના સ્ટેટમેન્ટ કોરિયોગ્રાફ કરશે અને



આ બંને કલાકારોએ સખત તાલીમ લેવી પડશે. આ ફિલ્મનું શૂટિંગ જુન મહિનાથી શરૂ થાય તેવી શક્યતા છે. આ ફિલ્મ એકશન પેકડ

ફિલ્મ હોવાથી શરીર પણ ફિટ અને મજબૂત હોવું જરૂરી હોવાથી તેની તાલીમ શરૂ થઈ ગઈ છે. રસપ્રદ છે કે, ફિલ્મ ફાઇટર ભારતની પ્રથમ એશિયન એકશન ફેન્સાઈમી ફિલ્મ છે. જેમાં ઋતિક રોશન અને દીપિકા પદુકોણ સાથે જોવા મળવાના છે. ઉપરાંત આ ફિલ્મમાં અનિલ કપૂર પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મમાં ઋતિક અને દીપિકા પ્રથમ વખત કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદનું છે.



## દરેક પ્રકારના રોલ મળી રહ્યા છે: રકૂલ

અભિનેત્રી રકૂલ પ્રિત સિંહે કહ્યું હતું કે મને દરેક પ્રકારની ભુમિકાઓ કરવાની તક મળી રહી છે એ માટે હું ખુશ છું. મારી આગામી ફિલ્મોમાં મને દર્શકો પાઈલોટની ભુમિકામાં જોઈ શકશે તો એ પછી એક પત્નિના રોલમાં હું જોવા મળીશ. આ સિવાય સાવ નોખી ભુમિકામાં પણ મને દર્શકો જોઈ શકશે. રકૂલની આવનારી ફિલ્મોમાં રનવે ૩૪, થેન્ક ગોડ, મિશન સિન્ડ્રેલા સહિતની સામેલ છે. રકૂલના ભાઈ અમનપ્રિતે સ્ટારિંગ યુ નામની એક એપ બનાવી છે. આ વિશે રકૂલ કહે છે કે આ એપ બોલીવૂડમાં સપનું પૂરું કરવા ઈચ્છતા લોકો માટે એક માધ્યમ બની રહેશે. હું મારા ભાઈને આ કામમાં સાથ આપી રહી છું. હાલ આ એપના ત્રીસ હજાર સબ્સ્ક્રાઇબર્સ છે. રકૂલની ફિલ્મ છતરીવાલી પણ રિલીઝ માટે તૈયાર છે. તે કહે છે આ ફિલ્મ સમાજને મહત્વનો સંદેશો આપશે. રકૂલ કહે છે મને સતત કામ કરતાં રહેવું ગમે છે. મને મોંઘી ગાડીઓનો ખુબ શોખ છે. મારી પાસે પાંચ કરેટનો ડાયમંડ પણ છે. મને પરફ્યુમ ખરીદવાનો ખુબ જ શોખ છે.

## ખુશી કપૂર બોલીવૂડમાં ડેબ્યુ કરશે

મુંબઈ : સ્વ. શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂર બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે. પિતા બોની કપૂરે આ વાતની પુષ્ટિ આપી હતી. રિપોર્ટના અનુસાર, ખુશી કપૂર, અગસ્ત્ય નંદા અને સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે. પુત્રી ખુશી જલદી જ શૂટિંગ શરૂ કરવાની છે આ વાતની પુષ્ટિ બોની કપૂરે આપી હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન બોની કપૂરે જણાવ્યું હતું કે, ખુશી એપ્રિલ મહિનામાં પોતાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની છે. હું આનાથી વધુ કંઈ જણાવી શકું એમ નથી. આ ફિલ્મ અને ખુશીના રોલ વિશે જલદી જ જાણકારી આપવામાં આવશે.

ઝોયા અખ્તરે ગયા વરસે નવેમ્બરમાં એક પોસ્ટ શેર કરીને પોતાની આવનારી ફિલ્મની જાણકારી આપી હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રજૂ થવાની છે. આ એક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ હશે.



**GUARANTEED ACCESS TO PRE-CONSTRUCTION CONDOS IN DOWNTOWN TORONTO & GTA CALL ME NOW!**

**BUY • SELL • INVEST**

**Nadir Shah**  
100% Professional, 0% Attitude Sales Representative MBA, ACEA (UK)

**416.625.3580**  
nadir.shah@sympatico.ca

4030, Sheppard Ave. East, Toronto, ON M1S 1S6  
T: 416.291.0929 (24/7) F: 416.291.0984

**CENTURY 21**  
Regal Realty Inc. Brokerage  
Member Broker

Not intended to solicit buyers or sellers already under a contract.





હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

 માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી  
 અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર શાણેશાણ માણો !!

 રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, સ્મતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ,  
 પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

[www.swadesh.news](http://www.swadesh.news)

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

[info@swadesh.news](mailto:info@swadesh.news)

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.

કોઈપણ સમસ્યાનો ઉકેલ યુદ્ધ નથી તે વાત દુનિયા હજી સમજી શકી નથી

# યુદ્ધ : આધુનિક જગતની સૌથી મોટી વિડંબણા

દુનિયામાં યુદ્ધની ભયાનકતા હવે કોઈને સમજાવવી પડે તેમ નથી. અત્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ સતત બોમ્બમારો અને મિશાઈલ છોડવાનું ચાલુ રાખતા આખી દુનિયા ચિંતાતૂર બની છે. યુદ્ધ જ્યારે થાય છે ત્યારે આખા દેશના લોકો પર તેનો ભય તોળાય છે અને તેનું નુકસાન અકલ્પનીય હોય છે. કેટલાક કિસ્સામાં તો તે ભરપાઈ પણ નથી થઈ શકતું. હિરોશીમા અને નાગાસાકીમાં બૉમ્બ ઝીકાયા પછી વર્ષો સુધી તેની અસર વર્તાઈ. અફઘાનિસ્તાન, સિરીયા અને ઈરાક જેવા દેશો પણ તેની અસરથી પૂરેપૂરા મુક્ત થઈ શક્યા નથી. યુદ્ધ થતા થતા નુકસાન અતિસમૃદ્ધ દેશો પણ ખમી શકતા નથી. અમેરિકા અને રશિયા જેવાં સુપરપાવર કહેવાતાં દેશો પણ નહીં. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ પછી જે રીતે વિશ્વએ તેની ખુંવારી જોઈ છે તે પછી કોઈ જ તે તરફ આગળ વધવાનું પસંદ કરતું નથી. પરંતુ વિશ્વયુદ્ધ પછી પણ કેટલીક વખત એવી સ્થિતિ સર્જાઈ અને તે પછી યુદ્ધ થયાં છે. માનવે તેનું નુકસાન ભોગવવું પડ્યું છે. જો કે, આ સ્થિતિ સાથે માનવે એટલું પણ સમજવું પડ્યું છે કે, યુદ્ધ એ કોઈપણ સમસ્યાનો ઉકેલ નથી. તેથી જ અંતે તેમાં વાતચીત અને સમાધાન તરફ આગળ વધવું પડે જ છે. હાલમાં રશિયા અને યુક્રેન પણ સંવાદની પ્રક્રિયામાં આગળ વધશે તેવી આશા હજી પણ જીવંત છે.

દુનિયાનો ઈતિહાસ તપાસીએ તો જાણીતી હસ્તીઓ યુદ્ધ વિરોધી રહી છે. ખૂબ જાણીતા મનોચિકિત્સક સિગમંડ ફ્રોઈડ યુદ્ધવિરોધી હતા અને તેમણે આ વિશે આલ્બર્ટ આઈન્સ્ટાઈનને એક પત્ર લખ્યો છે જે જાણીતો છે. આ પત્રમાં તેણે લખ્યું હતું કે, યુદ્ધ શા માટે? જે બાદ તેમણે તેની ભયાનકતાનું આલેખન પત્રમાં કર્યું હતું. સિગમંડ ફ્રોઈડનો આ પત્ર 'વિશ્વમાનવ' સામયિકમાં 1959ના નવેમ્બરના અંકમાં પ્રકાશિત થયો. પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે, આજની દુનિયામાં ન્યાય એ પશુબળના પાયા પર ઊભેલો છે, અને હિંસા દ્વારા જ નિભાવાઈ રહ્યો છે. એ સત્ય જો ભૂલી જઈશું તો આપણે આપણા તર્કમાં એક પગથિયું ચૂકી ગયા એમ ગણાશે." સિગમંડ ફ્રોઈડે યુદ્ધનો પ્રશ્ન રાજકીય ગણાવ્યો છે, પણ તેમણે આ પત્રમાં માનવજાતના ચાહક તરીકે આઈન્સ્ટાઈનને જવાબ આપ્યો છે. તેઓ લખે છે :

“પ્રત્યેક માણસને યુદ્ધની મહામારીનો ચેપ આટલી સહેલાઈથી શી રીતે લગાડી



શકાતો હશે? અને તમને લાગે છે કે, માણસ આવા ચેપનો આટલા જલદી ભોગ થઈ પડે છે, તેનું કારણ એ હોવું જોઈએ કે, એનામાં સ્વયંસ્ફૂર્ત એવી ધિક્કાર અને કૂરતાની વૃત્તિ પડેલી હોવી જોઈએ. જે તક મળતાં જ વિક્કરી ઊઠે છે.” સિગમંડ ફ્રોઈડ મનોચિકિત્સક છે અને તે માણસનું દિમાગ અન્ય કરતાં સારી રીતે પારખે છે. તેથી તેમનું સ્પષ્ટ તારણ છે કે, “ માણસજાતમાં રહેલી આ આક્રમક વૃત્તિ ક્યારેય પણ કચડાવાની નથી. માણસની આક્રમક વૃત્તિઓને કચડી નાખવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. આપણે જો કંઈ કરવા વિચારવાનું હોય તો તે એટલું જ કે, એની એ વૃત્તિઓને યુદ્ધ સિવાયના બીજા માર્ગોએ કઈ રીતે વાળવી ?”

તે પછી ફ્રોઈડે તેને લગતા ઉકેલ આપ્યા

**પ્રાસંગિક**  
**ધવલ શુક્લ**

છે. પણ અંતે તેઓ આ સિવાયના કોઈ ઝડપી માર્ગ નથી તેમ કહે છે. જો કે, તેમને યુદ્ધની આ વાસ્તવિકતા ખબર હોવા છતાં તેઓ યુદ્ધનો વિરોધ ઉગ્ર રીતે પ્રગટ કરતા હતા. તે વિશે લખતાં તેઓ કહે છે : “આપણા જીવનની બીજી અનેક ઘણાજનક વાસ્તવિકતાઓને આપણે મૂંગા મૂંગા સ્વીકારી લઈએ છીએ. તેમ આનોય સ્વીકાર કેમ નથી કરી લેતા? એ રીતે જોવા જઈએ તો આ પણ એક કુદરતી વૃત્તિઓનું, જીવશાસ્ત્રના નક્કર પાયા પર ઊભેલી અને લગભગ અનિવાર્ય એવી વૃત્તિઓનું જ પરિણામ છે.”

આ પ્રશ્નનો ઉત્તર વાળતાં ફ્રોઈડ આઈન્સ્ટાઈનને મનોચિકિત્સક ફ્રોઈડ લખે છે કે, “પ્રત્યેક મનુષ્યને પોતાની જિંદગી ઉપર પૂરેપૂરો અધિકાર છે. પરંતુ આ યુદ્ધો અનેક

**દુનિયાની જાણીતીમાં હસ્તીઓ પૈકી મનોચિકિત્સકોએ યુદ્ધ માટે માનવની કુર વૃત્તિને જવાબદાર ગણી તો ખુદ સૈનિકો પણ યુદ્ધને સામુહિક હત્યાના પરવાનાથી વિશેષ ગણતા નથી**

છે. જેમાં તેમણે કહ્યું છે કે, “જો આક્રમક અને વિનાશ કરવાની વૃત્તિ માણસને યુદ્ધ તરફ ધકેલી લઈ જતી હોય, તો એની સામા છેડાની વૃત્તિને-અર્થાત સર્જનની વૃત્તિને પણ આપણે વિકસાવવી જોઈએ.” તે પછી ફ્રોઈડે સત્તાનો દુરુપયોગ ન થાય, સ્વતંત્ર વિચાર કરી શકતાં હોય તેવું મોકળું મેદાન મળે તેવી તરફેણ કરી

ઉજળાં ભાવિની આશા આપતી જિંદગીઓનો નાશ કરે છે. એટલા માટે આપણે એને ધિક્કારીએ છીએ. કારણ કે, યુદ્ધ વ્યક્તિને એની મરજી વિરુદ્ધ એવી શરમભરી પરિસ્થિતિમાં જોતરી દે છે, કે જેમાં એની માનવતા રોળાઈ જાય છે. માણસે એના પુરુષાર્થમાંથી નીપજાવેલાં ફળ સમાન ભૌતિક સુખસાધન,

સગવડોનો અને બીજી અનેક વસ્તુઓનો યુદ્ધને કારણે નાશ થઈ જાય છે. યુક્રેનમાંથી આવી રહેલી તસવીર-વીડીયો ફ્રોઈડની આ વાતનો પુરાવો આપે છે. યુદ્ધની આવી અનેક સ્મૃતિઓ આજે પણ માનવજાતને ડરાવી મૂકે છે, પરંતુ જેમ બીજા વિશ્વયુદ્ધમાં એક માત્ર હિટલરથી કરોડો માણસની ખુવારી થઈ હતી, તે જ રીતે અત્યારે માત્ર પુતિનના એક નિર્ણયથી વિશ્વમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. હાલમાં મોટાભાગના દેશો રશિયાની નીતિના વિરોધમાં છે. જનીવામાં મળેલી બેઠકમાં 142 દેશોએ રશિયાના વલણને વખોડ્યું હતું. આગામી દિવસોમાં પણ તેની અસર આંતરરાષ્ટ્રીય ફલક પર વર્તાવવાની જ છે. કારણ કે રશિયા દ્વારા થયેલા હુમલામાં હવે નિર્દોષોના મોત થઈ રહ્યા છે.

વર્તમાન યુદ્ધો કેવી રીતે થાય છે તે વિશે પણ ફ્રોઈડે નોંધ્યું છે કે, “જે રીતે આજે યુદ્ધો સંચાલિત થતાં હોય છે, એમાં હવે આપણા જૂના આદર્શ મુજબ વીરતા કે શૌર્યનું ક્યાંય કશું સ્થાન રહ્યું નથી અને આપણા આધુનિક શસ્ત્રોને સહારે યુદ્ધ જીતાય છે. બંને પક્ષેથી સશસ્ત્રોનો ઉપયોગ થાય અને જેની પાસે આધુનિક શસ્ત્રો હોય તે જીતી જાય.

શિક્ષણવિદ્ અને સાહિત્યકાર રસેલ બર્નાર્ડ પણ યુદ્ધવિરોધી જાગૃતિ લાવવા ખાસ પ્રયાસ કર્યા હતા. સાહિત્યમાં નોબેલ સન્માન મેળવનારા રસેલને હિટલર સામે જંગ છેડવાનું અનિવાર્ય લાગ્યું હતું. તેમને લાગતું હતું કે, હિટલર જેવાંને ડામવા ભલે યુદ્ધ કરવું પડે. જો કે, તેઓ પૂરું જીવન યુદ્ધવિરોધી રહ્યા. તેઓ હિટલરના, સ્ટાલિનવાદના વિરોધી રહ્યા, જેમાં સામ્રાજ્ય ફેલાવવાનો મુખ્ય ધ્યેય હતો. આ ઉપરાંત તેઓ વિચેતનામ યુદ્ધને લઈને અમેરિકાના વિરોધી પણ રહ્યા. વિશ્વમાંથી અણુશસ્ત્રો નાબુદ થવા જોઈએ તે માટે તેમણે આંદોલન ચલાવ્યું હતું. 1945ના વર્ષમાં ‘ધ બોમ્બ એન્ડ સિવિલાઈઝેશન’ નામનો એક લેખ રસેલ બર્નાર્ડે લખ્યો. જેમાં તેમણે પરમાણુ બોમ્બની ઘાતકતા વિશેની ચર્ચા કરી. પરમાણુ બોમ્બમાં વપરાતાં યુરેનિયમ વિશે તેઓએ નોંધ્યું હતું કે, “યુરેનિયમ એકાએક ખૂબ જ કિંમતી પદાર્થ બની ચૂક્યો છે. અને હવે દેશો ઓઈલને બદલે યુરેનિયમ વિશે લડતાં પણ દેખાશે. હવે પછીના યુદ્ધમાં જો પરમાણુ બોમ્બ બંને પક્ષો દ્વારા ઉપયોગમાં લેવાશે તો તમામ મોટાં શહેરો નેસ્તનાબૂદ થશે,



# વાળને કાળા-મજબૂત બનાવે નારિયેળ તેલનું હેર માસ્ક

વાતાવરણમાં રહેલા પ્રદૂષણ અને પોસ્ટ કોવિડ બાદ હેર ફોલની સમસ્યા સામે લોકો લડી રહ્યાં છે. નારિયેળ તેલ સાથે અન્ય ઇન્ટ્રિડિયન્ટ્સ એડ કરી વાળને મજબૂત બનાવો આજે પ્રદૂષણ અને પોસ્ટ કોવિડ હેર ફોલની સમસ્યા સામે અનેક લોકો લડી રહ્યાં છે. નારિયેળના તેલને બેસ્ટ માનવામાં આવે છે. વાળની સારસંભાળ બહુ મહેનત માંગે છે, જે રીતે તમે સ્વસ્થ રહેવા માટે ભોજન કરો છો, એ જ રીતે વાળને પણ પોષણ જોઈએ. વાળનું ભોજન તેલ છે. ખરતાં વાળને અટકાવવા, તેને કાળા અને મજબૂત બનાવવા માટે નારિયેળના તેલમાંથી બનાવેલું હેર માસ્ક ઉત્તમ ઉપાય છે.

## નારિયેળ તેલ અને કેળાંનું માસ્ક

વાળમાં કેળું લગાવવાથી વાળ મુલાયમ બને છે. નારિયેળના તેલમાં કેળું મિક્સ કરીને લગાવવાથી વાળની અનેક સમસ્યા દૂર થઈ શકે છે. વાળ રફ અને બેમુખી થઈ ગયા હોય તો ફાયદો થાય છે. વાળને લગતી સમસ્યા દૂર થાય છે. મિક્સરમાં અડધું કેળું અને એક મોટો ચમચો નારિયેળનું તેલ નાંખીને બ્લેન્ડ કરો. આ પેસ્ટથી તમારા સ્કેલ્પ પર માલિશ કરો અને પછી વાળમાં લગાવી દો. અડધો કલાક બાદ શેમ્પૂ કરી લો.

## મધ અને નારિયેળના તેલનું માસ્ક

મધ ત્વચા અને વાળ માટે પણ ઉત્તમ છે. મધ વાળમાં ચમક લાવે છે. નારિયેળના તેલ અને મધને મિક્સ કરીને બનાવેલું હેર માસ્ક વાળને હેલ્થી રાખવામાં મદદ કરે છે. એક મોટી ચમચી નારિયેળ તેલને ગરમ કરી લો. એમાં મોટી ચમચી મધ નાંખીને તેને સારી રીતે મિક્સ કરી લો. આ પેસ્ટને સ્કેલ્પ અને વાળમાં લગાવો. લગાવ્યા બાદ અડધો કલાક રહેવા દો, ત્યાર બાદ નવશેકા પાણીથી ધોઈ લો.




## લીંબુ અને નારિયેળનું તેલ

લીંબુમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય છે. કોલોજનનું નિર્માણ કરવામાં તે મદદ કરે છે. કોલોજન વાળના ગ્રોથને વધારે છે. જેમના વાળ ઓછી હોય તેમણે લીંબુનો રસ લગાવવો જોઈએ. એનાથી ડેન્ડ્રૂફ પણ દૂર થાય છે. એક મોટી ચમચી નારિયેળ તેલમાં એક મોટી ચમચી લીંબુનો રસ મિક્સ કરો. તેને સ્કેલ્પમાં લગાવ્યા બાદ 30 મિનિટ પછી શેમ્પૂથી વાળને ધોઈ લો.

## આંબળાં, શિકાકર્ફ અને નારિયેળ તેલ

આંબળાં અને શિકાકર્ફ વાળને કાળા કરવામાં મદદ કરે છે અને વાળ માટે પૌષ્ટિક અને હેલ્થી છે. આંબળાંમાં એન્ટિ ઓક્સિડન્ટ્સ અને વિટામિન સી હોય છે. જે સ્કેલ્પને સ્વસ્થ રાખે છે. વાળને ઝડપથી વધારવામાં મદદ કરે છે. શિકાકર્ફ પાઉડર વાળનાં મૂળને મજબૂત કરે છે. એક મોટી ચમચી આંબળાંનો રસ, એક મોટી ચમચી શિકાકર્ફ પાઉડર, બે મોટી ચમચી નારિયેળનું તેલ, આ મિશ્રણને મિક્સ કરીને તેને નવશેકું ગરમ કરી લો. પછી તેને ગાળીને ઠંડું થવા દો, ત્યારબાદ વાળમાં માલિશ કરો. આખી રાત વાળમાં રહેવા દો અને સવારે વાળમાં શેમ્પૂ કરી લો.



નેટવર્ક-એટેચ્ડ સ્ટોરેજ (NAS) એ ફાઇલ-લેવલ સ્ટોરેજ આર્કિટેક્ચર છે. જે સંગ્રહિત ડેટાને નેટવર્કવાળા રિવાઈસ માટે વધુ સુલભ બનાવે છે. NAS - નેટવર્ક-એટેચ્ડ સ્ટોરેજ, SAN - સ્ટોરેજ એરિયા નેટવર્ક અને DAS - ડાયરેક્ટ-એટેચ્ડ સ્ટોરેજ એમ ૩ મુખ્ય સ્ટોરેજ આર્કિટેક્ચર છે. NAS નેટવર્કને બિલ્ટ-ઇન સિક્યોરિટી, મેનેજમેન્ટ અને ફોલ્ટ ટોલરન્ટ ક્ષમતાઓ સાથે સ્ટોરેજ માટે સિંગલ એક્સેસ પોઈન્ટ આપે છે. ટૂંકમાં કંપની પોતાના ડેટાનો બેકઅપ લેવા માટે NAS રિવાઈસનો ઉપયોગ કરે છે.

ASUSTOR નેટવર્ક-એટેચ્ડ સ્ટોરેજ (NAS) રિવાઈસ ડેડબોલ્ટ રેન્સમવેરના શિકાર બન્યા છે. આજ રીતે QNAP NAS રિવાઈસ પર પણ સમાન એટેક થયા છે. એટેકથી બચવા માટે કંપનીએ ફર્મવેર અપડેટ્સ (ADM 4.0.4.RQ02) બહાર પાડ્યા છે. વધુમાં કંપની યુઝર્સને ડેટા સુરક્ષિત રાખવા માટે સૂચવે છે કે યુઝર્સ પાસવર્ડ બદલવો, પાસવર્ડમાં આલ્ફાન્યુમેરિક અને સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરવો, રિફ્રેશ HTTP અને HTTPS પોર્ટ્સ બદલવા જે 8000 અને 8001 છે, વેબ સર્વર પોર્ટ્સ બદલો જે રિફ્રેશ પોર્ટ 80 અને 443 છે, ટર્મિનલ/SSH અને SFTP સેવાઓનો તમે ઉપયોગ ન કરતા હોવ તો તેવી અન્ય સેવાઓને બંધ કરો અને નિયમિત બેકઅપ લો અને ખાતરી કરો કે બેકઅપ અપ ટુ ડેટ છે.

રેન્સમવેર એટેક મુખ્યત્વે ADM OS થી ચાલતા NAS રિવાઈસ જેમાં AS5104T, AS5304T, AS6404T,

AS7004T, AS5202T, AS6302T, અને AS1104T મોડેલનો સમાવેશ થાય છે. QNAP NAS રિવાઈસને ટાર્ગેટ બનાવતા ઘૂસણખોરોની જેમ જ જોખમી હેકર્સ દાવો કરે છે કે તેઓ ASUSTOR NAS રિવાઈસને એન્ટિફટ કરવા માટે શૂન્ય-દિવસની નબળાઈનો ઉપયોગ કરી રહ્યાં છે. NAS રિવાઈસનો એક્સેસ પુનઃપ્રાપ્ત કરવા માટે 0.03 બિટકોઈન્સ (~\$1,150) ચૂકવવાની માંગણી કરે છે.

રેન્સમવેર ઓપરેટરોએ ASUSTOR માટેના એક અલગ સંદેશમાં જણાવ્યું હતું કે જો કંપનીએ 50BTCની કુલ ચૂકવણી માટે યુનિવર્સલ રિકિપ્શન કી વેચવા ઉપરાંત 7.5BTCની બિટકોઈન ચૂકવણી કરવી હોય તો તેઓ ખામીની વિગતો શેર કરવા તૈયાર છે.

ઉપયોગમાં લેવાતી સુરક્ષા નબળાઈની ચોક્કસ વિગતો સ્પષ્ટ નથી. પરંતુ એવી શંકા છે કે એટેક વેક્ટર EZ કનેક્ટ સુવિધામાં ખામી સાથે સંબંધિત છે. જે NAS રિવાઈસના એક્સેસની મંજૂરી આપે છે.

કંપની જણાવે છે કે જે યુઝર્સના NAS રિવાઈસ પર રેન્સમવેર એટેક થઈ ચૂક્યો છે તેને પોતાના NAS રિવાઈસમાં ઈથરનેટ નેટવર્ક કેબલને અનપ્લગ કરવો, પાવર બટનને ત્રણ સેકન્ડ્સ માટે દબાવીને અને પકડી રાખીને તમારા NASને સુરક્ષિત રીતે બંધ કરવું, તમારા NAS ને પ્રારંભ કરશો નહીં કારણ કે આ તમારો ડેટાને એનક્રિપ્ટ કરી દેશે. વધુમાં કંપની ફોર્મ ભરવા કહે છે જેથી તે તમારા ડેટાને રીકવર કરી શકે. @beinghumanmj

## કવચિત્રી : હિના મોદી, શીર્ષક : લહેરાતો ચાંદ

એણે કાંકરીચાળો કર્યો શાંત સરોવરમાં અને, હું હિચકે મૂલવા મંડી પ્રતિબિંબિત લહેરાતા ચાંદ પર. ચંચળ માછલીઓએ ઠેસ શું જરા મારી મારા ચંચળ મન એ બાયોમાં ભરી લીધું આખું આભ . તારાઓ સાથે છૂપાછૂપી પકડાપકડી રમતી બાળકી અને રંગબેરંગી તીતલીની જેમ- ખાયણાં ગાતી હાંચકે, પવનની લહેરો સાથે પહોંચી ચાંદ પર કરવા પ્રથમ ચુંબન. પ્રેમાશ્રુઓથી ઘોઈ નાંખ્યા એનાં બધા ડાઘ એ જે હતો મારો પ્રેમીક .

# DIVINE YOGA

By Geeta

## Children Yoga Class

Every Tuesday 5-6 PM

## Adult Yoga Class

Every Saturday 9-10 AM

Join today on ZOOM!  
: Classes Available :  
One to One Individual  
and Therapeutic

### Geeta Tailor

416-456-2261

Contact Geeta at  
divineyogabygeeta@gmail.com  
IG & FB: @divineyogabygeeta

## કથા, હવન, ગાયત્રી યજ્ઞ, વાસ્તુ પૂજન, શ્રાદ્ધ શાંતિ,

શશીકાંત ભટ્ટ

૯૦૫ ૪૫૬ ૭૬૨૨

કાલસર્પે યોગ શાંતિ, નક્ષત્ર શાંતિ, વગેરે ધાર્મિક કાર્યો અને લગ્ન, બેબી શાવર, જેવા કાર્યો માટે સંપર્ક કરો.

### Shashikant Bhatt

Home: 905-456-7622  
Cell: 416-258-2750





# કેનેડા જવા નાણાંની વ્યવસ્થા નહી કરે તો સગાઈ તોડીશ : મંગેતરની ધમકી બાદ યુવાનનો આપઘાત

વેપારી પુત્રનું મોત થતા નરોડા પોલીસે પડોશમાં રહેતી યુવતી સામે ગુનો નોંધ્યો

## અમદાવાદ

નરોડામાં સગાઈ થયા બાદ મંગેતરના ત્રાસથી વેપારીના પુત્રને આપઘાત કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, પોલીસ તપાસમાં યુવક પાસે પડોશમાં રહેતી યુવતી કેનેડા જવા માટે એક કરોડની માંગણી કરીને છૂટાછેડા માટે ધમકી આપતી હતી જેને લઈને યુવકે આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે.

નાના ચિલોડાખાતે સીએનજી પેટ્રોલ પંપ પાસે કેલાશ રોયલ ખાતે રહેતા અને મોબાઈલ તથા કાપડનો વેપાર કરતા

રામચંદ્ર વસંતમલ માખીજા (ઉ.વ.૫૧) પડોશમાં સોસાયટીમાં રહેતી વંદના ઉર્ફે વર્ષા કમલેશભાઈ જસવાણી સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે વેપારીના ૩૨ વર્ષના પુત્ર લખનની ઉપરોક્ત યુવતી સાથે નવ મહિના અગાઉ સગાઈ થઈ હતી. યુવતી દ્વારા કેનેડા જવા માટે ઈવેસ્ટર વિઝાના રૂ. ૧ કરોડ ખર્ચાને કેનેડા સેટલ થવા માટે વાત કરવામાં આવતી હતી. તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ ફરિયાદીની પત્ની તથા પુત્ર અને યુવતી અને તેની માતા સોમનાથ બાધા પૂરી

કરવા માટે ગયા હતા અને તેઓ ત્રણ દિવસ બાદ પરત આવ્યા બાદ ફરિયાદીને પત્ની તથા પુત્રને કહ્યું કે યુવતી કેનેડા જવા માટે એક કરોડની માંગણી કરતી હતી. જો રૂપિયાની વ્યવસ્થા નહી થાય તો સગાઈ તોડીને બીજા છોકરા સાથે લગ્ન કરવાની વાત કરતી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી સગાઈ તૂટી જવાની ચિંતામાં ફરિયાદીના પુત્રને મધરાતે ફાંસો ખાધો હતો, મૃતક યુવકના મોબાઈલમાંથી ઓડિયો તથા મેસેજના પુરાવા પોલીસે મેળવ્યા છે.

# ગોડસેના સેવકો અત્યારે સત્તામાં બેઠા છે, તે ગુજરાતનું અપમાન છે: કોંગ્રેસ

કોંગ્રેસના હોબાળાને કારણે રાજ્યપાલે તેનું ભાષણ અધવચ્ચેથી પડતું મુક્યું

## ગાંધીનગર

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સુત્રોચાર કરવાના કારણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું અભિભાષણ અધવચ્ચે જ છોડવું પડ્યું હતું. જે બાદ વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના

ધારાસભ્ય વીરજી ઠુમ્મરે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

કોંગ્રેસ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે જણાવ્યું કે, રાજ્યપાલ દ્વારા પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ અને રવિશંકર મહારાજના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આથી અમારે વિરોધ પક્ષ તરીકે સવાલ ઉઠાવવો પડ્યો હતો કે, જો તમે ગાંધીજી અને સરદાર પટેલનું ગુજરાત કહેતા હોવ, તો ગોડસેના

સેવકો અત્યારે ગુજરાતમાં સત્તામાં બેઠા છે. તેઓએ રાજ્યપાલને છાપીને આપેલું ભાષણ વાંચવાની ફરજ પાડી છે. આ ગુજરાતનું અપમાન છે. ગાંધીના હત્યારા ગોડસે વિરુદ્ધ વિધાનસભામાં એક શબ્દ પણ ના ઉઠાવવામાં આવે એટલે ગાંધીજીનું નામ લઈને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ થઈ રહ્યું છે. આ સાથે જ વીરજી ઠુમ્મરે રાજકોટના પોલીસ કમિશનરના કમિશન કાંડને ઉજાગર કરનારા ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

# ઓર્ગેનિક ખેત પેદાશો ઊંચા ભાવથી ખરીદીવા સરકારની વિચારણા : CM

## રાજકોટ

ગુજરાતમાં 12 વર્ષથી યોજાતા ગરીબ કલ્યાણ મેળાના સિલસિલામાં ત્રણ દિવસ રાજ્યના વિવિધ સ્થળે આવા મેળા યોજાઈ રહ્યા છે. મોરબીમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ખેડૂતો રાસાયણિકને બદલે પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પ્રોત્સાહન આપવા અનેકવિધ પગલા લઈ રહી છે, આ માટે ઓર્ગેનિક કૃષિ પેદાશોને વધુ ભાવ ચૂકવીને ખરીદી કરવા પણ સરકાર વિચારણા કરી રહી છે.

તેમણે ઉમેર્યું કે ખેતી ઉપર ડ્રોનથી દવા છંટકાવની ટેકનોલોજી સરકાર

અપનાવી રહી છે, ક્લાઈમેટ ચેન્જ માટે સરકારે અલગ વિભાગ કાર્યરત કર્યો છે. મોરબીમાં 1721 લાભાર્થીને ૩.40 કરોડની સહાય અર્પણ કરાઈ હતી. મુખ્યમંત્રીની હાજરીમાં અમરેલીમાં 82,000 લાભાર્થીને રૂ. 102 કરોડની સહાય અર્પાઈ હતી. જે બાદ ગીર સોમનાથ જિલ્લામાં કાજલી માર્કેટ યાર્ડ ખાતે, જામનગરમાં હાપા માર્કેટ યાર્ડ ખાતે, જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે ગરીબ કલ્યાણ મેળો એક જ સમય સવારે 9 વાગ્યે યોજાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વચ્ચે અલ ઉપસ્થિતિ રહી હતી.

અગાઉ 2 વાર મોકૂફ રહેલું સહકાર સંમેલન હવે 13 માર્ચે બાજીપુરામાં મળશે

## બારડોલી

બારડોલી નજીક બાજીપુરા ખાતે સુમુલ દ્વારા આયોજીત સહકાર સંમેલન બે વખત મોકૂફ રાખ્યા બાદ ગૃહ મંત્રાલયે ત્રીજી વખત લીલીગંડી આપતા આગામી 13મી માર્ચે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સહકાર સંમેલન મળશે. સુમુલ દ્વારા પહેલા તા.16 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહ અમિત શાહની હાજરીમાં સહકાર સંમેલન યોજવાનું નક્કી કરતા સહકાર ક્ષેત્રમાં જનમેદની એકઠી કરવા માટે ગામે ગામ આયોજન શરૂ થયા હતા. પરંતુ એકાએક સંમેલન મોકૂફ થયું હતું.

# કાલુપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ, 5 માર્ચ સુધી વિશેષ ઉજવણી

## અમદાવાદ

કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેના ઉપલક્ષમાં અડાલજમાં 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી વિશેષ ઉજવણીનું આયોજન થયું છે. 7 દિવસના કાર્યક્રમમાં 15 હજારથી વધુ વિદેશથી હરિભક્તો સાથે 30 લાખથી વધુ ભક્તો દર્શનનો લાભ લેશે. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પર્વ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આવેલા સાધુ - સંતોના આશીર્વાદ લીધા હતા. આ



કાર્યક્રમમાં કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ, વજેન્દ્ર પ્રસાદ મહારાજ સહિત અનેક સાધુ - સંતો ઉપસ્થિત રહ્યા હતા. હરિભક્તો માટે સતત 7 દિવસ સુધી જુદા જુદા સાધુ - સંતોનું પ્રવચન, હરિભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ,

કથા તેમજ અન્ય પ્રાસંગિક કાર્યક્રમ સહિત માર્ગદર્શન મળે એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સ્થળે ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળતી પારંપરિક છબી ઉભી કરાઈ છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ પંથમાં કહેવાય છે કે સૌથી વધુ લોક જાગૃતિનું કામ નશામુક્તિ માટે કરે છે. એ કામ હું આગળ વધારવા ગુજરાત પોલીસ સાથે કાર્યરત છીએ. હું વિનંતી કરીશ કે નશા મુક્તિની જુમ્બેશ વધુ મજબૂત બનાવે.

# 60થી વધુ વય, 3 ચૂંટણી લડનારાને ગુજરાતના બોર્ડ નિગમમાં સ્થાન નહીં

## અમદાવાદ

ભાજપે બોર્ડ નિગમમાં 60થી વધુ વય હશે આધવા તો ત્રણ ટર્મ હોદ્દાદારોની નિમણૂક માટે કેટલાંક ધારાધોરણો નક્કી કર્યા છે. 60થી વધુ વય હશે આધવા તો ત્રણ ટર્મ હોદ્દાદારોની નિમણૂક માટે કેટલાંક ધારાધોરણો નક્કી કર્યા છે. 60થી વધુ વય હશે આધવા તો ત્રણ ટર્મ હોદ્દાદારોની નિમણૂક માટે કેટલાંક ધારાધોરણો નક્કી કર્યા છે. 60થી વધુ વય હશે આધવા તો ત્રણ ટર્મ હોદ્દાદારોની નિમણૂક માટે કેટલાંક ધારાધોરણો નક્કી કર્યા છે.

તાજેતરમાં કેટલાંક બોર્ડ નિગમમાંથી ચેરમેન સહિતના હોદ્દાદારોનું રાજીનામું લઈ લેવાયું હતું. ભાજપે બોર્ડ નિગમમાં નિમણૂકો માટે પણ ધારાધોરણો ઘડ્યા છે જેમકે, જ્ઞાતિ-સામાજિક પ્રભુત્વ ધરાવતાં નેતાની પ્રથમ પસંદગી

સંગઠનમાં હોદ્દો ધરાવતાં હશે તેને તક નહી મળે. આમ છતાંય પસંદગી કરાશે તો સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપવું પડશે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટ માટે લાયક હતાં પણ સંજોગોવસાત છેલ્લી ઘડીએ પડતા મૂકાયા હોય, મત વિસ્તારમાં રાજકીય પ્રભુત્વ ધરાવતા હોય તેને ય સ્થાન મળી શકે છે. સાથેસાથે આ વખતે પક્ષના સર્વેમાં વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટ માટે મજબૂત દાવેદાર હોય પણ પક્ષ ટીકીટ આપવા ઈચ્છુક નથી તેવા દાવેદારને પણ બોર્ડ નિગમમાં ચેરમેન કે ડિરેક્ટર પદ આપીને સાચવી લેવા નક્કી કરાયું છે.

## સંક્ષિપ્ત સમાચાર

### ગિફ્ટ સિટી પાસે બીગ-બી બે ટાવર બનાવશે

ગાંધીનગર : પાટનગર ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટી પાસે ફિલ્મસ્ટાર અમિતાભ બચ્ચને ખરીદેલી જમીનમાં બે મલ્ટીસ્ટોરિયસ ટાવર ઉભા કરવામાં આવનાર છે. 25 થી 30 માળના આ



ટાવર વૈભવી રહેઠાણો માટે બનાવવામાં આવશે. મેગાસ્ટારે 2010માં ગુજરાત પ્રવાસન નિગમની 'પુશ્પુ ગુજરાત કી' નામનું એડ કેમ્પેઇન શરૂ કર્યું હતું. આ વિડીયો અને ઓડિયો શ્રેણીમાં તેમણે રાજ્યના પ્રવાસન સૃષ્ટિનો પ્રચાર શરૂ કર્યો હતો. દરમિયાન તેમણે ગિફ્ટની નજીક આવેલા શાહપુરમાં અમિતાભ બચ્ચને 2011માં 23619 ચોરસમીટર જમીન સાત કરોડ રૂપિયામાં ખરીદ કરી હતી.

### અમદાવાદ એરપોર્ટને મળ્યું અનોખું સન્માન

અમદાવાદ : શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને 'ઉત્તમ પ્રાદેશિક એરપોર્ટ' તરીકે એસોસિએટ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને સોમવારે આ બહુમાન પ્રાપ્ત થયું હતું. દિલ્હીમાં એસોસિએટ રેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાનો 'ઉત્તમ પ્રાદેશિક રિજીયોનલ એરપોર્ટ ઓફ ધ યર' તરીકેનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન પ્રધાન તથા અન્ય ટોચના મહાનુભવોની હાજરીમાં એસવીપીઆઈ એરપોર્ટને તાળીઓના ગડગડાટ વચ્ચે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એસવીપીઆઈ એરપોર્ટ અમદાવાદને કોવિડ માર્ગરૂપાઓનું સતત પાલન કરવામાં તથા ગ્રાહકોના અનુભવમાં સતત વૃદ્ધિ કરવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પ્રવાસ કરતા સમુદાયની અને પેસેન્જરોની જરૂરિયાતનાં ક્ષેત્રો અને તેમની અગ્રતા પારખવાની તક ઝડપી લઈને એસવીપીઆઈ એરપોર્ટ કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરતું રહ્યું છે.

### ગુજરાતમાં 31 ડાયાલિસિસ સેન્ટરોનું લોકાર્પણ

અમદાવાદ : ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના ૩૧ જેટલા "આધુનિક ડાયાલીસિસ સેન્ટરોનું" વર્ચ્યુઅલી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા નર્મદા જિલ્લાને આકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કરાયો છે, ત્યારે જિલ્લાના પ્રજાજનોને ઘર આંગણે જ શ્રેષ્ઠતમ સુવિધાઓ મળી રહે તે હેતુસર મંત્રી શ્રીકેશ પટેલ તથા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં દાહોના દેવગઢ બારીયા ખાતેથી ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના ૩૧ જેટલા "આધુનિક ડાયાલીસિસ સેન્ટરોનું" વર્ચ્યુઅલી ઇ-લોકાર્પણ તેમજ રાજ્યપલાની જનરલ હોસ્પિટલના હિમો ડાયાલીસિસ વિભાગની તકતીનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ સિવીલ સર્જન ડૉ. જયોતિબેન ગુપ્તા, તબીબી સ્ટાફ, આરોગ્યકર્મીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

### હાર્ટ એટેક આવતાં મહેશ સવાણી હોસ્પિટલમાં

સુરત : સુરતના ઉદ્યોગપતિ અને આપના પૂર્વ નેતા મહેશ સવાણીને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા 2 દિવસ થી છાતીના દુખાવાની ફરિયાદ હતી. ફરી દુખાવો થતા તેઓ હોસ્પિટલ ગયા હતા. જ્યાં બ્લોકેજ હોવાનું ખબર પડતાં તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આપના પૂર્વ નેતા અને 4000 યુવતીઓના લગ્ન કરાવનાર ઉદ્યોગપતિ મહેશ સવાણીની ગઈકાલથી જ હૃદયમાં દુખાવો થતો હોવાની ફરિયાદ પરિવારના લોકોને કહ્યું હતું. મોડી રાતે ડોક્ટરે તપાસતા મહેશ સવાણીને હાર્ટ એટેક આવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. મોડી રાતે એનજીઓપ્લાસ્ટિક કરીને ICCUમાં દાખલ કરાયા હતા.





# ગુજરાતનું ૬૬૮.૦૯ કરોડની પુરાંતવાળું બજેટ

વ્યવસાય વેરામાં ફેરફારના કારણે ૩.૧૦૮ કરોડની રાહત, નર્મદા પરિયોજના માટેના ખર્ચમાં ૧૭ ટકાનો ઘટાડો

**ગાંધીનગર**

ગુજરાત સરકારે વિધાનસભાની ચુંટણી પહેલાંનું છેલ્લું બજેટ આજે ગૃહમાં રજૂ કર્યું હતું. ગત વર્ષ કરતા બજેટમાં રાજ્યનો કુલ ખર્ચ સાત ટકા વધી રૂ. ૨,૪૩,૯૬૫ કરોડ રાખવામાં આવી છે. વધુ એક નાણામંત્રીએ સદનમાં બજેટ રજૂ કરતી વેળાને ખાધના બદલે પુરાંત હોવાનું દર્શાવવાની ઈચ્છા કોરાણે મૂકી નથી. બજેટમાં રૂ. ૬૬૮.૦૯ કરોડની પુરાંત દર્શાવાઈ છે. બજેટમાં નવા કરવેરા નાખવામાં આવ્યા નથી અને નથી એમાં પેટ્રોલ અને ડિઝલના ઊંચા ભાવ, મોંઘવારીમાં કોઈ રાહત મળે એવી જાહેરાત કરવામાં આવી નથી. માત્ર વ્યવસાય વેરામાં ફેરફારના કારણે રૂ. ૧૦૮ કરોડની રાહત આપવામાં આવી છે. પ્રથમવખત બજેટ

રજૂ કરતા નાણામંત્રી કનુ દેસાઈ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે આ બજેટ એક પડકાર છે કારણ કે બજેટમાં એવી કોઈ જાહેરાત નથી કે જેમાં કોઈ મોટી રોજગારીનું સર્જન થાય, નથી એવી કોઈ વિચારધારા કે જેનાથી કોરોનાની મહામારી પછી ગુજરાત રાજ્યના અર્થતંત્રને થયેલું નુકસાન અટકે અને ગુજરાત ફરીથી દેશના સૌથી વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધે.

ગત વર્ષની પરમ્પરા અનુસાર રાજ્ય સરકારના બજેટ ૨૦૨૦-૨૩ માં સૌથી વધુ નાણાકીય ફાળવણી શિક્ષણ, શહેરી વિકાસ અને ઉર્જા ક્ષેત્રને કરવામાં આવી છે. ગત વર્ષે પણ આ ત્રણ ક્ષેત્રોને સૌથી વધુ નાણા મળ્યા હતા. રાજ્ય સરકારે જળસંપત્તિ, પાણી પુરવઠો, નર્મદા એમ દરેક ક્ષેત્રે

નાણાની ફાળવણી કરી છે પણ રાજ્યમાં દર વર્ષે પાણીની સમસ્યા સર્જાય છે, રાજ્યનો ૬૭ ટકા ભાગ સતત પાણીની ખેંચ સાથે જીવે છે ત્યારે રાજ્યની જીવાદોરી એવા નર્મદા પરિયોજના માટેના ખર્ચમાં ૧૭ ટકાનો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. બજેટ ૨૦૨૧-૨૨માં નર્મદા માટે રૂ. ૭૩૭૦ કરોડની ફાળવણી સામે આ વર્ષે ફાળવણી ઘટી રૂ. ૬૦૯૦ કરોડ કરવામાં આવી છે. આ અંગે રાજ્ય સરકારે કોઈ સ્પષ્ટતા બજેટમાં કરી નથી. આ ઉપરાંત, જળસંપત્તિ માટેની ફાળવણી પણ ત્રણ ટકા ઘટાડી છે. જોકે, પાણી પુરવઠા માટેની જોગવાઈ ૩૭ ટકા વધારી રૂ. ૪૫૧ કરવામાં આવી છે. એવું બની શકે કે અન્ય ચીજોમાં ઘટાડો કરી તેનો ઉપયોગ હવે પાણી પુરવઠા વિભાગમાં કરવામાં આવશે.

**ક્લાસીફાઈડ / Classified**

**MOTEL JOB**  
Front-Desk Help, Computer Knowledge Preferred, and other motel help work.  
Email : wallaceburginn@gmail.com  
Call in Afternoon  
Cell : 647-931-0721

**આણંદમાં જુગારધામ પકડાયું, ભાજપ ઉપપ્રમુખ જ જુગાર રમતા પકડાયા આણંદ**

આણંદના આંકલાવમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. જેમાં શહેર ભાજપ ઉપપ્રમુખ જુગારધામ રમાડતા ઝડપાયા છે. નેતા દ્વારા રાજકીય વર્ગનો દૂરઉપયોગ કરી રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવવામાં આવતો હતો. ત્યારે ભાજપ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ૧૦ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.

આંકલાવમાં શહેર ભાજપ પ્રમુખ જુગાર ધામ ચલાવે છે તેવી પોલીસને ખાતરી મળી હતી, જેના આધારે સ્થાનિક પોલીસે રેડ પાડી હતી. જેમાં ભાજપ પ્રમુખ જગદીશ ઠાકોર જ પકડાયા હતા. આંકલાવ પોલીસે રેડ પાડતા જ ત્યાં અનેક લોકો જુગાર રમી રહ્યા હતા. જગદીશ ઠાકોર રાજકીય વર્ગનો દુરુપયોગ કરી રહેણાંક મકાનમાં જુગાર ધામ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. આંકલાવ પોલીસે ભાજપ ઉપપ્રમુખ જગદીશ ઠાકોરને ઝડપી પાડ્યો છે. પોલીસે ઉપપ્રમુખ સહિત ૧૦ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

## ગુજરાતમાં હવે મર્યાદા વગર પ્રસંગની ઉજવણી, મેળાવડાની છૂટ

**અમદાવાદ**

ગુજરાત રાજ્ય સરકારે કોરોનાના કેસમાં જોવા મળી રહેલા ઘટાડાના આધારે નિર્ણય લેતા રાજ્યમાં તમામ પ્રકારના નિયંત્રણ હટાવી લેવાની મંગળવારે જાહેરાત કરી હતી. રાજ્યમાં ગત સપ્તાહથી, દરેક શહેર અને જિલ્લામાં રાત્રિ કફરું હટાવી લેવામાં આવ્યો છે. આજેની જાહેરાત અનુસાર રાજ્યમાં હવે સિનેમા હોલ, લગ્ન પ્રસંગ, અંતિમયાત્રા, બસ પ્રવાસ, જીમ, કોચિંગ કેમ્પ કે જાહેર મેળાવડા ઉપર વ્યક્તિ મર્યાદા પણ હટાવી લેવાની જાહેરાત કરવામાં આવી છે.

## શૈક્ષણિક સંસ્થાઓમાં ડિક્રેન્સ રીસર્ચ માટે રૂપિયા ૧૨૦૦ કરોડની ફાળવણી

**અમદાવાદ**

શૈક્ષણિક સંસ્થાઓમાં સંરક્ષણ ક્ષેત્રે સંશોધન માટે રૂપિયા ૫ ડિક્રેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) દ્વારા રૂપિયા ૧૨૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી સહિત ૩૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાંથી ૧૨૦૦ જેટલા સ્કોલર હાલમાં ડીઆરડીઓ સાથે કામગીરી પણ કરી રહ્યા છે તેમ ડીઆરડીઓના ચેરમેન ડો. જી સતિષ રેડ્ડીએ અમદાવાદ ખાતે જણાવ્યું છે. ગાંધીનગરના ઉવારસદ ખાતે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાઈ રહેલા 'અમદાવાદ ડિઝાઈન વીક ૩.૦'ના બીજા દિવસે સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતોએ ડીઆરડીઓ ટાઉનહોલ

ખાતે સંરક્ષણ ક્ષેત્રમાં નવિનીકરણ-ડિઝાઈન પર ભાર મૂક્યો હતો તેમજ સ્ટાર્ટ અપ્સને સંરક્ષણ સંબંધિત પડકારોને ઉકેલવા માટે આગળ વધવા આહવાન કર્યું હતું. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ડિક્રેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના સચિવ ડો. રેડ્ડીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, 'ડીઆરડીઓએ સંરક્ષણ ક્ષેત્રમાં રૂપિયા ૧૨૦૦ કરોડ જેટલી રકમ તારવી છે. યુનિવર્સિટીએ ટેકનોલોજીના વિકાસનો મૂળભૂત પાયો છે. ડીઆરડીઓ શૈક્ષણિક સંશોધન કાર્યક્રમ માટે ૩૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ સાથે કામગીરી કરી રહી છે. સંરક્ષણ ક્ષેત્રે પાયાના સ્તરે સંશોધન માટે ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ સેન્ટર ઓફ એક્સલન્સ સાથે જોડાશે.

# જમીન માગણીની અરજી પેન્ડિંગ હશે વસ્ત્રાપુરમાં વર્ક પરમીટના બહાને કેનેડા તો લેન્ડ ગ્રેબિંગ કાયદો નહીં લાગશે લઈ જવાનું કહી રૂપિયા ૧૫ લાખની ઠગાઈ

**ગાંધીનગર**

રાજ્યના આદિજાતિ વિસ્તાર માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સુધારો કરવાનો નિર્ણય કર્યા પછી સરકાર વિધાનસભામાં વિધેયક લાવી રહી છે, જેમાં જંગલની જમીનના કેસ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગણાશે નહીં. સરકારી વિધેયકની જોગવાઈ પ્રમાણે જમીન માંગણીની અરજી પેન્ડિંગ હશે તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ નહીં થાય. આદિજાતિ વિસ્તારોમાંથી સમગ્રતયા મળેલી રજૂઆતનાં આધારે આ વિધેયક લાવવામાં આવી રહ્યું છે. વિધાનસભાની વિચારણા માટે રજૂ થયેલા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) (સુધારા) વિધેયકમાં

સરકારના મહેસુલ વિભાગ દ્વારા કેટલાક મહત્વના સુધારાઓ સુચવવામાં આવ્યા છે જે આદિવાસી વિસ્તારને લાગુ પડશે. આ કાયદા હેઠળ સ્પેશિયલ કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવે તેને આગળ ઉપર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પડકારી શકાશે. જે અંગે અપીલ બહાલ રાખી શકાશે. અપીલ રદ કરી શકાશે. જરૂર પડ્યે વધારાના પુરાવા જરૂરી હોય તો કેસ પાછો ખેંચવાની મંજૂરી પણ આપી શકાશે. અપીલ કરવામાં આવે તો પક્ષકારોને સુનાવણીની વ્યાજબી તક આપવાની રહેશે. સ્પેશ્યલ કોર્ટના આદેશ બાદ ૩૦ દિવસની અંદર અપીલ કરી શકાશે.

**અમદાવાદ**

ઘાટલોડિયામાં રહેતા વિશાલ નાગરે માર્ચ ૨૦૧૯માં હર્ષિલ ઘનશ્યામભાઈ પટેલની ડ્રાઈવ ઈન રોડ ગુરૂકુળ રોડ પર આવેલી ઉડાન હોલી ડે નામની ઓફિસનો સંપર્ક કર્યો હતો, આ સમયે વિશાલ નાગરને હર્ષિલ પટેલે તેમની કંપનીની કામગીરી સમજાવી અને ઘણા બધાને વર્ક પરમીટ અપાવી કેનેડા મોકલેલા ફોટા બતાવ્યા હતા. જેથી વિશાલે વર્ક પરમીટ કેનેડાના વીઝા માટે હર્ષિલ પટેલને વાત કરી હતી. બાદમાં હર્ષિલે કેનેડાના વર્ક પરમીટ વિઝા બનાવવાની પ્રોસેસના ૨ લાખ રૂપિયા અને જરૂરી ડોક્યુમેન્ટ જમા

કરાવવા કહ્યું. જેથી વિશાલ નાગરે ૫૦ ૦૦૦ રોકડા તેમના ભાઈના એસબીઆઈ એકાઉન્ટમાંથી એકિસિસ બેન્કના એકાઉન્ટમાં ચેકથી ટ્રાન્સફર કરાવ્યા હતા. પાંચેક મહિના રાહ જોયા બાદ વિશાલ નાગરે તેમનો સંપર્ક કર્યો તો તેમણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. જેથી તેમણે રૂપિયા પાછા માગ્યા તો હર્ષિલ પટેલે ફાઈલ પ્રોસેસમાં હોવાનું અને બે મહિનામાં ફાઈલ પાસ થઈ જશે તેવું કહ્યું હતું. ત્યારબાદ કોવિડ -૧૯ ના કારણે વિશાલ નાગરે તેમનો સંપર્ક કર્યો નહીં. બાદમાં ૨૦૨૧ માં હર્ષિલ પટેલનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કોવિડ-૧૯ કારણે તેમની ફાઈલ કેન્સલ થઈ ગઈ છે અને તેમને રૂપિયા પાછા મળી જશે. ત્યારબાદ હર્ષિલ પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે તેઓ મુંબઈ કામથી આવ્યા છે અમદાવાદ આવી ફોન કરશે. ઓફિસ પર આવીને રૂબરૂમાં વાત કરશે. પરંતુ ફોન આવ્યો નહીં. સમગ્ર ઘટનામાં હર્ષિલ પટેલ ૨ લાખ, વિરજ પટેલ ૫ લાખ, નીલ પટેલ અઢી લાખ, ભૌતિક પટેલ અઢી લાખ, જીલ પટેલ ત્રણ લાખ એમ કુલ મળી ૧૫ લાખ લઈ કેનેડાના વર્ક પરમીટ વિઝા લાવી નહીં આપી વિશાલ નાગર સાથે છેતરપિંડી કરી હોવાથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

## આંતરજાતીય લગ્નના કારણે પરિવારે વિખૂટા કરેલાં દંપતીનું હાઈકોર્ટ દ્વારા પુનર્મિલન

**છોટાઉદેપુર**

આંતરજાતીય લગ્ન થયા બાદ પણ યુવક-યુવતિ પોતપોતાના પરિવાર સાથે રહેતાં હતા. જો કે યુવતીના ઘરે લગ્નની વાતો ચાલી રહી હોવાથી તેણે સ્વીકાર કર્યો હતો કે તેણે લગ્ન કરી લીધા છે. જો કે પરિવારજનોને આ લગ્ન પસંદ ન હોવાથી યુવતીની સગાઈ કરવાની તૈયારીઓ શરૂ કરી હતી. તેથી યુવક હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની પિટિશન કરી હતી. કોર્ટના આદેશ બાદ યુવતીને હાઈકોર્ટ સમક્ષ હાજર કરાઈ હતી. જેમાં તેણે પતિ સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પુત્રીની બળજબરીથી લગ્ન કરાવવા બદલ હાઈકોર્ટે પિતાની ઝાટકણી કાઢી હતી અને દંપતીને પોલીસ રક્ષણ સાથે છોટાઉદેપુર મોકલવાનો નિર્દેશ કર્યો હતો.

## નરોડામાં મહિલાની હત્યા : પ્રેમીએ મહિલા પહેલા નદીમાં ફૂદી આપાઘાત કર્યો હતો

**અમદાવાદ**

નવા નરોડા હંસપુરા પાસે સંકલ્પ સિટીના ઈ બ્લોકના મકાનમાં મહિલા પહેલા મૂળ ખેડાના વતની કેલાશબહેન ભઈજીભાઈ ચૌહાણ ભાડે રહેવા માટે આવ્યા હતા. તા.૨૭ના અમરેલીથી મકાન માલિક ભાડુ લેવા માટે આવ્યા હતા આ સમયે ઘરે જઈ તપાસ કરતાં મકાનને બહારથી તાળું મારેલું હતું, જેથી મહિલા મકાન ખાલી કરીને જતી રહી હોવાની શંકા આધારે તેઓ તાળુ તોડીને ઘરમાં જોયું તો કોઈ અજાણી વ્યક્તિએ મહિલાને છરીના ઘા મારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. જેને મકાન માલિકે નરોડા પોલીસને જાણ કરી હતી. નરોડા

પોલીસે આવીને તપાસ કરીને મહિલાના પરિવારજનો સંપર્ક કર્યો હતો તો મહિલાના માતા-પિતાએ અમારે કોઈ લેવા દેવા નથી તેમ કહીને પોલીસ ફરિયાદ કરવાનો ઈન્કાર કર્યો હતો. જેને લઈને પોલીસ ખુદ ફરિયાદી બનીને તપાસ હાથ ધરતા ગળા સહીત શરીરના ભાગે છરીના ઘા મારેલા હતા અને છરી પણ લાશ પાસેથી મળી આવી હતી. નરોડા પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા છૂટાછેડા બાદ મકાનમાં એકલી જ રહેતી હતી, બીજીતરફ મહિલાનાએ એક પ્રેમીએ મહિલા પહેલા નદીમાં પડીને આપાઘાત કર્યો હતો તો મકાનમાંથી બીજા યુવક સાથે લગ્ન કર્યા હોવાના પુરાવા મળી આવ્યા હતા.

## નિત્યાનંદ આશ્રમની વિદેશ જતી રહેલી યુવતીઓનો દૂતાવાસમાં હાજર થવા ઈનકાર

**અમદાવાદ**

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી ડી.પી.એસ. સ્કૂલમાં એક સમયે ચાલતા નિત્યાનંદ આશ્રમમાંથી લાપતા થયેલી યુવતીઓએ ભારત બહારના કોઈ અજ્ઞાત સ્થળેથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જવાબ મોકલાવ્યો છે કે તેઓ વિદેશમાં આવેલા કોઈપણ ભારતીય દૂતાવાસમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર નહીં થાય. તેઓ અમેરિકામાં આવેલા યુનાઈટેડ નેશન્સમાં આવેલા ભારતીય હાઈકમિશન સમક્ષ હાજર થવા માંગે છે. હાઈકોર્ટે ફરી કેન્દ્ર સરકારને આ અંગે જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપી વધુ સુનાવણી ત્રીજી માર્ચના રોજ નિયત કરી છે. બન્ને પુત્રીઓને શોધવા હેબિયસ કોર્પસની રિટ કરનારા જનાર્દન શર્માની અરજી અંગે આજે સુનાવણી હાથ ધરાઈ હતી.





## પ. બંગાળમાં મમતાનો ડંકો, 108માંથી 103 નગર પાલિકાઓમાં જીત, ભાજપનો સફાયો

ડાબેરી પક્ષોના ફાળે 1 નગર પાલિકા, 3 નગર પાલિકાઓમાં કોઈને બહુમત મળી નહીં

કલકત્તા

બંગાળમાં નગર પાલિકાઓની ચૂંટણીમાં પણ મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો છે. બીજી તરફ ભાજપ અને બીજી પાર્ટીઓનો સફાયો થઈ ગયો છે.

બંગાળની 108 નગર પાલિકાઓ પૈકી 103માં ટીએમસીએ વિજય મેળવ્યો છે. જ્યારે ડાબેરી પક્ષોના ફાળે એક નગર પાલિકા આવી છે. ત્રણ નગર પાલિકાઓમાં કોઈને બહુમત મળી નથી. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસને એક પણ નગર પાલિકામાં જીત મળી નથી.



આ ચૂંટણીએ ફરી સાબિત કર્યું છે કે, બંગાળની રાજનીતિ પર ટીએમસી સંપૂર્ણપણે કબ્જો કરીને બેઠું છે.

ટીએમસીએ કહ્યું હતું કે, જેને વોટ આપ્યો છે તેનો પણ આભાર અને જેણે વોટ નથી આપ્યો તેનો પણ આભાર. બંગાળની સંસ્કૃતિ એકતાની સંસ્કૃતિ

છે. વિરોધી ઉમેદવારોને અપીલ છે કે, તેમ જ્યારે પણ કોઈ જરૂર હોય તો અમે પુરી કરીશું.

આ પહેલા કોંગ્રેસ અને ભાજપે ચૂંટણીમાં ટીએમસી પર ગરબડ કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે ચૂંટણીએ ભાજપને સૌથી વધારે નુકસાન કર્યું છે. ભાજપના વોટ શેરમાં ઘટાડો નોંધાયો છે. ભાજપના જે નેતાઓનો પ્રભાવ હતો તેવી નગર પાલિકાઓ પર પણ ભાજપ જીત મેળવી શક્યું નથી. રાજકીય રીતે બંગાળમાં ભાજપ હવે વધારે નબળી પડી છે.

## એનસીબી નાણાકીય નિષ્ણાતો, ફોરેન્સિક ઓડિટર્સની મદદ લેશે

ડ્રગ્સના હાઇ પ્રોફાઇલ, જટિલ કેસોની સતત વધતી સંખ્યા

નવી દિલ્હી

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ માદક પદાર્થો સાથે સંકળાયેલા કેસોના ઉકેલ માટે નિષ્ણાતોની એક ટીમની સેવાઓ લેવાનું નક્કી કર્યું છે. એનસીબી હવે નાણાકીય નિષ્ણાતો અને ફોરેન્સિક ઓડિટરોની મદદથી ડાર્ક વેબ અને ક્રિપ્ટો કરન્સીથી જોડાયેલ માદક પદાર્થોના બિઝનેસની તપાસ કરશે.

ગયા વર્ષે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના પ્રમુખ એસ એન પ્રધાને નિર્દેશ આપ્યા હતાં કે એજન્સીના અધિકારીઓને ફક્ત

આંતર રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કેસો, જટિલ તપાસ અને હાઈ પ્રોફાઇલ કાર્ટેલ અને સિન્ડિકેટ સાથે જોડાયેલ કેસોની તપાસ કરવી જોઈએ. તેમણે બ્યુરોના તપાસ એકમોને જણાવ્યું હતું કે માદક પદાર્થોના કેસો સાથે જોડાયેલ લેવડદેવડની સમગ્ર તપાસ કરે અને સંબંધિત કોર્ટમાં સમયસર ચાર્જશીટ દાખલ કરે.

આ દિશા નિર્દેશ એવા સમયે આપવામાં આવ્યા છે જ્યારે એનસીબીની મુંબઈ ઓફિસ અનેક હાઈ પ્રોફાઇલ અને જટિલ કેસોની તપાસ કરી રહી છે.

## ભારત-પેએ ગ્રોવરને કંપનીના તમામ પદોથી દૂર હટાવી દીધા

નવી દિલ્હી

પેમેન્ટ સ્ટાર્ટઅપ ભારતપેના સહ સંસ્થાપક અશીનર ગ્રોવરને તેમણે આચરેલી અનિયમિતતા બદલ કંપનીમાંથી તમામ પદો પરથી દૂર કરવામાં આવ્યા છે. હવે કંપની ગ્રોવરના કેટલાક શેરોની હિસ્સેદારી પરત લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. દુકાનદારોને ક્યુઆર કોડ દ્વારા ડિજિટલ પેમેન્ટ કરવાની સુવિધા આપનારી ભારતપે એ નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી બોર્ડ મિટિંગનો એજન્ડા મળ્યા પછી ગ્રોવરે પોતાના પદોથી રાજીનામું આપી દીધું હતું.

કંપનીની બોર્ડ મિટિંગ ગઈકાલે મોડી રાત સુધી ચાલી હતી. આ બેઠકમાં ગ્રોવરે આચરેલી અનિયમિતતા અંગે કરવામાં આવેલા સ્વતંત્ર ઓડિટના રિપોર્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભારતપેએ જણાવ્યું છે કે ઓડિટ રિપોર્ટમાં સામે આવેલા તથ્યોને આધારે તેની પાસે ગ્રોવર સામે કાર્યવાહી કરવાનો અધિકાર છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગ્રોવર પરિવાર અને તેમના સંબંધીઓએ કંપનીના ફંડમાં ગેરરીતિઓ આચરી છે. આટલું જ નહીં ગ્રોવર પરિવારે નકલી વેન્ડર બનાવી કંપનીના ખાતાઓમાંથી નાણાંની હેરાફેરી પણ કરવામાં આવી હતી.

## ફેબ્રુઆરી 2022માં નિકાસ 22.36% વધી 33.81 અબજ ડોલર, આયાતમાં પણ વધારો

આયાત 35 ટકા વધીને 55 અબજ ડોલર : વેપાર ખાધ વધીને 21.19 અબજ ડોલર

નવી દિલ્હી

ફેબ્રુઆરી, 2022માં ભારતની નિકાસ 22.36 ટકા વધીને 33.81 અબજ ડોલર રહી છે તેમ વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. ફેબ્રુઆરીમાં એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ અને કેમિકલ જેવા સેક્ટરના ઉત્પાદનોની નિકાસ વધવાને કારણે દેશની નિકાસમાં ઉછાળો જોવા મળ્યો છે.

જો કે ફેબ્રુઆરી, 2022માં આયાત પણ 35 ટકા વધીને 55 અબજ ડોલર રહી છે. જેના કારણે ફેબ્રુઆરી, 2022માં વેપાર ખાધ 21.19 અબજ ડોલર રહી છે. આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત વેપાર ખાધ તરીકે ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી, 2021માં વેપાર ખાધ 19.32 અબજ ડોલર રહી હતી.



વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર એપ્રિલ, 2021થી ફેબ્રુઆરી, 2022 સુધીના સમયગાળામાં દેશની કુલ નિકાસ 33.81 અબજ ડોલર રહી છે. જે એપ્રિલ, 2020થી ફેબ્રુઆરી, 2021 સુધીના સમયગાળા કરતા 8.19 ટકા વધુ છે.

## સ્વામી પ્રસાદ મૌર્યના કાફલા ઉપર પથ્થરમારો, ભાજપના સમર્થકો સામે લગાવ્યા ગંભીર આરોપ

કારના કાય તૂટ્યા : સ્વામી મૌર્યએ કહ્યું, આ હુમલો ભાજપની હતાશાનું પ્રતિક છે

કુશીનગર

ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં યુપીના પૂર્વ કેબિનેટ મંત્રી અને સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પથ્થરમારોના કારણે અનેક વાહનોના કાય તૂટી ગયા હતા. આ ઘટનાનો આરોપ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો પર લગાવવામાં આવ્યો છે. સ્વામી પ્રસાદ મૌર્યની પુત્રી ભાજપ સાંસદ સંઘમિત્રા મૌર્યએ કહ્યું કે તેમના પિતા પર ભાજપના લોકોએ હુમલો



કર્યો છે. મળતી માહિતી મુજબ યુપીના કુશીનગરમાં સ્વામી પ્રસાદ મૌર્યના કાફલા પર થયેલા પથ્થરમારોમાં લગભગ એક ડઝન વાહનોના કાય

તૂટી ગયા છે. ભાજપના કાર્યકરો પર પથ્થરમારો કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યના સમર્થકો પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા જઈ રહ્યા હતા. આ ઘટના બલવા પટ્ટી ગામમાં બની હતી. ઘટના બાદ સપામાં રોષ જોવા મળી રહ્યો છે. પથ્થરમારોની ઘટના બાદ સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યના સમર્થકોએ રસ્તો રોકીને પ્રદર્શન કર્યું હતું. ગોડરિયા બજારમાં સમર્થકોએ રસ્તો બ્લોક કર્યો હતો.

## ગુરુગ્રામ કોઠીમાંથી વિસ્ફોટકોનો ખજાનો મળી આવતા ખળભળાટ

હેન્ડ ગ્રેનેડ-કારતૂસ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ

નવી દિલ્હી

દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં જંગી માત્રામાં વિસ્ફોટકો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. હકીકતમાં, ગુરુગ્રામ પોલીસને માહિતી મળી હતી કે સેક્ટર 31ની કોઠીમાં વિસ્ફોટકોનો મોટો જથ્થો પડ્યો છે. ઘટનાસ્થળે પહોંચેલી ગુરુગ્રામ પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે P-12 નંબરની કોઠીમાં વિસ્ફોટકોનો મોટો જથ્થો પડ્યો છે.

આ બાબતની માહિતી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને આપવામાં આવી

હતી, ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે કોઠીમાં પડેલા વિસ્ફોટકોનો સાવધાની પૂર્વક નિકાલ કરીને મામલાની તપાસ શરૂ કરી છે. ગુરુગ્રામ પોલીસનું કહેવું છે કે આ કોઠી દિલ્હીમાં રહેતા એક વેપારીની જણાવવામાં આવી રહી છે. પોલીસે 2 હેન્ડ ગ્રેનેડ, 14 ટ્રેઈની હેન્ડ ગ્રેનેડ અને મોટી માત્રામાં ગોળીઓ જપ્ત કરી છે. આ સમગ્ર મામલે ડીસીપી વિરેન્દ્ર બિજના જણાવ્યા અનુસાર, ખાતમીદારની ચોક્કસ સૂચના પર અહીં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

## કંકાસ થાય તો માતા-પિતા પુત્રવધુને ઘરમાંથી કાઢી શકે : દિલ્હી હાઈકોર્ટ

નવી દિલ્હી

દિલ્હી હાઈકોર્ટે પત્નીના તેના સાસરીયામાં સંપત્તિના અધિકારોને લઈને એક ચુકાદો આપ્યો હતો. અને તહુ હતું કે પુત્રવધુ અને પુત્રની વચ્ચે ઝઘડો થાય અને તેની અસર વૃદ્ધ માતા પિતા પર થતી હોય તો આવા માતા પિતા પોતાની પુત્રવધુને ઘર બહાર કાઢવાનો અધિકાર ધરાવે છે. જઘડાથી મૂકિત ન પામી શકનારી પુત્રવધુને સંયુક્ત ઘરમાં રહેવાનો અધિકાર નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે પુત્રવધુ અને પુત્ર વચ્ચેના જગડા માતા-પિતા શા માટે સહન કરે? આ સમગ્ર મામલામાં સાસુ અને સાસરા વૃદ્ધ છે અને તેથી શાંતિપૂર્ણ જીવન જીવવા અને પુત્રવધુ તેમજ પુત્રના જગડાથી પ્રભાવિત ન થાય તેવો તેને અધિકાર પણ છે.

## જળવાયુ પરિવર્તનના લીધે વિશ્વની અડધી વસ્તી પર તોળાતો ભય ક્લાઈમેટ ચેન્જને કારણે ભારતમાં મોટાપાયે વધેલું દુષ્કાળનું જોખમ

નવી દિલ્હી

ક્લાઈમેટ ચેન્જને કારણે દેશના સમુદ્રી કિનારા વાળા શહેરો તેમજ હિમાલયની આસપાસના વિસ્તારો પર મોટી અસર થઈ શકે છે. ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (આઈપીસીસી)ની રિપોર્ટના જણાવ્યા અનુસાર જો ક્લાઈમેટ ચેન્જ સામે હાલ પગલા ન લેવામાં આવ્યા તો પુરી દુનિયા માટે પરિણામ બહુ જ ઘાતક સાબિત થઈ શકે છે. હવામાન બદલવાને કારણે વધુ આથવા ઓછો વરસાદ, પુર,

ગરમીનું પ્રમાણ વધી શકે છે. આ રિપોર્ટમાં વધી રહેલા તાપમાનને કારણે ભારતના કૃષિ ક્ષેત્ર પર માઠી અસર પહોંચશે. ક્લાઈમેટ ચેન્જ અને તેની સાથેનાં પરિબળોની તીવ્ર અસરથી 2050ના અંત સુધીમાં એશિયાની ગંગા, સિંધુ, અમૂ દરિયા સહિત અન્ય નદીઓના તટમાં પાણીની તીવ્ર કટોકટી સર્જાઈ શકે છે. ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જના અહેવાલમાં આવી ગંભીર ચેતવણી આપવામાં આવી છે.

## હવે મુસાફરો QR કોડથી સ્કેન કરી લાંબા અંતરની ટ્રેનોની ટિકિટ લઈ શકશે

નવી દિલ્હી

ભારતીય રેલવે વિભાગના રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ક્યૂ આર કોડથી ટ્રેનમાં સફર કરનારા મુસાફરો ટિકિટ ખરીદી શકશે એવી જાહેરાત કરી છે. આથી ઓટોમેટિક ટિકિટોના માધ્યમથી હવે આ નવો ડિજિટલ વિકલ્પ મળશે અને રોકડા નાણા ખર્ચવા પડશે નહીં. કેસલેશ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે એટીવીએમ પર યૂપીઆઈના માધ્યમથી આ ડિજિટલ સુવિધા પ્રથમ વાર શરૂ કરવામાં આવી છે. રેલવે સ્ટેશનો પર ઈનસ્ટોલ કરવામાં આવેલા એટીવીએમ એક ટચ સ્ક્રીન આધારિત ટિકિટિંગ કિયોસ્ક છે જે પ્રવાસીઓને સ્માર્ટકાર્ડ વિના ડિજિટલ પેમેન્ટ કરવાનો વિકલ્પ આપે છે.



# યુક્રેનથી ભારતીયોને સ્વદેશ લાવવા ઓપરેશન ગંગા

ભારતીયોને પરત લાવવા એરફોર્સની મદદ લેવાશે : યુક્રેન મુદ્દે પીએમ મોદીએ સતત ત્રીજા દિવસે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

નવી દિલ્હી

યુક્રેનમાં રશિયાનું આક્રમણ વધુ ઘાતક બની રહ્યું છે ત્યારે ભારતે યુદ્ધઝરત દેશમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે 'ઓપરેશન ગંગા' અભિયાનને વધુ ઝડપી બનાવતા એરફોર્સને પણ સામેલ કરી છે. આ મિશનમાં દેશની ખાનગી એરલાઈન્સ પણ જોડાઈ છે. કેન્દ્ર આગામી ત્રણ દિવસમાં ૨૬ ફ્લાઈટ્સ મારફત યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને સ્વદેશ લાવશે. મંગળવારે ૬૧૬ ભારતીયોને પરત લવાયા હતા. બીજાબાજુ વિદેશ સચીવે મંગળવારે મોડી રાત્રે કહ્યું હતું કે ક્રીવમાંથી બધા જ ભારતીયો બહાર નીકળી ગયા છે. યુક્રેનમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે ત્યારે સ્થિતિની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વધુ એક વખત ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. યુક્રેનમાં મંગળવારે રશિયાના હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થવા અંગે વડાપ્રધાન મોદીએ ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને લાવવા માટે ભારતીય હવાઈદળને ઉતારવાનો નિર્ણય લીધો છે. ઓપરેશન ગંગાના ચોથા દિવસે મંગળવારે યુક્રેનના પશ્ચિમી પડોશી દેશો રોમાનિયા અને હંગેરીમાંથી ૬૧૬ ભારતીયોને પરત લવાયા હતા. ખાનગી એરલાઈન્સ અત્યાર સુધીમાં નવ વિશેષ ફ્લાઈટ્સમાં ૨,૦૧૨ ભારતીયોને પરત લાવી છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું હતું કે, ભારતીયોને લાવવા માટે પોલેન્ડમાં બુચારેસ્ટ અને બુડાપેસ્ટ તેમજ સ્લોવાક રિપબ્લિકમાંથી પણ ફ્લાઈટ્સ ચલાવવામાં આવી રહી છે.

## અત્યાર સુધી ૬૪૦૦ ભારતીય યુક્રેનથી પરત ફર્યા, વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓ સામે મુલાકાત કરી



રશિયા અને યુક્રેન વચ્ચે સતત આઠમા દિવસે લડાઈ ચાલુ છે અને રશિયન સેનાએ યુક્રેનના દક્ષિણી શહેર ખેરસોન પર પણ કબજો કરી લીધો છે. રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે આજે વાતચીત કરી શકે છે. આ માટે રશિયન ડેલિગેશન બેલારુસ-પોલેન્ડ બોર્ડર પર પહોંચી ગયું છે. તો બીજી તરફ રશિયાના સૈન્ય ઓપરેશનથી ખરાબ રીતે પ્રભાવિત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે અભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસીમાં યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને મળ્યા હતા. ઘરે પરત ફરેલા વિદ્યાર્થીઓએ પીએમ સાથે તેમના અનુભવો શેર કર્યા હતા. પીએમને મળેલા આ વિદ્યાર્થીઓ વારાણસી તેમજ ઉત્તર પ્રદેશના અન્ય ભાગોના હતા. બેંકે હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં ત્યાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા લગભગ ૨૦ હજાર ભારતીયોને પીએમ મોદીએ ઓપરેશન ગંગા હેઠળ ત્યાંથી બહાર કાઢવા છે. ભારત સરકાર ત્યાં ફસાયેલા તેના વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. એટલા માટે યુક્રેનના પાડોશી દેશો સાથે વાત કર્યા બાદ તમામ ભારતીયોને સફળતાપૂર્વક પરત લાવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

### ભારતીયોને રોમાનિયાથી લાવવા ક્વાયત તેજ

રોમાનિયા થકી ભારતીયોને સ્વદેશ ઝડપથી પરત મોકલી શકાય તે માટે જ્યોરાદિત્ય સિંઘિયા બુચારેસ્ટ પહોંચ્યા છે. રોમાનિયા સ્થિત ભારતીય એમ્બેસીએ યુક્રેનના ઓડિસામાં અટવાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મોલ્ડોવાના રસ્તે રોમાનિયા થકી સ્વદેશ પહોંચવાની વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું છે. એમ્બેસી યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને મોલ્ડોવાના રસ્તે ઓડિસાથી રોમાનિયાની રાજધાની બુચારેસ્ટ પહોંચાડવા માટે ત્યાંની લોકલ ઓથોરિટી સાથે સંપર્કમાં છે.

### યુક્રેનમાં વધુ એક ભારતીયનું મોત, પંજાબનો રહેવાસી હતો

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન બુધવારે વધુ એક ભારતીયનું મોત થયું છે. જાણવા મળ્યા મુજબ મૃતક વિદ્યાર્થી પંજાબનો રહેવાસી હતો. મંગળવારે પણ ખારકીવના શેલિંગ ખાતે એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. મૃતક ચંદન જિન્દાલ (22) વિનિલ્સિયા નેશનલ મેડિકલ યુનિવર્સિટી, વિનિલ્સિયા, યુક્રેન ખાતે અભ્યાસ કરતો હતો. ઈસ્કેમિક સ્ટ્રોક બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના પિતાએ તેના મૃતદેહને ભારત પહોંચાડવામાં મદદ કરવા માટે સરકારની મદદ માગી છે. હુમલામાં માર્યા ગયેલા કર્ણાટકના વિદ્યાર્થીના મૃતદેહને પરત લાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

### ભારતીયોને બહાર કાઢવા રશિયા બોર્ડર ખોલશે

પૂર્વ યુક્રેનમાં ફસાયેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને રાહત મળે તેવા અહેવાલો મળી રહ્યા છે. રશિયાની સેનાના આક્રમ વચ્ચે રશિયાના ભારતના રાજદૂત ડેનિસ અલીપોવનું કહેવું છે કે, ભારતીયોને અહીંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે વિનંતી મળી છે. આ સંબંધમાં અમે ભારતીય અધિકારીઓના સંપર્કમાં છે. અલીપોવના નિવેદનથી એવા સંકેત મળી રહ્યા છે કે, રશિયાના રસ્તે ભારતીય વિદ્યાર્થીઓને ભારત પાછા લાવવામાં આવી શકાય છે.

## પીયૂષ જૈનની રૂ. 197 કરોડમાં જીએસટી ચોરીમાં કાળી કમાણીનો કોડવર્ડ, કુફાજી

ડમી કંપનીઓના નામે નકલી ઇ-વે બિલ મોકલવામાં, નકલી બિલથી માલ મોકલાવો

લખનઉ

પીયૂષ જૈન પાસેથી પકડી પાડવામાં આવેલા રૂ. 197 કરોડના જીએસટીની ચોરીનો ખેલ એકદમ સંગઠિત અને સુનિયોજિત રૂપથી વિકસિત થઈ રહ્યો હતો. જીએસટીની ચોરીના સંપૂર્ણ બિઝનેસનો કોડવર્ડ હતો, કુફાજી. ડીજીજીઆઈની ટીમે જીએસટી ચોરીના આ કોડવર્ડને શોધી કાઢ્યો છે. કુફાજી કોડવર્ડ સાથે તૈયાર કરવામાં આવેલા 12 નકલી ઇ-વે બિલ તેના ઘરેથી અને



10 તેની કત્રોજ ફેક્ટરીથી મળી આવ્યા છે. ફોરેન્સિક તપાસમાં તેનો ઘટસ્ફોટ થયો હતો. ડમી કંપનીઓના નામે નકલી ઇ-વે બિલ મોકલવામાં આવતાં

હતાં. ગણપતિ રોડ કેરિયર્સના ડિરેક્ટર પ્રવીણ જૈન અને તેના પુત્ર રજત જૈનની મારફત નકલી ઇ-વે બિલ બનાવીને પીયૂષ જૈનને મોકલવામાં આવતાં હતાં. રજત જૈનના કર્મચારી રાજેશ રાયના ઇ-મેલ મારફત કુફાજીના નામથી બિલ મોકલવામાં આવતું હતું. ગણપતિ ટ્રાન્સપોર્ટના નકલી ઇ-વે બિલ ઉપર જ માલ મોકલવામાં આવતો હતો. તેમાં ખરીદનાર અને વેચનારનું નામ ખોટું રહેતું હતું.

## અલ્ટ્રા હાઇ-નેટવર્થ ધરાવનારાની 11%ના વધારા સાથે 13,637 થઈ

મુંબઈ

કોરોના મહામારીના કપરાકાળ દરમિયાન પણ ભારતમાં અલ્ટ્રા- હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ (UHNWI) ની સંખ્યા વર્ષ 2021માં 11 ટકા વધીને 13,637 થઈ છે. આવી વ્યક્તિઓની સંપત્તિમાં જંગી વધારો એ શેરબજારમાં તેજ અને ડિજિટલ ક્રોડને આભારી છે. જેમની સંપત્તિ 3 કરોડ ડોલર કે તેથી વધારે હોય તેમને અલ્ટ્રા હાઈ-નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ કહેવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ વર્ષ 2021માં વૈશ્વિક સ્તરે અબજોપતિઓની સંખ્યાના મામલે ભારત ત્રીજા ક્રમે

છે. અમેરિકા દુનિયામાં સૌથી વધુ 748 અબજોપતિઓ ધરાવતો દેશ છે, ત્યારબાદ 554 અબજોપતિઓ સાથે ચીન બીજા ક્રમે અને 145 અબજોપતિઓ સાથે ભારત ત્રીજા ક્રમે છે. ધી વેલ્થ રિપોર્ટ 2022 - શિર્ષક ધરાવતા અહેવાલમાં વૈશ્વિક સ્તરે અલ્ટ્રા હાઈ-નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલની સંખ્યા વર્ષ 2021માં 9.3 ટકા વધીને 6,10,569 થઈ ગઈ છે, જે વર્ષ 2020માં 5,58,828થી હતી. વધારે સંપત્તિ ધરાવતા HNIની વર્ષ 2021માં 11 ટકા વધીને 13,637 છે જે એશિયા પેસિફિક ક્ષેત્રમાં સૌથી વધુ વૃદ્ધિ છે.

## યુપીના મુખ્યમંત્રી યોગીએ મતદાન કરી BJPની જીત માટે કર્યો મોટો દાવો

લખનઉ

યુપી વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં પૂર્વાંચલની 57 સીટો પર મતદાન ગુરુવારે થયું હતું. જેમાં ઘણા દિગ્ગજ નેતાઓની વિશ્વસનીયતા દાવ પર છે. તેમાં સ્વામી પ્રસાદ મૌર્યથી લઈને રામ અચલ રાજભર અને લાલજી વર્મા જેવા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે. છઠ્ઠા તબક્કામાં સીએમ યોગી સહિત તેમના ઘણા મંત્રીઓની અગ્નિ પરીક્ષા છે. ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં સતીશ ચંદ્ર દિવેદી, ઉપેન્દ્ર તિવારી, આનંદ સ્વરૂપ શુક્લા મેદાનમાં હતા. મતદાન બાદ યોગીએ કહ્યું કે યુપીમાં મતદાન હવે નિષ્ણાંયક તબક્કામાં પહોંચી ગયું છે. તમે છેલ્લા 5 વર્ષમાં વિકાસના પ્રોજેક્ટ જોયા છે. તેમણે કહ્યું કે અમે આખા પ્રદેશમાં 80 ટકા સીટ જીતી જઈશું.

## દેશના સમુદ્રકિનારાના 35 કરોડ લોકો પર ક્લાઇમેટ ચેન્જનો ડર પ્રદૂષણને નિયંત્રિત નહીં કરાય તો ભારત માટે ગંભીર પરિણામ આવશે

નવી દિલ્હી

ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC)એ સોમવારે તેના છઠ્ઠા એસેસમેન્ટ રિપોર્ટનો બીજો હિસ્સો પ્રસિદ્ધ કર્યો હતો જેમાં તેણે વૈશ્વિક સમુદાય પ્રદૂષણને નિયંત્રણમાં લેવામાં નિષ્ફળ રહેશે તો ભારત સહિત તમામ દેશોએ તેના ખતરનાક પરિણામો ભોગવવાં માટે તૈયાર રહેવું પડશે. IPCC રિપોર્ટમાં જણાવાયું હતું કે દરિયાની જળસપાટીમાં વધારો થવાના

કારણે મુંબઈ સહિત દરિયાકિનારે વસેલા ભારતીય શહેરો પર ગંભીર પૂરનો ભય તોળાઈ રહ્યો છે. અમદાવાદ અર્બન હીટ આઈલેન્ડનો ગંભીર કેસ બની શકે છે. ચેન્નઈ, ભુવનેશ્વર, પટણા અને લખનઉ સહિત ઘણા શહેરોમાં ગરમી અને ભેજ ગંભીર સ્તર સુધી વધી શકે છે. પેનલે સૌપ્રથમવાર પ્રાદેશિક એસેસમેન્ટ કર્યું છે અને તેના રિપોર્ટમાં મેગા સિટી ઉપર પણ ફોકસ કરેલું છે.

## એર ઈન્ડિયાના સીઈઓ, એમડીનું પદ સ્વિકારવા ઈલકેર આયસીનો ઈનકાર

નવી દિલ્હી

એર ઈન્ડિયાના નવા સીઈઓ બનવાની ઓફર મળ્યાના બે જ સપ્તાહ બાદ તુર્કિશ એરલાઈન્સના પૂર્વ ચેરમેન ઈલકેર આઈસીએ આ પદ સ્વિકારવાની ના પાડી દીધી હતી. ટાટા ગુરૂપ દ્વારા તેમને સીઈઓની સાથે એમડી બનવાની પણ ઓફર કરી હતી. ભારતીય મીડિયા પર આરોપો લગાવીને આ પદને સ્વિકારવાની તેમણે ના પાડી દીધી હતી. નોંધનીય છે કે જેમને એર ઈન્ડિયાના ચેરમેન બનવાની ઓફર આપી તેમના પર એવા આરોપ છે કે તેઓ તુર્કીના રાષ્ટ્રપતિના ખાસ માણસ છે. તુર્કી ખુલ્લેઆમ પાકિસ્તાનને સમર્થન આપી રહ્યું છે. જેને પગલે ભારતમાં આ નિમણૂકનો વિરોધ શરૂ થયો હતો.





# ઠાકોરભાઈ દેસાઈએ લાક્ષણિક રીતે કહી દીધું: 'ત્યાં જઈને મારે શું મંજૂરા વગાડવાના છે?'

આ કથા ઠાકોરભાઈ દેસાઈની છે. નવી પેઢી માટે ઠાકોરભાઈ દેસાઈ અજાણ્યું નામ હશે. સ્વાભાવિક છે. હા, આજની પેઢી અમદાવાદમાં લો ગાર્ડન પાસે આવેલા ઠાકોરભાઈ દેસાઈ હોલને સારી રીતે જાણે છે. એ હોલ એમના નામનો જ છે. બસ એ જ ઠાકોરભાઈ દેસાઈની આ વાત છે. મોરારજી દેસાઈના જમાનાના તેઓ નેતા હતા. ૧૯૦૩ની સાલમાં જન્મેલા ઠાકોરભાઈ સ્વાતંત્ર્યસેનાની હતા અને અનેકવાર જેલમાં જઈ આવ્યા હતા. હિતેન્દ્રભાઈ દેસાઈના મંત્રીમંડળમાં તેઓ મંત્રી બન્યા હતા. માતૃભાષામાં જ શિક્ષણ આપવાના અને અંગ્રેજી આઠમા ધોરણથી જ શીખવવાના આગ્રહી હોઈ તેઓ ઠાકોરભાઈ આઠમાવાળા તરીકે પણ જાણીતા બન્યા હતા. સાદગી તેમની સ્વાભાવિક હતી. ગળી અને ઈસ્ત્રી વગરના જાડા ધોતિયા, કફની અને ગોળમટોળ ટોપીવાળા ઠાકોરભાઈ દેસાઈ હોવા છતાં અંગ્રેજી ભાષાના અચ્છા જાણકાર હતા. ગૂજરાત વિદ્યાપીઠમાં ભણ્યા હતા અને તે જ સંસ્થાના વાઈસ ચાન્સેલર પણ બન્યા હતા. રોટલો ને મરચું ખાઈને જીવન ગુજારતા રણિયા-હળપતિ (ગરીબ લોકો)ના તેઓ હિતચિંતક હતા.

## મંજૂરા વગાડવા નથી

ધારાસભા કે પાર્લમેન્ટમાં જવા માટે આજે લોકો જાતજાતની રીતરસમો અને ખુશામતો કરે છે ત્યારે ઠાકોરભાઈ એક ભિન્ન પ્રકૃતિના માણસ હતા. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને તે પછી પ્રદેશ પ્રમુખ બન્યા હતા. રાજકારણમાં રહી પ્રજાનાં કામો કરવા માટે વિધાનસભા કે સંસદમાં જવું જોઈએ કે પ્રધાનપદું મેળવવું જોઈએ અને એમ કરવાથી જ પ્રજાનાં કામો થાય એમ તેઓ માનતા

નહોતા. પક્ષના પ્રમુખપદે પહોંચ્યા પછીય તેમણે ક્યારેય વિધાનસભા કે સાંસદની ટિકિટ મળે તેવી ઈચ્છા રાખી નહોતી. ૧૯૫૭ના અરસામાં તેમને રાજ્યસભાની ટિકિટ આપવાનું સૂચન થયું ત્યારે તેનો ઈન્કાર કરતાં. તેમણે લાક્ષણિક રીતે કહ્યું હતું : 'ત્યાં જઈને મારે શું મંજૂરા વગાડવાના છે?' તેમણે મંજૂરા વગાડવાનો વિકલ્પ ના સ્વીકાર્યો અને ગુજરાતના સંસ્થાકીય રાજકારણના કેન્દ્રમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું.'

## ચાલીને કોંગ્રેસ ભવન જતાં

હાલ જ્યાં સરદાર સ્ટેડિયમ છે ત્યાં ૧૯૫૦ના સમયમાં બે તલાવડીઓ અને ટેકરો હતાં. તેની સામે નવજીવન બ્લોકસ બાંધવામાં આવ્યા હતા. ૧૯૫૩ પછી ઠાકોરભાઈ નવજીવન પ્રેસના ટ્રસ્ટી તરીકે અહીં રહેવા આવ્યા હતા. નદી પારનો આ વિસ્તાર વગડા જેવો હતો. બસ પકડવી હોય તો હાલના સરદાર સ્ટેડિયમવાળી જગાએથી ઈન્કમેટેક્સ સુધી ચાલીને જવું પડતું. એ જમાનામાં ટૂંકી પોતડી, ઝભ્ભો અને માથે તીરછી ટોપી પહેરી ઠાકોરભાઈ દેસાઈ ધગધગતા ઉનાળામાં નવજીવન બ્લોકસ(સરદાર સ્ટેડિયમ પાસે)થી કોંગ્રેસ હાઉસ, ભદ્ર, લાલ દરવાજા સુધી ચાલીને જતા. એ વખતે નેહરુભિજ નહોતો. નદી ઓળંગવા ગાંધી પુલ કે એલિસબ્રિજ જ ઓળંગવો પડતો. ઠાકોરભાઈ ગાંધી પુલ ઓળંગી કોર્ટની રાંગે રાંગે ચાલતા ભદ્ર-કોંગ્રેસ હાઉસના રોજ ચારથી પાંચ કલાક બેસતા.

## ફી ભરવા પૈસા નહોતા

ઠાકોરભાઈ દેસાઈ મૂળ સૂરત જિલ્લાના ખરસાડ ગામના વતની હતા, પરંતુ અમદાવાદ આવી ઘર વસાવ્યું. ત્યારે ફર્નિચરમાં તેમણે બે ખુરશીઓ, એક ટેબલ, આરામ કરવા એક

પાટિયું, બાળકોને રાખવા માટે બે ઢાળિયાં, રેડિયો મૂકવા અડધિયું કબાટ, પાટીવાળા બે ખાટલા અને લાકડાની બે પેટી બનાવવાની હતી. અમદાવાદમાં ઉનાળો

લખે છે, '૧૯૪૮માં હું અને કિલબિલ સી. એન. સ્કૂલમાં ભણતાં હતાં. એક મહિને ફી ના ભરી શકવાના કારણે અમને બંનેને વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં.' બીજા

દેસાઈના પુત્ર જિતેન્દ્ર દેસાઈને પત્રકારત્વના અભ્યાસ માટે નાગપુરની કોલેજમાં જવું હતું પરંતુ ત્યાં હોસ્ટેલમાં રહી, ભણવાનું હોઈ એ ખર્ચ માટેની આર્થિક વ્યવસ્થા ના હોઈ ઠાકોરભાઈ દેસાઈએ પુત્રને ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ કર્યો હતો. અહીં પણ ફી મોડી ભરવા બદલ નોટિસ મળી હતી.

## કંકોતરી ના છપાવી

પુત્રી કિલબિલનાં લગ્ન વખતે ઠાકોરભાઈએ કંકોતરી પણ છપાવી નહોતી. લગ્ન મુંબઈમાં હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી યશવંતરાય ચવાણને પણ ઠાકોરભાઈ આપવા ગયા હતા. યશવંતરાય ચવાણને દિલ્હી જવાનું હોઈ તેઓ આવી શકશે નહીં તેમ તેમણે કહ્યું ત્યારે ઠાકોરભાઈએ ચવાણના પટાવાળા વિદુને લગ્નમાં મોકલવા કહ્યું હતું.

મુંબઈમાં પ્રાંતીય સરકારો રચાઈ ત્યારે ખરે સાહેબ મુખ્યમંત્રી અને મોરારજી દેસાઈ ગૃહમંત્રી હતા. એ વખતે વિદુ પણ દોરીદાર પાઘડી, સફેદ કોટ અને લાલ પટ્ટો પહેરતો પટાવાળો હતો. એ વખતે ઠાકોરભાઈ મોરારજીભાઈના પીએ હતા. તે પછી મોરારજીભાઈ કેન્દ્રમાં ગયા અને વિદુ પણ યશવંતરાય ચવાણ સાથે આવી ગયો. ઠાકોરભાઈએ વિદુને જોતા જ કહ્યું, 'ચવાણ સાહેબ, તમે આવી ના શકો તો કોઈ વાંધો નહીં પણ આ વિદુને ખાસ રજા આપજો જેથી તે મારી પુત્રીના લગ્નમાં આવે. એ મારો જૂનો સાથી છે. કિલબિલને એણે નાનપણમાં હેતથી રમાડી છે.' લગ્નમાં વિદુ આવ્યો. ઠાકોરભાઈ માટે મુખ્યમંત્રી યશવંતરાય અને તેમના પટાવાળો એક સમાન હતા.

## હાર્યા એટલે હાર્યા

૧૯૬૪માં ચૂંટણી આવી. એ વખતે ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવાનું કામ

ઠાકોરભાઈ દેસાઈએ કર્યું હતું. કોંગ્રેસના નેતાઓએ ઠાકોરભાઈને આગ્રહ કર્યો કે, ઠાકોરભાઈને હવે વિધાનસભામાં મોકલવા જોઈએ. વાત સ્વીકારાઈ. ઠાકોરભાઈ માટે નવસારી મતવિસ્તાર વધુ અનુકૂળ હતો પરંતુ પોતાના વતન(વેગામ) ની અને ગણદેવીના જૂના સાથી કાર્યકર્તાઓની લાગણીથી તેઓ ગણદેવીમાંથી ચૂંટણી લડ્યા અને હાર્યા. ધનવાનો ઈચ્છતા નહોતા કે ગરીબોના હિતચિંતક ઠાકોરભાઈ વિધાનસભામાં આવે. ઠાકોરભાઈ હાર પચાવી શક્યા પરંતુ કાર્યકર્તાઓ તેમ કરી શક્યા નહીં. તેમણે એવો મુદ્દો શોધી કાઢ્યો કે મતદાનના ચોવીસ કલાક પહેલા પ્રચાર બંધ થઈ જવાની આચારસંહિતા છતાં સામેના ઉમેદવારે સભાઓ ભરી હતી તેના પુરાવા અને ફોટા રજૂ કરી ચૂંટણી રદ કરાવવા કોર્ટમાં જવું, પણ ઠાકોરભાઈએ એમ કરવા સંમતિ ના આપી.

અંતે કહ્યું 'હાર્યા એટલે હાર્યા... હવે આ બધાનો કોઈ અર્થ નથી.' તે પછી પણ કાર્યકરોના ચહેરા પર નિરાશા જોઈ ઠાકોરભાઈ બોલ્યા, 'તમારાં મોઢાં આવા કાળી શાહી જેવા કેમ થઈ ગયાં છે ? શું તમે કોઈ ગુનો કર્યો છે ? તમે મહેનત કરવામાં કોઈ ક્યાશ રાખી નથી. પછી આ હતાશા શાની ? હતાશા ખંભેરી નાંખો અને ટટ્ટાર થઈ જાવ. આવી સાત ચૂંટણીઓ હારી જઈએ તો પણ નિરાશ થવાનું ના હો...' કાર્યકરો સ્વસ્થ થઈ ગયા. એટલું કહી તેઓ ગણદેવીથી અમદાવાદ આવવા નીકળ્યા. અમદાવાદ આવીને તેમણે પહેલું કામ રેડિયો કાંતવાનું કર્યું. તેમણે કોંગ્રેસ જેટલું જ રેડિયામાં મન પરાયું.

## દેવેન્દ્ર પટેલ

### સંપર્ક

+91 98792 07102



ગળી અને ઈસ્ત્રી વગરના જાડા ધોતિયા, કફની અને ગોળમટોળ ટોપીવાળા ઠાકોરભાઈ દેસાઈ ગુજરાતી માધ્યમના આગ્રહી હોવા છતાં અંગ્રેજી ભાષાના અચ્છા જાણકાર હતા. ગૂજરાત વિદ્યાપીઠમાં ભણ્યા હતા અને તે જ સંસ્થાના વાઈસ ચાન્સેલર પણ બન્યા હતા. રોટલો ને મરચું ખાઈને જીવન ગુજારતા રણિયા-હળપતિ (ગરીબ લોકો)ના તેઓ હિતચિંતક હતા

આકરો છતાં ઘરમાં સિલિંગ ફેન વસાવ્યો નહોતો. રેડિયો તે વખતે લક્ઝરી ગણાતો. ઠાકોરભાઈને સમાચાર સાંભળવાની ટેવ છતાં રેડિયો વસાવી શક્યા નહોતા. રેડિયો સાંભળવા તેઓ રોજ જીવણકાકાના ઘેર જતા. ઠાકોરભાઈ દેસાઈના પુત્ર જિતેન્દ્ર દેસાઈ પિતાના સંસ્મરણો આલેખતાં 'રવિયા દુબળાના રખેવાળ' પુસ્તકમાં

દિવસે ઠાકોરભાઈ દેસાઈએ સી. એન. વિદ્યાલયના આચાર્ય ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ'ને ચિટ્ટી લખી સમયસર ફી ના ભરી શકવા માટે દિલગીરી વ્યક્ત કરી. ફી ભરવા માટે મુદત માંગી હતી. એ ચિટ્ટી વાંચ્યા બાદ ઠાકોરભાઈ દેસાઈનાં સંતાનોને વર્ગમાં બેસવા દેવામાં આવ્યાં હતાં. ૧૯૫૬માં ઠાકોરભાઈ

## જાણવા જેવું

### ભારતનો સૌથી ઊંચો ધોધ નોહકાલીકાય ધોધ

મેઘાલયના ચેરાપૂંજી નજીક આવેલો ધોધ નોહકાલીકાય ૩૪૦ મીટરની ઊંચાઈથી પડે છે. દેશનો આ સૌથી ઊંચો ધોધ ૨૩ મીટર પહોળો છે. આ ધોધ દરિયાની સપાટીથી ૧૨૩૯ મીટરની ઊંચાઈએ આવેલો છે. ચેરાપૂંજી સૌથી વધુ વરસાદ માટે પણ જાણીતું છે. નોહકાલીકાય ધોધ સાથે કા લિકાઈ નામની મહિલાની દંતકથા વણાયેલી છે. તેના નામ પરથી આ ધોધનું નામ નોહકાલીકાય પડેલું. આ ધોધ જ્યાં પડે છે તે સ્થળે એકદું થયેલું પાણી લીલા રંગનું હોય છે. ઊંચા ખડકો અને ગાઠ જંગલો વચ્ચે આવેલો આ ધોધ દુર્ગમ છે. આ ધોધ શિલોંગથી ૫૩ કિલોમીટરના અંતરે છે. ચેરાપૂંજીના જંગલો ભારે વરસાદને કારણે સમૃદ્ધ છે. ચેરાપૂંજી આસપાસ અનેક ધોધ છે. ખસી હિલ્સ ઉપર આવેલી ઈકો પાર્ક, દાઈનથેલેન ધોધ, કેમની ગુફાઓ વગેરે ખેવા લાયક સ્થળો છે. રામકૃષ્ણ મિશન પણ આ સ્થળે આવેલું છે. વૃક્ષોના જીવંત મૂળિયાના બનેલા પૂલો અહીં ખેવા મળે છે.

### બેટરી કે પાવર વિના કામ કરતું ગેસલાઇટર

સાધનોને વીજળી કે બાહ્ય શક્તિની જરૂર પડે પરંતુ ગેસ લાઇટર એવું સાધન છે કે જેમાં કોઈ શક્તિની જરૂર પડતી નથી પરંતુ તણખો પેદા થાય છે. ગેસ લાઇટરની રચના સારી છે. લાંબી નળીમાં સ્પ્રિંગ વડે દબાણ પેદા કરતા ધાતુના બે ટુકડા પરસ્પર અથડાય તેવી રચના હોય છે. બટન દબાવો એટલે ખટાક અવાજ થઈને તણખો પેદા થાય છે. તેમાં વપરાતી ધાતુને પિગ્ગો ઘલેક્ટ્રિક કહે છે. પિગ્ગો એટલે દબાણ. ઘણી ધાતુઓમાં દબાણ કે ઘર્ષણથી તણખા પેદા થાય તે તમે જોયું હશે. જૂના વખતમાં ચક્રમક લોટાના ટુકડા સાથે અથડાવીને અગ્નિ પેદા કરાતો. જૂના વખતના લાઇટરમાં પથર વપરાતી જેને ઘસારો લાગે તો તણખો પેદા થતો. ગેસ લાઇટરમાં ઊંચા પ્રકારના પિગ્ગો ઘલેક્ટ્રિક ધાતુના ટુકડા હોય છે. આ ધાતુને આઘાત થાય ત્યારે પોઝિટીવ અને નેગેટિવ આયનો છૂટા પડે. બેટરીની જેમ ઓછો વીજભાર હોય તે તરફ કરંટ વહે. આ ધાતુના એક ચોરસ સેન્ટીમીટરના ટુકડા ઉપર ૫૦૦કિલો વજનનું દબાણ થાય તો ૨૫૦૦ વોલ્ટ જેટલી વીજળી પેદા થઈ શકે.



# FIFA-UEFA દ્વારા ફૂટબોલ વર્લ્ડ કપમાંથી રશિયાની હકાલપટ્ટી

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ દ્વારા પુતિનના 'ઓલિમ્પિક ઓર્ડર' સન્માનને પાછું ખેંચી લેવાયું

રશિયન ખેલાડી સામે રમવા કરતાં ટૂર્નામેન્ટ પડતી મૂકીશ : સ્વિટ્ઝરલેન્ડ



લંડન

યૂક્રેનની સ્ટાર ટેનિસ ખેલાડી ઇલેના સ્વિટ્ઝરલેન્ડના રશિયન ખેલાડીઓ સામે રમવાનો ઇનકાર કરી દીધો છે. તેણે જણાવ્યું હતું કે તે કોઈ રશિયન ખેલાડી સામે રમવા કરતાં ટૂર્નામેન્ટની ઓપનર ટૂર્નામેન્ટને પડતી મૂકવાનું વધારે પસંદ કરશે. રશિયા તથા બેલારુસના ખેલાડીઓને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ દ્વારા તટસ્થ એથલેટ્સના બેનર હેઠળ લાવવામાં આવશે તો જ હું તેમની સામે રમીશ. હું કોઈ રશિયન ખેલાડીને યુદ્ધ માટે જવાબદાર ગણાવી રહી નથી.

યૂક્રેન ઉપર હુમલા કરવા બદલ રશિયાને વિશ્વથી અલગ કરી દેવાનું અભિયાન શરૂ થઈ ચૂક્યું છે અને રમતજગતે તો રશિયા સામે આકરાં પગલાં પણ ભરી લીધા છે અને હજુ કેટલાક આકરાં પ્રતિબંધો પણ લાદવામાં આવનાર છે. વિશ્વમાં ફૂટબોલની સૌથી મોટી સંચાલક સંસ્થા ફિફા અને યુરોપિયન ફૂટબોલ એસોસિયેશન (યુઈએફએ) દ્વારા રશિયાની ચાલુ વર્ષ કતાર ખાતે રમાનારા વર્લ્ડ કપમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રશિયન ફૂટબોલ ક્લબો ને વિશ્વભરની પ્રત્યેક ટૂર્નામેન્ટ અને

## હોકી જુનિયર વર્લ્ડ કપમાંથી પણ રશિયા બહાર થયું

ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને પણ વૈશ્વિક રમતજગતને સમર્થન આપીને રશિયાને આગામી એફઆઇએચ વિમેન્સ જુનિયર હોકી વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું છે. આ ટૂર્નામેન્ટ પહેલીથી વરમી એપ્રિલ સુધી સાઉથ આફ્રિકાના પૉર્ટફ્રેટમ ખાતે રમાશે. આ પહેલાં ફિફા અને યુરોપિયન ફૂટબોલ ફેડરેશને પણ રશિયા અને બેલારુસની ક્લબોને ફૂટબોલની મેજર લીગમાંથી બહાર કરી દીધા છે. ટેનિસ ફેડરેશને પણ બજે દેશની મેન્સ ડેવિસ કપ તથા વિમેન્સ બિલી બિન કિંગ કપ ટૂર્નામેન્ટમાંથી હકાલપટ્ટી કરી દીધી છે.

એમ્પિયનશિપમાંથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. હવે વિવિધ રમતોના રશિયન ખેલાડીઓ જ પોતાના દેશની સરકારની આકરી ટીકાઓ કરીને તેમને

## હોકી, ટેનિસ અને શૂટિંગ સહિત વિવિધ ગેમ્સમાં રશિયાની સાથે હવે બેલારુસ પણ સસ્પેન્ડ થયું

લંડન : યૂક્રેન ઉપર કરેલા હુમલા બાદ રશિયાની સાથે હવે બેલારુસને પણ વિશ્વના રમત ફેડરેશન, ઓલિમ્પિક સમિતિ તથા અન્ય મેજર ઇવેન્ટ્સમાંથી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યું છે. પહેલી માર્ચથી રશિયાને જે રમતોની યજમાની મળી છે તે પણ પાછી ખેંચી લેવામાં આવી છે. જોકે ઓલિમ્પિક સમિતિએ રશિયન ખેલાડીઓને વ્યક્તિગત સ્પર્ધાઓમાં નેશનલ ફ્લેગ અને રાષ્ટ્ર ગીત વિના રમવાની મંજૂરી આપી છે પરંતુ આ નિર્ણયનો પણ ચોમેરથી મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. વિશ્વભરના મોટા સ્પોન્સર્સ પણ રશિયા સાથેનો નાતો તોડ્યો છે. રશિયન કંપનીઓ પણ આ યુદ્ધનો વિરોધ કરીને પોતાના દેશમાં યોજાનારી મેજર ઇવેન્ટ્સથી દૂર થઈ રહી છે. ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, ફૂટબોલની વિવિધ લીગ, સાઇકલિંગ, ફોર્મ્યુલા વન, એથલેટિક્સ, બેડમિન્ટન બાદ હવે શૂટિંગ, હોકી તથા ટેનિસની રમતોનું સંચાલન કરનાર સંસ્થાઓએ રશિયા ઉપર પ્રતિબંધ લાદી દીધો છે.

આવી છે અને આરબી લિપજિંગે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફિફાએ જણાવ્યું હતું કે યૂક્રેનના પ્રભાવિત હોકી પ્રત્યે અમારી સહાનુભૂતિ છે અને અમે તેમની સાથે છીએ. ફિફાએ આશા વ્યક્ત કરી હતી કે યૂક્રેનની પરિસ્થિતિમાં જલદીથી સુધારો થશે અને ફૂટબોલની રમત વધુ એક વખત લોકોમાં એકતા તથા શાંતિની દૂત બનશે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિએ વ્લાદિમીર પુતિનને ૨૦૧૧માં આપેલા ઓલિમ્પિક ઓર્ડરને પણ પાછો ખેંચી લીધો છે. આ ઉપરાંત અન્ય રશિયન અધિકારીઓને આપવામાં આવેલા સન્માન પણ પાછા ખેંચવામાં આવ્યા છે.

## કોહલીની 100મી ટેસ્ટ સાથે રોહિતની ટીમ ઇન્ડિયાનો નવા યુગમાં પ્રવેશ થશે

નવીદિલ્હી: ક્રિકેટની પરંપરાગત ફોર્મેટમાં હંમેશાં પ્રાધાન્ય આપનાર વિરાટ કોહલી પોતાની 100મી ટેસ્ટ યાદગાર બનાવવા માગશે ત્યારે બીજી તરફ રોહિત શર્મા શ્રીલંકા સામે શુક્રવારથી પીસીએ સ્ટેડિયમ ખાતે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય વિજય હાંસલ કરીને ભારતના 35મા ટેસ્ટ સુકાની તરીકેની પોતાની નવી ઈનિંગની શાનદાર શરૂઆત કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઊતરશે. કોહલીની 100મી ટેસ્ટ ઉપર તમામની નજર છે અને ભારતનો આ ભૂતપૂર્વ સુકાની પણ 100મી ટેસ્ટમાં સદીના દુકાળનો અંત લાવવાનો પ્રયાસ કરશે. તે છેલ્લા બે વર્ષથી ટ્રિપલ ફિગરનો સ્કોર નોંધાવી શક્યો નથી. શ્રીલંકન બોલર્સ સુરંગા લકમલ, લાહિરુ કુમારા તથા લસિથ એચ્ચુલોનિયા જેવા બોલર્સની હાજરીવાળા બોલિંગ આક્રમણ સામે કોહલીને કોઈ પરેશાની થાય તેમ લાગતું નથી. કોહલી પોતાની ટ્રેડ માર્ક કવર ડ્રાઈવ, ઓન ડ્રાઈવ, ફ્લિક અને પુલ શોટ્સથી સ્ટેડિયમમાં હાજર રહેલા તેના સમર્થકોને રોમાંચિત કરવાના તમામ પ્રયાસ કરશે. મોહાલી ટેસ્ટ મેચ સાથે રોહિતના નેતૃત્વમાં ભારતીય ટીમ નવા યુગનો પણ પ્રારંભ કરશે. રોહિતની મર્યાદિત ઓવર્સની ક્રિકેટમાં ખાસ કરીને આઈપીએલમાં મળેલી સફળતાથી તમામ માહિતગાર છે જ્યાં તે ધોની જેવા ટિગ્ગજ સુકાનીઓને પડકાર ફેંકી રહ્યો છે પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશિપ કરવી અત્યંત અલગ હોય છે.



## સ્ટાર જિમ્નાસ્ટ દીપા કર્માકર IGF દ્વારા સસ્પેન્ડ, ભારતીય ફેડરેશનને ખબર નથી

નવી દિલ્હી ભારતની જિમ્નાસ્ટ દીપા કર્માકરને ઇન્ટરનેશનલ જિમ્નાસ્ટિક્સ ફેડરેશનની વેબસાઇટ ઉપર સસ્પેન્ડ ખેલાડી તરીકે દેખાડવામાં આવી છે. આ ઘટના અંગે ભારતીય જિમ્નાસ્ટિક્સ ફેડરેશન પરેશાન છે અને અધિકારીએ જણાવ્યું હતું કે દીપાને ક્યારેય અને શેના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે તેની અમને કોઈ જાણકારી જ નથી. નોંધનીય છે કે વેબસાઇટ ઉપર ૨૮ વર્ષીય દીપા જ સસ્પેન્ડ દેખાય છે અને બાકીની તમામ ભારતીય જિમ્નાસ્ટ એક્ટિવ દેખાડવામાં આવી રહી છે. દીપાની બાયોગ્રાફીનું જે સેક્શન છે તેમાં પણ સસ્પેન્ડ લખેલું છે. સસ્પેન્ડનો

મતલબ શું થાય છે તેનો ભારતીય ફેડરેશન કોઈ ખુલાસો કરી શક્યું નથી. ૨૦૧૬ની રિયો ઓલિમ્પિકની વોલ્ટ ઈવેન્ટમાં ચોથા ક્રમે રહ્યા બાદ દીપા ચર્ચાનું કેન્દ્ર બની હતી. ૨૦૧૯ બાદ તેણે કોઈ ઈવેન્ટમાં ભાગ લીધો નથી અને તે ઈજાની સમસ્યાનો સામનો કરી રહી છે. તે ૨૦૨૦ની ટોક્યો ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કરી શકી નહોતી. જિમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ સુધીર મિત્તલે જણાવ્યું હતું કે દીપાના સસ્પેન્ડ અંગે અમને કોઈ માહિતી નથી. ઇન્ટરનેશનલ ફેડરેશન સાથે ચર્ચા કર્યા પહેલાં હું કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરી શકતો નથી.

## ઓસી. અને પાક.ની ટેસ્ટ શ્રેણીને બેનો-કાદિર ટ્રોફી નામ અપાયું

રાવલપિંડી ઓસ્ટ્રેલિયન ટીમ ૨૪ વર્ષના ગાળા બાદ પાકિસ્તાનમાં પોતાની ટેસ્ટ શ્રેણી રમશે અને આ ટેસ્ટ શ્રેણીને બેનો-કાદિર ટ્રોફીના નામથી ઓળખવામાં આવશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ બાબતને સમર્થન આપીને જણાવ્યું હતું કે નવી ટ્રોફી બે મહાન લેગ સ્પિનર રિચી બેનો અને અબ્દુલ કાદિરના નામથી ઓળખવામાં આવશે. રિચી બેનોના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાએ ૧૯૫૯માં પાકિસ્તાન સામેની પ્રારંભિક શ્રેણીમાં ૨-૦થી વિજય હાંસલ કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ બેનો જાણીતા ટીવી કોમેન્ટેટર બની ગયા હતા. કાદિરે ઓસ્ટ્રેલિયા સામેની ૧૧ ટેસ્ટમાં ૪૫ વિકેટ હાંસલ કરી હતી. રિચી બેનોની પત્ની ડાફનેએ જણાવ્યું હતું કે અબ્દુલ કાદિર સાથે રિચીના નામની મંજૂરી આપવાનો મને આનંદ થયો છે.

## ટી૨૦ રેન્કિંગમાં શ્રેયસ ઐયરની ૨૭ ક્રમાંકની છલાંગ, કોહલીની પીછેહઠ

દુબઈ શ્રીલંકા સામેના શાનદાર પ્રદર્શનના કારણે ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરે આઈસીસી ટી૨૦ રેન્કિંગમાં ૧૭ ક્રમાંકની છલાંગ લગાવી છે. બીજી તરફ વિરાટ કોહલી ટોપ-૧૦માંથી બહાર થયો છે. શ્રીલંકા સામેની ત્રણ મેચમાં ત્રણ અડધી સદી નોંધાવનાર ઐયર ૧૮મા ક્રમે પહોંચી ગયો છે. પેસ બોલર ભુવનેશ્વર કુમાર પણ ત્રણ ક્રમાંકના ફાયદા સાથે બોલર્સની યાદીમાં ૧૭મા ક્રમે પહોંચ્યો છે. શ્રીલંકાના પાશુમ નિશાન્કાએ ભારત સામેની બીજી મેચમાં ૭૫ રનની ઈનિંગ રમી હતી અને તે

## BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પૂજારા, રહાણે તથા હાર્દિક ડાઉન ગ્રેડ થયા

અમદાવાદ મુંબઈ : અનુભવી સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને ભૂતપૂર્વ ટેસ્ટ સુકાની અજિંક્ય રહાણેને બીસીસીઆઈના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ડાઉન ગ્રેડ કરવામાં આવ્યા છે. કંગાળ ફોર્મના કારણે પૂજારા અને રહાણેને હવે ગ્રેડ-એમાંથી ગ્રેડ-બીમાં સામેલ કરી દેવામાં આવ્યા છે. બીસીસીઆઈની ટોચની સમિતિએ આ યાદીને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સૌથી મોટી પીછેહઠ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની થઈ છે જેને ગ્રેડ-એમાંથી સીધો ગ્રેડ-સીમાં રાખવામાં આવ્યો છે. વિવાદાસ્પદ વિકેટકીપર રિદ્ધિમાન સાહાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે અને તેને બીમાંથી ગ્રેડ-સીમાં સ્થાન અપાયું છે. જોકે તેને એક કરોડ રૂપિયા મળશે. શ્રીલંકા સામે તાજેતરમાં રમાનારી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થયેલા રહાણે અને પૂજારાને વાર્ષિક ત્રણ કરોડ રૂપિયા મળશે.





# રશિયાનો યુક્રેનના ચર્નિહિવ શહેર પર હુમલો, 22ના મોત

રશિયાનો યુક્રેનના ખેરસોન સહિત પાંચથી વધુ શહેરો પર કબજો : કિવ, ખાર્કિવ, બુકા, ઈરપિન સહિત અનેક શહેરો ખંડેર થયા

**મોસ્કો** અંતરે રશિયાનું લશ્કર અને ટેન્કો પહોંચી ગઈ છે. કિવ, ખાર્કિવ, બુકા, ઈરપિન સહિત અનેક શહેરો ખંડેર થઈ ગયાં છે. યુક્રેન પાયમાલ થઈ ગયું છે. ચેર્નીહિવનાં ઓઈલ ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. UN દ્વારા યુક્રેન પર અણુ હુમલાની આશંકા વ્યક્ત કરાઈ છે. જે માનવજાત માટે અનેક જોખમો સર્જી શકે છે.

પુતિને ફાન્સના વડા મેક્રોન સાથે વાતચીતમાં યુક્રેન સાથે યુદ્ધ ચાલુ રાખવાનો અને તેનું નિઃશસ્ત્રીકરણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. યુક્રેનની સંસદે



રશિયન નાગરિકોની મિલકતો જપ્ત કરવાનો કાયદો પસાર કર્યો છે. યુદ્ધ લંબાશે તેવી ધારણા સાથે અમેરિકાએ તેના 12,000થી વધુ સૈનિકો યુરોપમાં મોકલવાનું શરૂ કર્યું છે. અમેરિકાએ બેલારુસ

પુતિને ભારતીય વિદ્યાર્થીઓને તેના 9000થી વધુ સૈનિકો માર્યા સલામત યુક્રેનથી બહાર કાઢવા ગયા છે. 30 વિમાન, 374 ખાતરી આપી હતી. રશિયાએ ઓટોમોબાઈલ્સ ટેકનિક્સ, આ માટે 130 બસો તૈયાર રાખી છે. રશિયા અને યુક્રેન વચ્ચે 42, MLRS, 900 AFV, 31 હેલિકોપ્ટર્સ, 90 આર્ટિલરી બેલારુસની બોર્ડર પર મંત્રણાનો બીજો દોર યોજાયો છે. આ મંત્રણામાં બંને દેશો યુદ્ધવિરામ યુદ્ધ બંધ કરવા અપીલ કરાઈ છે. રશિયાના વિદેશપ્રધાન લાવરોવે કહ્યું છે કે યુક્રેન સાથે મંત્રણા કરીશું પણ હુમલા ચાલુ રહેશે. યુક્રેન દ્વારા માનવતાનાં ધોરણે યુદ્ધ બંધ કરવા અપીલ કરાઈ છે. યુક્રેને દાવો કર્યો છે કે યુદ્ધમાં રશિયાને ભારે નુકસાન થયું છે. તેના 9000થી વધુ સૈનિકો માર્યા ગયા છે. 30 વિમાન, 374 ઓટોમોબાઈલ્સ ટેકનિક્સ, આ માટે 130 બસો તૈયાર રાખી છે. રશિયા અને યુક્રેન વચ્ચે 42, MLRS, 900 AFV, 31 હેલિકોપ્ટર્સ, 90 આર્ટિલરી બેલારુસની બોર્ડર પર મંત્રણાનો બીજો દોર યોજાયો છે. આ મંત્રણામાં બંને દેશો યુદ્ધવિરામ યુદ્ધ બંધ કરવા અપીલ કરાઈ છે. રશિયાના વિદેશપ્રધાન લાવરોવે કહ્યું છે કે યુક્રેન સાથે મંત્રણા કરીશું પણ હુમલા ચાલુ રહેશે. યુક્રેન દ્વારા માનવતાનાં ધોરણે યુદ્ધ બંધ કરવા અપીલ કરાઈ છે. યુક્રેને દાવો કર્યો છે કે યુદ્ધમાં રશિયાને ભારે નુકસાન થયું છે.

## અમે યુક્રેનના નાગરિકોની હત્યા નહીં કરીએ : રશિયન જવાનો

રશિયન જવાનોએ આંસુ સાથે ભાવુક વીડિયો જાહેર કર્યા

**મોસ્કો** : યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ દરમિયાન રશિયન જવાનોએ કેટલાક વીડિયો જાહેર કર્યા છે. જેમાં તેઓ આંખોમાં આંસુ સાથે કહી રહ્યા છે કે અમને યુક્રેનના આમ નાગરિકોની હત્યા કરવાના પણ આદેશ અપાયા છે જે અમારા માટે શક્ય નથી. રશિયન જવાનો કહી રહ્યા છે કે રશિયન સરકાર અમારી પાસે અમાનવીય કામ કરાવી રહી છે. જ્યારે અમને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું હતું ત્યારે એવી સ્પષ્ટતા નહોતી કરવામાં આવી કે અમારે યુક્રેન સાથે યુદ્ધ કરવા જવાનું છે. યુક્રેને એક નિવેદન જાહેર કરીને રશિયન માતાઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના જવાનોના મૃતદેહો અમારી પાસેથી લઈ જાય. રશિયાએ પોતાનો યુદ્ધ પ્લાન બદલી નાખ્યો છે અને હવે

દરેક બાજુથી હુમલાની સ્ટ્રેટેજી અપવાની છે જેને પગલે અનેક જાનહાનીની શક્યતાઓ છે. આ સ્થિતિ વચ્ચે રશિયન જવાનોએ વીડિયો દ્વારા રશિયન સરકારની પોલ ખોલી હતી, આંખોમાં આંસુ સાથે આ જવાનો કહી રહ્યા છે કે અમારે યુક્રેનના નાગરિકોની હત્યા નથી કરવી. અમને તો કહેવામાં પણ નહોતું આવ્યું કે અમારે યુક્રેન સાથે યુદ્ધ માટે જવાનું છે.

## યુક્રેનની જરા પણ ઉશ્કેરણી વગર પુતિને હુમલો કર્યો : જો બાઇડેન

રશિયા અને યુક્રેનના યુદ્ધમાં અમેરિકા સૈન્ય નહીં મોકલે

**વોશિંગ્ટન** : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાડીમીર પુતિને કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વગર યુક્રેન સાથે યુદ્ધ શરૂ કર્યું છે. તેમણે સેનેટના સંયુક્ત સત્રને સંબોધતા જણાવ્યું હતું કે અમેરિકા તેની સામે આવી પહેલા પડકારને પહોંચી વળવા માટે તૈયાર છે. ઈતિહાસમાંથી આપણે પદાર્થપાઠ શીખ્યા છીએ કે જ્યારે પણ સરમુખત્યારે તેમના આક્રમણની કિંમત

ચૂકવતા નથી ત્યારે તેઓ વધારે અંધાધૂંધી સર્જે છે. તેઓ સતત આગળ વધતા રહે છે અને તેના લીધે અમેરિકા અને વિશ્વ સામે ભય સતત વધતો રહે છે. આથી જ યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ પછી શાંતિ અને સ્થિરતા લાવવા નાટો જોડાણ રચવામાં આવ્યું હતું. ૨૮ દેશોના સંગઠનમાં અમેરિકા પણ સભ્ય છે. બાઈડેને પુતિનની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે

પુતિને કોઈપણ ઉશ્કેરણી વગર યુદ્ધ શરૂ કર્યું છે. પુતિને વિચાર્યું હતું કે નાટો વળતો જવાબ નહીં આપે. તેણે વિચાર્યું હતું કે તે અમારામાં ભંગાણ પડાવશે. રશિયાએ યુક્રેન પર હુમલો કરી રીતસરની ખોટી ગણતરી માંડી છે. પુતિને વિચાર્યું છે કે તે યુક્રેન પર ફરી વળશે અને વિશ્વ જોતું રહેશે. તેમણે ક્યારેય કલ્પી ન હોય તેવી તાકાતનો સામનો કરવો પડ્યો છે.

## સાયબર હુમલાને ખાળવા યુક્રેને આઈટી આર્મી રચી

રશિયા પ્રાયોજિત હેકરો દ્વારા મોટા પાયે થતા સાયબર હુમલાનો સામનો કરી રહેલા યુક્રેને વિશિષ્ટ સાયબર પડકારોનો સામનો કરવા આઈટી આર્મી ઊભી કરી છે તેના ટેલીગ્રામ પર લગભગ 2 લાખ વપરાશકારો જેટલી થઈ ગઈ છે. યુક્રેનની આઈટી આર્મી તરીકે ઓળખાતી આ સેના દેશને રશિયન સાયબર હુમલાનો સામનો કરવામાં તેમજ રશિયન સાઈટ્સ અને તેમના એજન્ટોને બંધ કરવામાં સહાયરૂપ થવા ટેકનોલોજી આગેવાનોનો સંપર્ક કરવા ટેલીગ્રામ ચેનલનો ઉપયોગ કરી રહી છે.

## યુદ્ધનો અમેરિકન સોશિયલ મીડિયા પર અપ્રચાર

યુક્રેન સામે રશિયા ભૌગોલિક ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ યુદ્ધ લડી રહ્યું છે. દુનિયાના મોટા ટેક પ્લેટફોર્મ પર રશિયાના સરકારી મિડિયાને તેમના પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવા દેવા માટે દબાણ વધી રહ્યું છે. રશિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ તેના અપ્રચાર માટે કરી રહ્યું છે. અમેરિકાની માલિકીની કોઈ ટેક કંપનીઓએ રશિયાના સરકારી માધ્યમો પર પ્રતિબંધ મુકવી હિમત દાખવી નથી.

## આ 5 દેશો હતા શાંત હતા, તે પણ હવે આવી ગયા એક્શન મોડમાં

**સ્વીડન**: વડાપ્રધાન મેગડાલેના એન્ડરસને સોમવારે યુક્રેનના સૈન્ય મોરચે મદદની જાહેરાત કરી. તેમણે કહ્યું કે સ્વીડન તેના અન્ય દેશોને સૈન્ય મદદ ન આપવાના સિદ્ધાંતને તોડવા જઈ રહ્યું છે. એન્ડરસને કહ્યું કે સ્વીડન યુક્રેનને 5000 એન્ટી ટેન્ક હથિયારો મોકલશે.

**સ્વિટ્ઝર્લેન્ડ**: અત્યાર સુધી તટસ્થ રહેતા સ્વિટ્ઝર્લેન્ડે રશિયા અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પણ ટીકા કરી હતી. રાષ્ટ્રપતિ ઇગ્નાઝિયો કેસિસે કહ્યું કે આ યુદ્ધ યુરોપના હૃદયમાં થઈ રહ્યું છે. તેમણે આ યુદ્ધને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. યુરોપિયન યુનિયન દ્વારા લાદવામાં આવેલા તમામ રશિયન પ્રતિબંધોને પણ લાગુ કરશે.

**ફિનલેન્ડ**: વડાપ્રધાન સના મારિને યુક્રેનને હથિયારો સપ્લાય કરવાની જાહેરાત કરી છે. ફિનલેન્ડ યુક્રેનને

2,500 એસોલ્ટ રાઈફલ્સ, 1.50 લાખ બુલેટ્સ, 1,500 એન્ટી ટેન્ક હથિયારો અને 70,000 ફૂડ પેકેટ્સ સપ્લાય કરશે. પીએમ સના મારિને ફિનલેન્ડને નાટોમાં સામેલ કરવાની વાત કરી છે.

**જાપાન**: જાપાને યુક્રેનને 100 મિલિયન ડોલરની લોન તેમજ 100 મિલિયન ડોલરની માનવતાવાદી સહાયની પણ જાહેરાત કરી છે. આ સાથે જ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્જો આબેએ નાટો જેવા પરમાણુ શેરિંગ કાર્યક્રમની વાત કરી છે. તેના પર વડાપ્રધાન ફુજિમિયો કાશિદાએ કહ્યું કે જાપાન અમેરિકા સાથે પરમાણુ શેરિંગ ડીલ નહીં કરે.

**જર્મની**: જર્મની યુક્રેનને સૈન્ય સહાયની જાહેરાત કરવાની સાથે 500 સ્ટિંગર મિસાઈલ આપશે. જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ડે પણ તેના સંરક્ષણ પાછળ 113 બિલિયન ડોલર ખર્ચ કરવાની જાહેરાત કરી છે.

## ગૂગલે પ્લે સ્ટોર પરથી સ્પુતનિક એપ્સને કરી બ્લોક

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગૂગલે મહત્વનું પગલું ભર્યું છે. ગૂગલે પોતાના પ્લે સ્ટોર પરથી આરટી અને સ્પુતનિક સાથે સંકળાયેલી મોબાઈલ એપ્સ બ્લોક કરી દીધી છે. જોકે આ ચેનલ્સ યુરોપની બહાર જોઈ શકાશે. વિજ્ઞાપન પર પહેલેથી જ પ્રતિબંધ મુકી દેવામાં આવેલો છે. ગૂગલના સ્વામિત્વવાળા યુટ્યુબે મંગળવારે પોતે યુક્રેન પરના રશિયાના હુમલાના જવાબમાં સમગ્ર યુરોપમાં રશિયન સમાચાર RT અને સ્પુતનિકને પણ બંધ કરી દીધું છે તેવી માહિતી આપી હતી.

## રશિયન સેનાના મેજર જનરલ રેન્કના અધિકારીનું મોત થયું

રશિયન સેના યુક્રેનમાં ભીષણ યુદ્ધ લડી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં રશિયન મિસાઈલોએ કિવ અને ખાર્કિવને નષ્ટ કરી નાખ્યું છે. યુક્રેનનું ખેરસોન શહેર હવે રશિયાના કબજા હેઠળ છે. પરંતુ આ લડાઈમાં યુક્રેનની સાથે રશિયાને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. સમાચાર આવી રહ્યા છે કે આ યુદ્ધમાં રશિયન મેજર જનરલ રેન્કના અધિકારી આંદ્રે સુપોવેલ્સ્કીનું મોત થયું છે.

## યુક્રેન જંગને પગલે બંને મહાસત્તાઓ નબળી પડતાં ચીન મજબૂત બનશે

નવી દિલ્હી : યુક્રેન પર આક્રમણ શરૂ કર્યું તે સાથે યુરોપમાં શીતયુદ્ધના વાદળો ઘેરાઈ ચૂક્યા છે. અમેરિકાની આગેવાની હેઠળ નાટો અને તેના સાથી દેશોએ મોસ્કો સામે આર્થિક પ્રતિબંધો લાદવાની શરૂઆત કરી છે જેનો આડકતરો લાભ ચીનને થશે. યુએસ, રશિયા અને યુરોપિયન યુનિયનને આર્થિક નિયંત્રણોને કારણે સહેલું પડશે પણ ચીન આ મામલે તટસ્થ હોવાથી તેને કોઈ આર્થિક નુકશાન થવાની સંભાવના નથી. આમ હવે યુએસની આગેવાની હેઠળ નાટો યુરોપમાં રશિયાને ભીંસમાં લેવા મશગૂલ હશે ત્યારે ચીનને પેસિફિકમાં તેની મનમાની કરવાની તક મળી જશે. પરિણામે દુનિયાની ત્રણ મોટી આર્થિક તાકાતોને યુદ્ધની અસર થશે પણ ચીન તેમાંથી બાકાત રહેવાને કારણે ભવિષ્યમાં તેની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

## રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ધરપકડ કરનારને ૭.૫ કરોડનું ઈનામ અપાશે

રશિયા દ્વારા યુક્રેન પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. યુક્રેન પર આક્રમણ કરવાના નિર્ણયના કારણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશ્વમાં એકલા પડી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે મોસ્કોના પ્રખ્યાત બિઝનેસમેન એલેક્સ કોનાનીખિનએ પુતિનની ધરપકડ કરનારાને ૭.૫ કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. કોનાનીખિનના કહેવા પ્રમાણે જો કોઈ વ્યક્તિ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધરપકડ કરશે તો પોતે તેને ૭.૫ કરોડ રૂપિયાનું ઈનામ આપશે. પોસ્ટની સાથે જ વ્લાદિમીર પુતિનનો ફોટો પણ લગાવ્યો છે અને લખ્યું છે કે, જે પણ અધિકારી પોતાની બંધારણીય ફરજનું પાલન કરશે તથા પુતિનની એક યુદ્ધ અપરાધી તરીકે રશિયન અને આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત ધરપકડ કરશે તેને હું ૧૦ લાખ ડોલર આપીશ.'



# ગુજરાતી સિનિયર્સ સમાજ ઓફ મિસીસાગાની મીટીંગ યોજાઈ

## મિસીસાગા

ગુજરાતી સિનિયર્સ સમાજ ઓફ મિસીસાગા દ્વારા ગત તારીખ 27-2-2022ને રવિવારે સંસ્થાની એક મીટીંગ સગન બેન્કવેટ હોલ ખાતે રાખવામાં આવી હતી. સ્ટેજ ઉપર રસીલાબેન ગાજરીયા તથા ભારતીબેન ગાંધીએ કેટલાક સુચનો કર્યા બાદ તમામ હાજર સભ્યોને બીંગો ગેમ રમાડવામાં આવી હતી. સ્ટેજ ઉપર રસીલાબેન તથા ભારતીબેનને પ્રેમલગ્ન અને અરેન્જ

મેરેજ અંગે નાની એવી સ્કિપ્ટ તૈયાર કરી તેની રજૂઆત કરી હતી. તેમણે પોતાના જીવન પ્રસંગો બધાને કહી ઘણો જ આનંદ કરાવ્યો હતો. બાદમાં પ્રમખુ કલાબેને બધાને આવકાર આપ્યો અને પ્રથમ ઉપપ્રમખુ પ્રવીણભાઈ મહેતા તથા મધુરુબેનનો આભાર માન્યો હતો. ત્યારબાદ લલીતભાઈ ઠાકર તથા શીલાબેન તથા શિલપેશભાઈ પરીખ તથા પનૂમબેન પરીખનું સ્વાગત કરાયું હતું. તે બાદ 14 વર્ષથી સંસ્થાની



મનોરંજન પ્રવૃત્તિ કરતા નિલેષભાઈ પટેલ તથા પરમેશ્વરે બપ્પી લહેરી

તથા લતા મંગેશકરના ગીતોથી બધા સભ્યોએ ગીત ગાતા રમઝટ શરૂઆત કરી હતી અને ધીરે ધીરે

જામી હતી.

## રોમાનિયામાં મેયર અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે ચડભડ

### નવી દિલ્હી

યુકેનમાં ફસાયેલા છાત્રોને મળવા માટે અને તેમને પાછા લાવવા માટે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા ગયા છે. કારણકે યુકેનથી પાછા ફરેલા ભારતીય વિદ્યાર્થીઓ રોમાનિયા પહોંચ્યા છે અને અલગ અલગ જગ્યાએ તેમને ઉતારો અપાયો છે. દરમિયાન સિંધિયાને એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોમાનિયાના એક શહેરના મેયર અને સિંધિયા વચ્ચે તડાફઠી થઈ હોવાનું

દેખાય છે. સોશિયલ મીડિયા પર ફરી રહેલા વિડિયોમાં દેખાય છે કે, રોમાનિયાના એક કેમ્પમાં પહોંચેલા સિંધિયા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા કરાયેલી વ્યવસ્થા અંગે જાણકારી આપી રહ્યા હતા ત્યારે મેયરે તેમને ટોક્યા હતા. સાથે સાથે તેમણે સિંધિયાને પૂછ્યું હતું કે, તમે અહીંથી ક્યારે જઈ રહ્યા છો...અમે વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરી રહ્યા છો. એ પછી સિંધિયા કહે છે કે, મને બધી ખબર પપડી રહી છે અને તેઓ મેયરથી અલગ થઈ જાય છે. એ પછી સિંધિયા વિદ્યાર્થીઓની

પાસે જઈને કહે છે કે, અમારો પ્લાન છે કે, અમે દરેક કેમ્પમાંથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને કાઢીને લઈ જઈશું અને આ માટે રોમાનિયા સરકારનો ધન્યવાદ. કોંગ્રેસના નેતા સલમાન નિઝામીએ આ વિડિયોને લઈને કહ્યું છે કે, જુમલા અને વાયદા ભારતમાં કામ કરે છે પણ વિદેશની ધરતી પર નહીં. રોમાનિયાના મેયરે સિંધિયાને પાઠ ભણાવીને કહ્યું હતું કે, તમે અહીંથી ક્યારે જાવ છો.. કારણકે વિદ્યાર્થીઓને રહેવાની જગ્યા અને ભોજન અમે આપી રહ્યા છે.

## શિવસેનાના કોર્પોરેટર-કોન્ટ્રાક્ટર પાસે 130 કરોડની બેનામી સંપત્તિ

### મુંબઈ

ઈન્કમ ટેક્સ વિભાગે ગયા અઠવાડિયે શિવસેનાના એક નગરસેવક અને પાલિકાના અમુક કોન્ટ્રાક્ટરો પર છાપાઓ માર્યા હતા. આ કાર્યવાહીમાં 130 કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિનો પર્દાફાશ થયો છે જેમાં બેનામી માલમત્તા, હાલના વહેવારો આદીનો સમાવેશ થાય છે. ઈન્કમ ટેક્સ વિભાગે 2૫ ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં વિવિધ ૩૫ સ્થળોએ છાપાઓ માર્યા હતા. આ સંદર્ભે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) અનુસાર પ્રાથમિક તપાસ એવું સૂચવે છે કે આ

કોન્ટ્રાક્ટરોએ ગેરરીતિ આચરી ૨૦૦ કરોડ રૂપિયાની આવકની ઉચાપત કરી છે. આ સંદર્ભે સીબીડીટીના એક પત્રક અનુસાર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યથવંત જાધવ તેમના અમુક સહયોગી અને પાલિકાના અમુક કોન્ટ્રાક્ટરોના વિવિધ સ્થળો પર છાપા મારીની કાર્યવાહી કરવામાં આવી હતી. આઈટી વિભાગે તેમની આ કાર્યવાહી દરમિયાન ગેરરીતિ સૂચવતા અનેક કાગળીયાઓ, ડિજિટલ પુરાવાઓ જપ્ત કર્યા હતા. જપ્ત કરેલ આ પુરાવાઓ કોન્ટ્રાક્ટર અને જે- તે વ્યક્તિના ઘનિષ્ઠ સંબંધ હોવાનું પુરવાર કરે છે.

## યુએસ સેનેટમાં એચ-વનબી વિસાના દૂરુપયોગને રોકવા ખરડા રજૂ કરાયો

### નવી દિલ્હી

વોશિંગ્ટન: એચ-વનબી વિસા અને એલ-વન વિસા કાર્યક્રમનો સર્વગ્રાહી ઉપયોગ રોકવા પ્રભાવશાળી સેનેટરોએ યુએસ સેનેટમાં બિલ રજૂ કર્યું છે. તેઓની દલીલ છે કે તેનાથી અમેરિકન કામદારોના હિતોનું રક્ષણ થશે અને લોકપ્રિય વિજા કાર્યક્રમનો દૂરુપયોગ કરનારી ક્વોલિફાઈડ અમેરિકનોને હાઈ-સ્કીલ્ડ જોબ્સથી વંચિત રાખનારી વિદેશી આઉટસોર્સિંગ કંપનીઓ પર પર અંકુશ લાદી શકાશે. એચ-વનબી વિસા નોન-ઈમિગ્રન્ટ વીઝા છે. તેના હેઠળ અમેરિકન કંપનીઓને ખાસ પ્રકારના જોબ્સ માટે કે વિશેષ ટેકનિકલ નિપુણતા ધરાવતા વિદેશી કર્મચારીઓને લાવવાની છૂટ મળે છે. ટેકનોલોજી કંપનીઓ દર વર્ષે આ માટે ભારત અને ચીનમાંથી હજારો વિદેશી કર્મચારીઓને હાથે કરે છે. ભારતીયો સહિતના વિદેશી પ્રોફેશનલ્સમાં જ એચ-વન વિઝાનો પૂરેપૂરો ક્વોટા ઉપયોગમાં લેવાઈ જાય છે. એલ-વન વિઝા તે નોન-ઈમિગ્રન્ટ વિઝા છે.

## યુપીમાં છઠ્ઠા તબક્કામાં 55 ટકા મતદાન

### લખનઉ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા હેઠળ ગુરુવારે 55 ટકા મતદાન થયું હતું. દસ જિલ્લાની 57 બેઠકો માટે ગુરુવારે થયેલા મતદાનમાં કુલ 676 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું હતું. જે અગ્રણી નેતાઓનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થયું છે તેમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ કોંગ્રેસ પ્રમુખ અજય કુમારનો સમાવેશ થાય છે. યોગી આદિત્યનાથ ગોરખપુર શહેર અને અજયકુમાર તમકુહી રાજ બેઠક પરથી ઉભા રહ્યાં છે. મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો હતો. છઠ્ઠા તબક્કામાં કુલ મતદારોની સંખ્યા 2.15 કરોડ હતી. હવે સાતમા અને અંતિમ તબક્કા હેઠળ 54 બેઠકો પર સાત માર્ચના રોજ મતદાન થશે. ત્યારબાદ 10 માર્ચના રોજ ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એમ કુલ પાંચ રાજ્યોની તમામ બેઠકોની મતગણતરી કરવામાં આવશે. આજે ઉત્તર પ્રદેશમાં જે 57 બેઠકો પર મતદાન થયું છે તે પૈકી ભાજપે 2017માં 46 બેઠક જીતી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યમાં મતદાન શાંતિથી પૂર્ણ થયું હતું. આજે સવારે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, બેઝિક શિક્ષણ પ્રધાન સતિષ દિવેદી, વિરોધ પક્ષના નેતા રામ ગોવિંદ ચૌધરી, સુહેલદેવ



ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભાર, પ્રધાન ઉપેન્દ્ર તિવારી અને પૂર્વ પ્રધાન નારદ રાવ સહિતના અગ્રણી નેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીએ યોગી આદિત્યનાથ સામે પૂર્વ ભાજપ નેતા સ્વર્ગસૃષ્ટ ઉપેન્દ્ર દત્ત શુક્લાના પત્નીને ઉભા રાખ્યા છે.

## રશિયા-યુકેન યુદ્ધ, તબાહીનું તાંડવ...

### અનુસંધાન પેજ નં.4થી ચાલુ

આ આગ ક્યારે બૂઝાશે એની કોઈને હજી ખબર નથી. પરંતુ રશિયાનું લશ્કર યુકેનમાં જ રહેશે એ નક્કી છે. યુકેનની પ્રજાનો આ યુદ્ધમાં મિજાજ જોતાં આ તાબેદારી સહન કરે એવી શક્યતા ઓછી છે. તેથી આંતરિક વિગ્રહ ચાલુ રહેશે એ નક્કી છે. સત્તા તથા વર્ચસ્વની લડાઈમાં સામસામા હુમલા થતા રહેશે તો લોકો મરતાં રહેશે તે પણ નિશ્ચિત છે. યુકેને રશિયા સામેના યુદ્ધમાં ભારતની મદદ માંગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે વાત કરીને યુદ્ધ રોકવા કહે એવી વિનંતી યુકેનના ભારત ખાતેના રાજદૂતે કરી હતી. પોતાના નાગરિકોને બચાવવા માટે મોદી દરમિયાનગીરી કરે એવી આ વિનંતીને માન આપીને મોદીએ પુતિન સાથે વાત પણ કરી. પોતાના નાગરિકોના જીવ બચાવવા ભારતને આજીજી કરતું યુકેન ભારતીયોને બચાવવામાં જરાય રસ બતાવતું નથી.

સોશિયલ મીડિયા પર યુકેનમાં ફસાયેલા સંખ્યાબંધ વિદ્યાર્થીઓના વીડિયો વાયરલ થયા છે. આ વીડિયોમાં વિદ્યાર્થીઓ પોતાની વેદના ઠાલવી રહ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ માટે ખાવા-પીવાની કોઈ સગવડ કરાઈ નથી એ તો આઘાતજનક છે. યુદ્ધનું કેન્દ્ર બનેલા ખારકીવમાંથી બહાર નિકળવા માટેની ટ્રેનોમાં પણ ચડવા નથી દેવાતા. કોઈ ભારતીય ગમે તેમ કરીને ચડી પણ જાય તો તેમને ધક્કા મારીને નીચે ઉતારી મૂકાય છે. આ વિદ્યાર્થીઓ પોતે જીવતા વતન પાછા ફરીશું કે નહીં એ ફફડાટમાં જ દિવસો કાઢી રહ્યા છે. યુકેનના વલણ સામે રશિયા ભારતીયોને મદદ કરી રહ્યું છે. ભારતીયો માત્ર પોતાનો ધ્વજ લગાવીને નીકળશે તો પણ તેમને કંઈ નહીં કરાય અને કીવમાં ભારતીય દૂતાવાસ સુધી પહોંચાડી દેવાશે એવી ખાતરી રશિયાએ આપી છે.

## યુદ્ધ : આધુનિક જગતની સૌથી...

### અનુસંધાન પેજ નં.10થી ચાલુ

અને એ રીતે જ તમામ વૈજ્ઞાનિક લેબોરેટરીઝ અને સરકારી કેન્દ્રો પણ ધ્વસ્ત થશે. સમૂહમાં રહેતી પ્રજા વેરવિખેર થશે, અને ફરી પાછા આપણે પાપાણ યુગમાં ધકેલાઈ જઈશું. ટૂંકમાં રસેલે પરમાણુ બોમ્બથી શું નુકસાન થઈ શકે છે તેનું ચિત્ર આ લેખમાં બતાવ્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજ સૈનિક તરીકે હિસ્સો રહેલા હેન્રી પેચ કહે છે કે, “યુદ્ધ એ સામૂહિક હત્યા છે, તે સિવાય બીજું કશું નહીં.” આ રીતે યુદ્ધની નિરર્થકતા અનેક સૈનિકોએ પણ અનુભવી છે. 2004માં એક કાર્યક્રમમાં હેન્રી પેચે કહ્યું હતું કે, “યુદ્ધનો અંત આવ્યો ત્યારે મને ખ્યાલ ન આવ્યો કે અમે વિજયી થયા. તે પછી ધીમે ધીમે સ્થિતિ સમજી એટલે એટલે હું નિરાંતમાં હતો. કારણ કે તે પછી મારે પાછું યુદ્ધભૂમિ પર જવાનું ન હતું. જે તે સમયે પાશ્ચાત્યોમાં ભીષણ યુદ્ધ થતા હજારો યુવાનોને

મેં મોતને ભેટલા જોયા. આ બધાથી હું ખૂબ ગુસ્સે થયો. હું ત્યારે જર્મનીના એક સૈનિક સાથે હાથ મીલાવવા ગયો. આ મારી લાગણી છે. અત્યારે તે જર્મન સૈનિક ચાર્લ્સ કુએન્ડઝ 107 વર્ષના છે અને આજે યુદ્ધ વિશે વિચારીએ ત્યારે યુદ્ધનો અર્થ અમે જાણીએ છીએ. મારા મતે યુદ્ધ એવી ઘટનાનું નામ છે જેમાં હત્યાઓને કોઈપણ રીતે સાચી અને યોગ્ય ઠેરવવામાં આવે છે. કોઈપણ યુદ્ધમાં સૈનિકને યુદ્ધભૂમિમાં લડવા માટે મોકલાય અને એવા વ્યક્તિને મારવાનું કહેવાય કે જેને તે ક્યારેય મળ્યો નથી, અને તે તેને જાણતો નથી, તેની ભાષા જાણતો નથી. આ બધા જ પોતાનું જીવન હોમી દે છે અને પછી યુદ્ધનો અંત ટેબલ પર આવે છે. જો છેલ્લે સમાધાન માટે ટેબલ ઉપર જ બેસવાનું હોય તો પછી યુદ્ધને નામે હજારો કે લાખો માનવજીવિતોનો અંત શા માટે લવાય છે.





# HONEST - DEDICATED - TEAMWORK

Don't Let Confusion Cast A Shadow over Buying Your Dream Home.



## CENTURY 21

Innovative Pinnacle Real Estate Group

We Look forward to providing you with an unusually High Level of Service and Commitment giving you a New definition of results in the Real Estate Industry. After all it is your Satisfaction that defines our Success!!!

- Free Staging
- Free Professional Photography & virtual tour
- Free Marketing, Flyers, Newspapers, Media Advertising
- Free Comparative Market Analysis
- Team of Professional for same price as hiring a single realtor
- Over 15 years of combined experience



- No Pressure
- No Obligation
- Just Answers to Your Questions... Its that Simple!

**COMING SOON!**  
20 Tubman Ave #1402  
Dundas & Parliment



West Facing 1+1 At Wyatt Condos! Modern & Sleek Interior. Amazing Open Concept Layout. No Wasted Space. Den Can Be Jr 2nd Bdrm W Closet Space. Lots Of Natural Light. Stylish Euro Kitchen. Lrg Balcony. Unobstructed West View Overlooking Dwtm, Cn Tower & Sports Field. Convenient Dwtm Location, Steps To The Aquatic Centre And Outdoor Athletic Grounds, Tic At Your Door Step. Close To Uoft, Ryerson, Eatons Centre & Distillery District. A Must See!

**Just Purchased**  
77 Progress ave.  
Belleville



Purchased this Oversize bungalow for only \$601K with a deep lot for a client who was looking for an investment property with good income potential. It's also perfect to build your dream home or severance and build 2 homes.

**JUST LISTED**  
9 Blakemanor Blvd  
Bellamy Road /Nelson Street



3 Bedroom Bungalow Home Located In And Excellent Location. Fully Renovated home. Separate Side Entrance To The Basement. Additional Kitchen, Living, 2 Bedroom And Washroom Located In The Basement. Open Concept Main Floor Features A Large Quartz Island And Kitchen Countertop. Live and rent for extra monthly income.

Call or DM for further details on this both amazing projects.

You have Nothing to Loose... Call us for a Free Consultation on How to Get Started.

Use The Advantage of a Team, Because... Teamwork Makes Your Dreams Work!

## Shamim & Amin Kharodia

Broker of Record / Sales Representative

teamkharodia@gmail.com

300-2855 Markham Rd Toronto ON M1X 0C3

D: (647) 501-6786 | D: (647) 308-2941

F: (416) 298-8303 | P: (647) 666-8676




Grand Centurion Office

Each office owned and Operated. This is not intended to solicit buyers/sellers currently under contract with any brokerage.



  
**Chapel  
Ridge**  
FUNERAL HOME  
& CREMATION CENTRE

**416.993.0826**  
**24/7 # 905.305.8508**



तमारी सगवड माटे अमे बे इयुनरल सेन्टर ओडर करीये छीये. मारभम अने मिसिसागा. संपूर्ण हिन्दू तथा जैन विधिनी सगवडता. (St. John's Dixie, 737 Dundas St. E., Mississauga, ON L4Y 2B5)

**इयुनरल सर्विस, बेजिक कास्केट, डिमेशन अने टेक्स बधां साथे टोटल इक्त \$4270**

वधु माहिती माटे झोन करो. अमारो प्रोडेशनल स्टाइ तमारी लाचामां तमने माहिती आपशे. प्रिपेड इयुनरल अने ट्रावेल ईन्सुरन्स

- तमारा डोलर इयुनरल होममां जमा नहि थाय. परंतु सरकारे नीमेली ट्रस्ट कंपनी पासे रहेशे.
- अेक वधत प्लान भरीद्या पछी तमे के तमारा डेमिलीअे कडीपण वधु पैसा नहि आपवा पडे.
- ट्रावेल ईन्सुरन्स - इक्त \$595 अेक वधत आपी जिंदगी भर तमे क्वांय पण निश्चित ट्रावेल करी शकशो. \*

\* This is not a general insurance. Applies only in case of a death away from home.

8911 Woodbine Avenue, Markham, Ontario L3R 5G1

www.chapelridgefh.com • info@chapelridgefh.com